

શેઠ માણોકલાલ જેઠામાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.



માહિતી (મેળવવાના) અધિકાર

અધિનિયમ - ૨૦૦૫

અધિનિયમની કલમ-૪(ખ) હેઠળની વિગતવાર

માહિતી આપતી પુસ્તકા/માર્ગદર્શિકા

પ્રસિદ્ધ કર્યા તારીખ : ૩૦-૬-૨૦૧૬

માહિતીનો અધિકાર અધિનિયમ - ૨૦૦૫

(સને ૨૦૦૫નો અધિનિયમ ક્રમાંક ૨૨)

-: પ્રસ્તાવના :-

લોકશાહીના આદર્શની સર્વોપરિતા જાળવવા અને જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય અને તેના નિયંત્રણ હેઠળના પુસ્તકાલયોની માહિતી નાગરિકો સરળતાથી મેળવી શકે ઉપરાંત માહિતી અધિકારના વ્યવહારું શાસનની રચના કરવાના હેતુથી જાહેર વ્યવહારમાં માહિતીની જાહેરાત કરી કાર્યક્રમ સંચાલનની નાગરિકોને જાણકારી આપવાનો અભિગમ છે.

સાર્વજનિક પુસ્તકાલયોમાં પ્રજાના સંસ્કારો અને સંસ્કૃતિનો વારસો સચ્ચાયેલો પડ્યો છે. પુસ્તકાલય પ્રવૃત્તિમાં મુખ્યત્વે માહિતી, શિક્ષણ, સાહિત્ય અને જ્ઞાન સાથે સીધો સંબંધ છે અને વાચન સામગ્રીનો સંગ્રહ, જાળવણી, પ્રચાર અને પ્રસાર કરવાની કામગીરી પુસ્તકાલય સાથે સંકળાયેલી છે. પુસ્તકાલય એ “જ્ઞાનની પરબ્ર” કે “જ્ઞાનમંદિર” જેવા ગૌરવવંતા પદને શોભાવે છે. પુસ્તકાલય, પુસ્તક અને વાચનના કારણે માનવી શિક્ષિત અને જાગૃત બને છે. પરિણામે કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થયો છે. સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં પુસ્તકાલયોનો ફાળો ઘણો મોટો રહ્યો છે. માનવીના ચારિત્ર્ય ઘડતરનું કામ પુસ્તકો કરતા હોય છે.

માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કલમ ૪ (૧) (ભ) મુજબ શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયની માહિતી પ્રસિદ્ધ કરવા કુલ ૧૭ નિયમ સંગ્રહો તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા છે.

(લતાબેન જે. પંડ્યા)

જાહેર માહિતી અધિકારી
જુનિ. સહાયક ગ્રંથપાલ

(ડૉ. બિપીનભાઈ જે. મોદી)

ગ્રંથપાલ,
શેઠ મા.જે. પુસ્તકાલય,
અમદાવાદ.
(એપેલેટ ઓથોરીટી)

અનુક્રમણિકા

ક્રમ	પ્રકરણ નં.	પ્રકરણની વિગત	પાના નં.
૧.	૧	વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો	
૨.	૨, ૬	અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક	
૩.	૩	દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહીત નિષ્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ	
૪.	૪, ૫	કાર્યો બજાવવા માટે પોતે નક્કી કરેલા ધોરણો કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને રેકૉર્ડ	
૫.	૭	નીતિ અથવા તેના અમલીકરણના ઘડતરના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના નામ દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન કોઈ ગોઠવણીની વિગતો	
૬.	૮	વ્યવસ્થા તંત્રના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો માટે ખૂલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ	
૭.	૮/૧૦	અધિકારી અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વળતર	
૮.	૧૧	યોજનાઓ, સૂચિતખર્ય અને વહેંચણીપરના અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર	
૯.	૧૨	ફાળવેલ રકમો અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહીત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત	
૧૦.	૧૩	આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાઓની વિગતો	
૧૧.	૧૪	ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો	
૧૨.	૧૫	જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા વાચનાલયના કામકાજના કલાકો સહીતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો	
૧૩.	૧૬	જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદા અને બીજી વિગતો	
૧૪.	૧૭	ધરાવવામાં આવે તેવી બીજી માહિતી	

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોઝર નં. ૧
પુસ્તકાલયના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫

પ્રો-એક્ટિવ ડિસ્કલોજર નં. ૧

પુસ્તકાલયના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો

૧:૧ પુસ્તકાલયનો હેતુ/મહત્વ :

‘જ્ઞાનના જેવું પવિત્ર આ જગતમાં અન્ય કોઈ નથી’ આ કથનને ચરિતાર્થ કરતા મા.જે. પુસ્તકાલયના આ જ્ઞાનમંદિર (ટેમ્પલ ઓફ નોલેજ)નો જ્ઞાનદીપક સતત પ્રકાશિત રહ્યો છે. પૂર્વ દિશામાં સવારના ઉગતા સૂરજના સોનેરી કિરણો તેના પ્રવેશ દ્વારે જ્ઞાનના સાથ્યા પૂરી પુસ્તક, વાચન અને પુસ્તકાલય સેવાઓને અજવાળવાનું કાર્ય કરે છે. અમદાવાદ મહાનગરના નગરજનોને પાયાની જરૂરિયાતો પૂરી પાડતું મ્યુ. કોર્પો. અભાલ વૃદ્ધ સૌ કોઈને પુસ્તક અને વાચન સેવાઓ પૂરી પાડી સંસ્કાર સભર સમાજ નવરચના કરવાનું અને ચારિત્ર ઘડતરનું કાર્ય કરે છે. આ પુસ્તકાલય ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન અને સંવર્ધનનું કાર્ય કરે છે. માત્ર વાચકને કેન્દ્ર બિંદુમાં રાખી રૂચિને અનુરૂપ વાચન સામગ્રી પૂરી પાડવા સમાજમાં વાચન ટેવ ઊભી કરી તેને પોષવાનું કાર્ય પુસ્તકાલય કરે છે. પરિણામે આજે આ પુસ્તકાલય સાચા અર્થમાં સમાજનું વિશ્વ વિદ્યાલય બન્યું છે. આ દિશામાં પુસ્તકાલય થકી સર્વોત્તમ જીવન જીવવાનો માર્ગ કે માર્ગદર્શનના પાઠો ભણાવવા ગ્રંથમાં સંકલિત થયેલી ઉત્તમ સુવિચારોના માધ્યમથી માનવી ચિંતનશીલ બન્યો છે અને તેથી જ દરેક દિશાઅથી શુભ અને સુંદર વિચારો ગ્રામ થાય છે. આ રીતે પરિવર્તનની પળ પણ સાર્થક બને છે. ઉપરોક્ત સદ્ગુણો અને સત્કાર્યોની સ્થાપના સામૂહિક ધોરણે થવાથી સમાજ-સેવાનું મહત્વનું કાર્ય થઈ રહ્યું છે. મા.જે.ના પાયામાં પૂજ્ય બાપુએ રાખેલા સત્ય, અહિસા, સાદગી અને સદ્ભાવનાના પથ્થરો પડ્યા છે અને ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર પટેલના શુભ હસ્તે આ પુસ્તકાલય સેવાઓ ખૂલ્લી મૂકવામાં આવી છે ત્યારે લોક કલ્યાણ, દઢ સંકલ્પ, પ્રમાણિક નીતિમત્તા અને સંનિષ્ઠ, પારદર્શક, લોક ભોગ્ય વહીવટના ગુણો મા.જે.ની સેવાના અણુએ આણુમાં પ્રસરી રહી છે.

૧:૨ પુસ્તકાલયના કાર્યો-ફરજો :

ગુજરાત રાજ્યના ગૌરવ અને ગરિમા સમું, ભારતના સાર્વજનિક પુસ્તકાલયોની શ્રેષ્ઠીમાં પ્રથમ હરોળમાં અગ્ર સ્થાને આવતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પુસ્તકાલય પ્રવૃત્તિઓમાં શિરોમણી સમું આ પુસ્તકાલય સને ૧૯૮૮ થી સતત વિકસનું રહ્યું છે. સમૃદ્ધ વાચન સામગ્રી, વિવિધ શાખા-પ્રશાખાઓમાં વિસ્તરેલા જ્ઞાનને વિવિધ વિષયો અને ભાષાના માધ્યમથી નજીકીય પુસ્તક સ્વરૂપે જોવાની, માણવાની, પામવાની સુંદર સુવિધા, વ્યક્તિગત સંપર્ક સાથેની સધન અનુલયસેવા, ત્વરિત માહિતીસેવા, અભાલ-વૃદ્ધ સૌને અનુરૂપ ગ્રંથસેવા, વાચનસેવાઓ નાના ભૂલકા માટે રમકડાગૃહથી શરૂ કરીને સીનીયર સીટીઝન સુધીના સામાન્ય વાચકો, જિશ્વાસુઅઓ, વિદ્યાર્થીઓ, માહિતીવિદો, શિક્ષણ શાસ્ત્રીઓ, સંશોધકોને જરૂરિયાત અનુસારની વાચનરૂચિને સતત પોષતી અને પ્રોત્સાહિત કરતી વિપૂલ વૈવિધ્યસભર વાચન સામગ્રી વિવિધરંગી વિસ્તરણ, સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિજ્ઞાનું માધ્યમો દ્વારા માહિતી સ્ત્રોતનો રસાસ્વાદ માણવાની એકમાત્ર સામાજિક અને સાંસ્કૃતિક સેવાકીય સંસ્થા એટલે આપણું

મા.જે. પુસ્તકાલય. આ પુસ્તકાલયની સેવાનું હાઈ ઉત્તમ, અધતન અને શાસ્ત્રીય પુસ્તકાલયસેવાઓનું આબેહૂબ અવતરણ તેના કાર્યક્ષેત્રના પ્રત્યેક અંગમાં વિલસી રહ્યું છે.

એકવીસમી સદી માહિતી યુગના નવા કિરણો સાથે આવી છે. કોમ્પ્યુટર, ઈન્ફર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુનિકેશન ટેકનોલોજી, પ્રિન્ટીંગ ટેકનોલોજી, સંચાર માધ્યમ અને વિજાણું માધ્યમના ઉપકરણોએ વૈશ્વિક સ્તરે નવિનીકરણો સ્થાપિત કરી જ્લોબલાઈઝેશનના નવા અભિગમો અપનાવ્યા છે. સમય, સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ પરિવર્તન સાધવાની આ દિશામાં પણ વિકાસ સાધવાના પ્રયત્નો હાથ ધરાયા છે. ઈન્ટરનેટ, ડિજીટલ લાયબ્રેરી, પ્રજ્ઞાચ્યક્ષુઓ માટેનો ઓડિયો વિભાગ, મા.જે. પુસ્તકાલયમાં રેફરન્સ એન્ડ રીસર્ચ સેન્ટર અને જ્ઞાન વિહાર વિદ્યાર્થી વાચનાલયની સેવાઓનો લાભ વાચકો લઈ રહ્યા છે. ભવિષ્યમાં કોમ્પ્યુટર એપ્લિકેશન, ડિજિટાઈઝેશન, લાયબ્રેરી ઓટોમેશન, વૈશ્વિક જ્લોબલાઈઝેશન અને ઓનલાઈન સેવાઓ, અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પુસ્તકાલયો - વાચનાલયો જેવી અનેક સેવાઓના લાભ આપવા પ્રયત્નો હાથ ધરાયા છે.

૧:૩ સંક્ષિમ ઈતિહાસ :

સત્યાગ્રહ આશ્રમથી શરૂ કરેલી ઐતિહાસિક દાંડીકુચના પ્રારંભે મહાત્મા ગાંધીએ આશ્રમના પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર પ્રદર્શિત કર્યો. જે ૨૭મી જુલાઈ ૧૯૩૭ના રોજ ફી પ્રેસ જર્નલમાં પ્રગટ થતાં બીજા જ દિવસે રસિકલાલ માણેકલાલ તરફથી રૂ. ૫૫,૦૦૦ ની સખાવત ગ્રંથાલય ભવનના નિર્માણ માટે મળતાં તેઓ શ્રી નામથી હૂલામણું આ પુસ્તકાલય તેના પ્રારંભથી જ ભવ્ય ભૂતકાળ સાથે ઉજ્જવળ વર્તમાનના સુર્વણાંકિત પૃષ્ઠો થકી વધુ દૈદિયમાન અને સુવાસિત બન્યું છે. પૂજ્ય બાપુજીના કરકમલોના સ્પર્શે ખાતમુહૂર્ત પાભ્યા બાદ પાંચેક વર્ષમાં જ્યપુરી સ્થાપત્ય ધરાવતું ભવન તૈયાર થતાં ૧૫મી એપ્રિલ ૧૯૩૮ના રોજ આ પુસ્તકાલય સરદાર વલ્લભભાઈના શુભહસ્તે જાહેરજનતાના લાભાર્થે ખુલ્લુ મુકાયું. શેઠ શ્રી રસિકલાલ તરફથી કમશઃ વિશેષ અનુદાનો મળતાં ‘સુભદ્રાબેન માણેકલાલ વાચનાલય’ અને ‘બાળકિશોર વિભાગ’ પણ અસ્તિત્વમાં આવ્યો. ૧૪મી જૂન ૧૯૪૫ના રોજ તે વખતના મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાનશ્રી મોરારજી દેસાઈના હસ્તે “બાળકિશોર વિભાગ” ખુલ્લો મુકાયો. ૧૯૫૦માં અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. ૫૦,૦૦૦/- નું વિશેષ અનુદાન મળતાં અલગ ગ્રંથભંડારની રચના થઈ. ૧૯૫૭માં પુસ્તકોને બંધ કબાટોના બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૭૪ અને પછીના વર્ષોમાં રૂ. ૧૬.૫૦ લાખની રકમ મ્યુ. કોર્પોરેશન તરફથી મળતા ગ્રંથાલય ભવનનું વિસ્તરણ કરવામાં આવ્યું. ૨૦૦૪-૦૫ માં પુનઃ રૂ. ૨૨.૦૦ લાખની કેપિટલ રકમ મળતા રેફરન્સ એન્ડ રીસર્ચ સેક્શન તથા જ્ઞાનવિહાર - વિદ્યાર્થી વાચનાલય વિભાગ અસ્તિત્વમાં આવ્યો. અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨-૧૪માં રૂ. ૫.૩૫ કરોડના ખર્ચે પુસ્તકાલયના નિવિનીકરણ અને રીટ્રોફીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી. જેમાં વાતાનુકૂલિત ઓડિટોરીયમ અને લીફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.

અનેકવિધ માહિતી માધ્યમોના પડકારો વચ્ચે ગ્રંથાલયસેવાને સતત અગ્રેસર અને જીવંત રાખવા છેલ્લા દોઢ દાયકા દરમ્યાન ગ્રંથાલયસેવાઓનું ફલક અત્યંત વિસ્તરતું રહ્યું છે. તેના સેવાફલક ઉપર માત્ર વયસ્કો જ નહીં અપિતું સૌ નાના ભૂલકાઓ, બાળકો, કિશોરો, મહિલાઓ, સીનીયર સીટીજન પ્રજ્ઞાચ્યક્ષુઓ વગેરેને પણ આવરી લઈ ફરતા પુસ્તકાલયો સાથે “મા.જે.” ની સેવાઓ ઘર ઊંબરા સુધી વિસ્તારવામાં આવી છે. વૈવિધ્યભરી વિસ્તરણ સેવાઓ અને વિશેષ કરીને ‘સાહિત્ય વર્તુળ’ સાહિત્ય ચોરાની સાહિત્યિક પ્રવૃત્તિએ મૂક સાહિત્યને જીવંત બનાવી માત્ર અમદાવાદને જ નહીં અપિતું સમગ્ર ગુજરાતને ગુંજતું કર્યું છે....નગરજનોનું એ ગૌરવ બની રહ્યું છે.

સંક્ષિમ માહિતી

સ્થાપના વર્ષ	: ૧૯૩૮
અનુદાન	: અમદાવાદ ભુનિસિપલ કોરોરિશન
વ્યવસ્થા	: મા.જે. પુસ્તકાલય, વ્યવસ્થાપક મંડળ
કુલ ખર્ચ	: ૫,૫૪,૬૩,૨૮૮=૦૦
કર્મચારીગણ	: પુસ્તકાલયના શીડીયુલ પર મંજૂર થયેલ મહેકમ કુલ ૧૧૮ કર્મચારીઓ હાલમાં ભરેલી જગાઓ કુલ ૮૦
વ્યાવસાયિક	: ૪૨
અર્ધ - વ્યાવસાયિક	: ૧૬
બિન - વ્યાવસાયિક	: ૨૨
વાચકસેવાઓ	
સામાન્ય	: વર્તમાનપત્રો - સામયિકો : અધ્યયન (સંદર્ભ) : અધ્યયન (વિદ્યાર્થી)
ગ્રંથપરિકમણ	: વયસ્ક : બાળકિશોર : મહિલા : ફ.બા.પુ. : ફ.મ.પુ. : નવા પશ્ચિમજોન ફ.બા.પુ. : શાખા પુસ્તકાલય (વિજયનગર - કાલુપુર - નરોડા - સરસપુર - મણીનગર- વાસણા-વેજલપુર - હિભેટલાલ પાર્ક - અમરાઈવાડી વાચનાલય) : - વયસ્ક : - બાળકિશોર : આંતર ગ્રંથાલય
પ્ર-લેખન માહિતીસેવા	: અનુલય (સંદર્ભ) : માહિતી : વાડુમયસૂચિ : પ્રતિલિપિ
વિભાગીય	: ૨મકડા ગૃહ : બાળ-કિશોર વિભાગ : બાળસંગ્રહાલય : પ્રજ્ઞાયક્ષુઓ માટેનો ઓડિયો વિભાગ : મહિલા વિભાગ

વિસ્તરણ

- : શાખા પુસ્તકાલય
- : ફરતું બાળ પુસ્તકાલય
- : નવા પણીમ ઝોન માટેનું ફરતું બાળ પુસ્તકાલય
- : મહિલાઓ માટેનું ફરતું પુસ્તકાલય
- : આર્ટ અને પિકચર ગેલેરી
- : ડિજિટલ લાયબ્રેરી
- : કાવ્યધારા
- : કેસેટ્સ શ્રવણ
- : ગ્રંથ પ્રદર્શન
- : દંશ્ય-શ્રાવ્ય
- : સીડી - ડીવીડી - વીસીડી
- : ઠી-બુક્સ, ઠી-જર્નલ્સ, રિજિટાઈઝેશન
- : જ્ઞાનસત્ર
- : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
- : વિસ્તરણ પ્રવૃત્તિઓ
- : કોમ્પ્યુટર
- : શ્રી ચંદ્રકાંત કર્સ્ટીઆ ભ્યુ. પુસ્તકાલય - વિજયનગર
- : કવિ શ્રી રામનારાયણ પાઠક 'દ્વિરેફ' ભ્યુ. વાચનાલય - કાલુપુર
- : માણબટ પ્રેમાનંદ ભ્યુ. પુસ્તકાલય - નરોડા
- : શ્રી સુરેશભાઈ રામકુમાર જોખી ભ્યુ વાચનાલય - સરસપુર
- : કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ ભ્યુ. પુસ્તકાલય - હિમતલાલ પાર્ક
- : ગઢાવિપતિ આચાર્યશ્રી સુભોધસાગર સુરીશ્વરજ મહારાજશ્રી શાખા પુસ્તકાલય - વાસણા
- : ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પુસ્તકાલય - વેજલપુર
- : શામળ ભણ ભ્યુ. વાચનાલય - અમરાઈવાડી
- : આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી શાખા પુસ્તકાલય - મણીનગર
- : અ.ભ્યુ.કો. પુસ્તકાલય ખાતુ, પુસ્તકાલયો-૮, વાચનાલયો-૩૮,
બાલભવન-૬

શિક્ષણ વિભાગ

- : વાચનાલય
- : અધ્યયન (કિશોર)
- : અધ્યયન (વયસ્ક)

ગ્રંથભંડાર (સામાન્ય)

- : દેય
- : અદેય

ગ્રંથભંડાર (વિશિષ્ટ)

- : અમદાવાદનો વારસો - અમદાવાદનો અક્ષરદેહ - અમદાવાદની અસ્મિતા
- : પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ વિભાગ

વिशिष्ट साहित्य

नवા ઉમેરાયેલા ગ્રંથો	: સત્યાગ્રહ આશ્રમ
કુલ ગ્રંથસંગ્રહ	: ગાંધી સાહિત્ય
સામયિકો	: રીસર્વ એન્ડ રેડી રેફરન્સ વિભાગ
કુલ સભ્ય સંખ્યા	: કોમ્પ્યુટર એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ
કુલ ગ્રંથપરિકમણા	: પેપર કલીપાંગ ફાઈલો કુલ ફાઈલો ૮૨ છે.
ફરતું બાળ પુસ્તકાલય	: ડેક્યુમેન્ટ - ઈન્ફર્મેશન ૨૫૮
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: ૧૦,૦૦૨
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: ૭,૫૪,૮૨૮
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: ૨૦૦
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: ૨૩,૩૭૨ (વાર્ષિક - ૨૪૬૫, આજીવન - ૨૦૬૦૭) (મા.જે. પુસ્તકાલય + શાખા પુસ્તકાલયો + ફરતા પુસ્તકાલયો)
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: ૨,૦૭,૩૬૦ (મા.જે. પુસ્તકાલય + શાખા પુસ્તકાલયો + બા.ક્રિ.વિ. + ફરતા પુસ્તકાલયો)
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: વિસ્તાર : ૧૦
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: સેવાકેન્દ્ર : ૨૫
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: વિસ્તાર : ૧૦
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: સેવાકેન્દ્ર : ૩૨
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: વિસ્તાર : ૫
નવા પશ્ચિમ ઝોન - ફ.બા.પુ.	: સેવાકેન્દ્ર : ૧૮

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૨
પુસ્તકાલયના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૬
પુસ્તકાલયની પાસે અથવા પુસ્ત.ના નિયંત્રણ હેઠળ હોય
તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧.	ગ્રંથપાલ	(૧) વ્યવસ્થા અને સંચાલન (૨) વહીવટી બાબતો (૩) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાયજન, સંકલન (૪) આયોજન (૫) મહેકમની તમામ બાબતો (૬) નાણાંકીય આયોજન (૭) નિરીક્ષણ અને કંટ્રોલ (૮) પુસ્તકાલય પ્રચાર અને પ્રસાર (૯) સહકાર - સમન્વય (૧૦) વહીવટી અધિકારી - પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ - પુસ્તક પસંદગી સમિતિ (૧૧) પુસ્તક અને વાચન સેવાઓ (૧૨) ભવન વિસ્તરણ અને આયોજન (૧૩) મોર્નાઈજેશન (૧૪) કોમ્પ્યુટરાઈઝેશન - લાયબ્રેરી ઓટોમેશન (૧૫) પુસ્તકાલય સેવાઓનો વિકાસ (૧૬) વિસ્તરણ પ્રવૃત્તિઓ (૧૭) સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (૧૮) વહીવટી અને નાણાંકીય નીતિવિષયક બાબતો (૧૯) નવીન આયોજન (૨૦) પુસ્તકાલયની ટેકનીકલ બાબતો (૨૧) ટ્રેનિંગ (૨૨) નાગરિક અધિકાર (૨૩) માહિતી અધિકાર (૨૪) અંદાજપત્ર (૨૫) વાર્ષિક વહીવટી અહેવાલ (૨૬) પુસ્તકાલય, શાખા પુસ્તકાલયો, વાચનાલય અને ફરતા પુસ્તકાલયની વ્યવસ્થા અને આયોજન (૨૭) વાચનલક્ષી સેવાઓ (૨૮) મ્યુ. કોર્પોરેશનના પુસ્તકાલયો/વાચનાલયો તેમજ બાલભવનો	નીતિવિષયક બાબતો અંગેની ફાઈલ રેકર્ડ, ટ્રસ્ટડાય, કર્મચારીઓની સિલેક્ટ ફાઈલ, કર્મચારીઓના સી.આર. રિપોર્ટ

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨.	સહાયક ગ્રંથપાલ (વહીવટ) (જગ્યા ખાલી)	(૧) વહીવટને લગતી બાબતો (૨) કર્મચારીઓની વ્યવસ્થા, પ્રશ્નો અને નિરાકરણ (૩) સેવાઓની સંપૂર્ણ દેખરેખ અને માર્ગદર્શન (૪) કર્મચારીઓની શિસ્ત વર્તણૂક અને અનિયમિતતા સંદર્ભ ઈન્કવાયરી અંગેની તમામ બાબતો (૫) કોર્ટ કચેરીમાં ચાલતા કેસો અને વકીલોને પૂરી પાડવાની માહિતી (૬) સ્ટાફ ટ્રેનિંગને લગતી બાબતો (૭) કર્મચારીઓની રજા, પેશાળી, મેડિકલ, પગાર, છ.પી.એફ., વીમો, ઈન્કમટેક્ષ જેવી તમામ બાબતો (૮) અંદાજપત્ર અને નાણાંકીય બાબતો (૯) પ્રો-ઓડિટ અને આવેલા વાંધાઓને લગતી બાબતો (૧૦) ભવન વિસ્તરણ અને આનુષાંગિક બાબતો (૧૧) મેન્ટેનાન્સ સંબંધી તમામ બાબતો (૧૨) ઓફિસ સેકેટરીએ રજૂ કરેલી બાબતો (૧૩) સ્ટાફ વેદ્ધેર અંગેની બાબતો (૧૪) શાખા પુસ્તકાલયો (૧૫) માહિતી અધિકાર (૧૬) નાગરિક અધિકાર (૧૭) મહિલા વિભાગ (૧૮) બાળકિશોર વિભાગ (૧૯) રમકડાં ગૃહ - પ્રતિલિપી સેવા (ઝેરોક્ષ), લેમિનેશન (૨૦) જાળવણી અને નિભાવ (૨૧) વાર્ષિક વહીવટી અહેવાલ (૨૨) વર્ગીકરણ (૨૩) સૂચિકરણ (૨૪) અનુલય સેવા (૨૫) ગ્રંથ સંસ્કરણ (૨૬) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવેલ અન્ય બાબતો	(૧) કોર્ટ મેટર અંગેની ફાઈલો / રેકડ (૨) જ્યુટિલીસ્ટ (૩) જાહેર માહિતી અધિકાર અંગે આપેલ માહિતીની ફાઈલોનો રેકડ (૪) વાર્ષિક અહેવાલ, અંદાજપત્ર (૫) પ્રો-એક્ટિવ ડિસ્કલોગર (૬) ખાતાકીય તપાસ - ઈન્કવાયરી રિપોર્ટ (૭) પુસ્તકાલયના વ્ય.મંડળ ઠરાવના પ્રોસીડરીની ફાઈલ (૮) પુસ્તકાલયના કર્મચારીઓની કામગીરી અને જવાબદારીઓની ફાઈલ (૯) અ.મ્યુ. કોર્પો. વહીવટી નાણાંકીય સરક્યુલરોની ફાઈલ અને સ્ટાફ સરક્યુલર

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩.	સહાયક ગ્રંથપાલ (ટેકનીકલ/કોમ્પ્યુટર) (જગ્યા ખાલી)	<p>(૧) કોમ્પ્યુટર અને સંલગ્ન બાબતો (૨) ટેકનિકલ કામગીરીની બાબતો (૩) ડિઝીટલ લાયબ્રેરી (૪) કોમ્પ્યુનિકેશન (૫) ફરતાં પુસ્તકાલયો (૬) પરિગ્રહણ શાખા (૭) બાઈન્ડિંગ અંગેની તમામ બાબતો (૮) નોનબુક મટિરીયલ્સ (૯) ઈ-બુક્સ ઈ-જર્નલ્સ (૧૦) ઓનલાઈન લાયબ્રેરી સર્વિસીઝ (૧૧) એજ્યુકેશનલ એન્ડ વોકેશનલ ગાઇડન્સ (૧૨) ઈન્ફર્મેશન ટેકનોલોજી (૧૩) રેફરન્સ સેવાઓ (૧૪) રેડી રેફરન્સ સેવાઓ (૧૫) વિસ્તરણ સેવાઓ (૧૬) ઉપભોક્તા શિક્ષણ (૧૭) જનસંપર્ક અને વાચન સર્વેક્ષણ (૧૮) પુસ્તકાલયની આંકડાકિય માહિતી (૧૯) વર્ગીકરણ, સૂચિકરણ (૨૦) ગ્રંથાલય સંસ્કાર (૨૧) પેપર ક્લિપીંગ (૨૨) આર્ટ એન્ડ પિક્ચર ગેલેરી (૨૩) બુક લેમિનેશન અને માઈક્રો ફિલ્મીકરણ (૨૪) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો (૨૫) માહિતી અધિકાર</p>	<p>(૧) કોમ્પ્યુટર ટેમજ ઇન્ટરનેટ સેવાઓ (૨) ફરતા પુસ્તકાલયો (૩) ડિઝીટલ લાયબ્રેરી (૪) બુક્સ રીલીઝ રજસ્ટર</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૪.	સહાયક ગ્રંથપાલ (શાખા પુસ્તકાલયો) (જગ્યા ખાલી)	(૧) શાખા પુસ્તકાલયોનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા (૨) પુસ્તકાલયો (શાખા)ની સેવાઓની બાબતો (૩) વર્ગીકરણ - સૂચિકરણ - અનુલય સેવાઓ (૪) વિસ્તરણ સેવાઓ (૫) શાખા પુસ્તકાલયોના નવીન આયોજનો અને વિકાસ અંગેની બાબતો (૬) ગ્રંથ સંસ્કરણના કાર્યો (૭) શાખા પુસ્તકાલયો અને વાચનાલય (૮) આંકડાકીય માહિતી અંગેની બાબતો (૯) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો	(૧) સભ્યોના પત્રવ્યવહારની ફાઈલ (૨) પોસ્ટેજ રજીસ્ટર (૩) અતિદેય ટિકીટ સ્ટોક રજીસ્ટર - વિજયનગર (૪) અતિદેય રજીસ્ટર (૫) ડ્યુ-ટેટ બુક (૬) સભ્યોનું વર્ગીકૃત રજીસ્ટર (૭) સભ્યનોંધણી રજીસ્ટર (૮) રિસ્લેસ બુક રજીસ્ટર (૯) રદબુક રજીસ્ટર (૧૦) બાઈન્ડિંગ રજીસ્ટર (૧૧) અતિદેય તેમજ સભ્યનોંધણી આવકની હિસાબી નોટ (૧૨) અનામત પુસ્તક કિંમત પહોંચબુક (૧૩) સભ્યકી પહોંચબુક (૧૪) અરજફોર્મ સ્ટોક રજીસ્ટર (૧૫) દેનિક વર્તમાનપત્ર નોંધણી રજીસ્ટર (૧૬) સામયિક નોંધણી કાર્ડ / રજીસ્ટર (૧૭) ટેલિફોન બિલ નોંધણી રજીસ્ટર (૧૮) ઈશ્યુ થયેલ પુસ્તકોનું વર્ગીકૃત રજીસ્ટર (૧૯) ઈમ્પ્રેશ કેશ રજીસ્ટર (૨૦) સભ્યપદ અરજફોર્મ (૨૧) સામયિક વાઉચર નોંધણી રજીસ્ટર (૨૨) મનીઓર્ડ કરેલ સામયિકોની વિગત અંગેની ફાઈલ (૨૩) ટિકટ ખોવાયા અંગેની પહોંચબુક

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૫.	જી. સહાયક ગ્રંથપાલ (પુસ્તક અને વાચન સેવાઓ, માહિતી સેવાઓ)	<p>(૧) વર્ગીકરણ - સૂચિકરણ (૨) પુસ્તક આપ-લે વિભાગ (૩) સભ્યપદ નોંધણી વિભાગ (૪) સામયિક વિભાગ અને વાચનાલય (૫) ગ્રંથભંડાર - સુપરવિઝન (૬) તમામ વિભાગોનું સુપરવિઝન (૭) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો (૮) શાખા પુસ્તકાલયો/વાચનાલયો</p> <p>જુનિયર સહાયક ગ્રંથપાલને ઈન્ચાર્જ સહાયક ગ્રંથપાલનો ચાર્જ આપવામાં આવેલ છે, તેની અંદર ઓડિટ (નોડલ ઓફિસર) અને જાહેર માહિતી અધિકારીની સઘળી જવાબદારી સોંપવામાં આવેલ છે.</p>	-

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૭.	ટેકનિકલ આસીસ્ટન્ટ	(૧) વર્ગાકિરણ (૨) સૂચિકરણ (૩) ગ્રંથસંસ્કરણ (૪) સૂચિકાર્ડની ગોઠવણી (૫) ગ્રંથ ગોઠવણી (૬) અનુલય સેવા - ત્વરિત સંદર્ભ સેવા - રેડી રેફરન્સ (૭) માહિતી સેવા (૮) પુસ્તક, વાચન અને વાચક સેવાઓ (૯) ન્યુએરાઇવલ્સ (પુસ્તકો રીલીઝ કરવા) (૧૦) ગ્રંથભંડાર નિરીક્ષણ અને કંટ્રોલ (૧૧) ગ્રંથભંડારમાંથી બુક વિડીગ આઉટ અંગેની બાબતો (૧૨) અન્ય સંસ્થામાંથી આવતા વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મુલાકાત માહિતી આપવી. (૧૩) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો.	(૧) રીલીઝ કરવામાં આવેલ પુસ્તકોનું રજીસ્ટર
૮.	ટેકનિકલ આસીસ્ટન્ટ		

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૩.	જુનિ. ટેકનિકલ આસી. (ખાલી જગ્યા)	(૧) વર્ગાકિરણ (૨) સૂચિકરણ (૩) ગ્રંથસંસકરણ (૪) સૂચિકાર્ડની ગોઠવણી (૫) ગ્રંથ ગોઠવણી (૬) અનુલય સેવા - ત્વરિત સંદર્ભ સેવા - રેડી રેફરન્સ (૭) માહિતીસેવા (૮) પુસ્તક, વાચન અને વાચક સેવાઓ (૯) ન્યુએરાઇવલ્સ (પુસ્તકો રીલીઝ કરવા) (૧૦) ગ્રંથભંડાર નિરીક્ષણ અને કંટ્રોલ (૧૧) ગ્રંથભંડારમાંથી બુક વિડીગ આઉટ અંગેની બાબતો (૧૨) અન્ય સંસ્થામાંથી આવતા વિદ્યાર્થીઓને પુસ્તકાલયની મુલાકાત માહિતી આપવી. (૧૩) ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો	(૧) રીલીઝ કરવામાં આવેલ પુસ્તકોનું રજીસ્ટર

શોઠ માણેકલાલ જેઠામાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૪.	ઓફિસ સુપ્રિટેન્ડન્ટ (જગ્યા ખાલી)	<p>(૧) પુસ્તકાલયના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ કર્મચારીઓની સેવાકીય તમામ બાબતો હેડકલાર્ક મારફતે કરાવવી. (૨) તમામ વિભાગોની વહીવટી વ્યવસ્થાકીય બાબતો સંભાળવાની રહેશે. (૩) પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળે કરેલા ઠરાવોના અમલ અને ગ્રંથપાલશ્રી અને સહા. ગ્રંથપાલશ્રીના માર્ગદર્શન મુજબ પુસ્તકાલયનો વહીવટ અને વ્યવસ્થાકીય સંચાલનકીય કાર્યવાહી સંભાળવી (૪) પુસ્તકાલયના વહીવટી કામો સંભાળતા કર્મચારીઓને તેઓના કામમાં માર્ગદર્શન આપવું અને વહીવટી કામગીરી કરાવવી (૫) પુસ્તકાલયમાં કર્મચારીઓની મુશ્કેલીઓ સાંભળી તેમની રૂબરૂમાં સમજણ આપવી. યોગ્ય નિકાલ માટે માર્ગદર્શન આપવું (૬) એસ્ટાભ્લીશમેન્ટને લગતી બાબતો, બિલકલાર્ક, સિનિયર કલાર્ક અને હેડકલાર્ક કરેલી કાર્યવાહીની ચકાસણી કરવી (૭) પુસ્તકાલયનો પ્રા-ઓડિટ વિભાગ, મેન્ટેનન્સ વિભાગમાં કરેલી કાર્યવાહીની ચકાસણી કરવી (૮) જી.પી.એફ., રોસ્ટર અંગેની કામગીરીઓની ચકાસણી તેમજ માર્ગદર્શન આપવું (૯) પુસ્તકાલયના કર્મચારીઓના જુદી જુદી કોર્ટો, ટ્રીબ્યુનલો, તપાસપંચો, કચેરીઓમાં દાખલ થયેલા કે દાખલ કરવાના દાવાઓ જેવી આનુષાંગિક બાબતો સંભાળવી (૧૦) અ.ભ્ય. કોર્પો. તરફથી પુસ્તકાલયમાં આવતા જરૂરી તેમજ અગત્યના પરિપત્રોમાં વહીવટના સંદર્ભમાં અમલ કરાવવાની કાર્યવાહી કરવી (૧૧) પુસ્તકાલયના કર્મચારીઓની જે તે વિભાગોમાં ગોઠવણી કરવા, કર્મચારીઓનું ડ્યુટીલિસ્ટ ગ્રંથપાલશ્રી તેમજ સહા. ગ્રંથપાલશ્રીનું માર્ગદર્શન મેળવી બનાવવું. ઉપરાંત જરૂરિયાત સમયે વિભાગોની કામગીરી યોગ્ય રીતે ચાલે તે માટે કર્મચારીઓની ગોઠવણા, વ્યવસ્થા કરવી. (૧૨) પુસ્તકાલયના વહીવટના સંદર્ભમાં તમામ પ્રકારનો પત્રવ્યવહાર કરવો (૧૩) એકાઉન્ટન્ટશ્રી કે ઓફિસ સેકેટરીની રજા દરમ્યાન - ગેરહાજરી દરમ્યાન તેમના વતી જે તે બિલોમાં સહી કરવાની તેમજ તેમની કામગીરી સંભાળવાની રહેશે. (૧૪) પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી દ્વારા અન્ય જે પણ કામગીરી મૌખિક કે લેખિતમાં સોંપે તે કામગીરી કરવાની રહેશે. (૧૫) કોર્ટ મેટર ઉપરોક્ત તમામ બાબતો સહા. ગ્રંથપાલ વહીવટ મારફતે ગ્રંથપાલશ્રી સમક્ષ રજૂ કરવાની રહેશે.</p>	<p>(૧) પુસ્તકાલયના કર્મચારીઓના ડ્યુટીલિસ્ટની ફાઈલ (૨) પુસ્તકાલયના વ્ય.મંડળના ઠરાવોની પ્રોસીડરીસની ફાઈલ (૩) પુસ્તકાલયના કર્મચારીઓની શૈક્ષણિક લાયકાતો કામગીરી અને જવાબદારીઓની ફાઈલ (૪) કર્મચારીઓ અને અન્ય પાર્ટીઓ સાથેની કોર્ટ મેટર સંબંધિત રેકર્ડ (૫) અમદાવાદ મ્યુ. કોર્પો.ના વહીવટી સરક્યુલરોની ફાઈલ (૬) શીડ્યુલ કર્મચારીઓ તથા પેન્શનરોની સર્વિસબુકો (૭) રોજંડા વેતનના કર્મચારીઓની સર્વિસબુકો (૮) કર્મચારીઓની ભરતી અને પ્રક્રિયા અંગેનું રેકર્ડ (૯) પુસ્તકાલયના કર્મચારીઓનું શીડ્યુલ, પેન્શનરોનું શીડ્યુલ તેમજ મહેકમનું માળખું (૧૦) રોજંડા કર્મચારીઓનું રજીસ્ટર અને સંબંધિત રેકર્ડ</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગ્ર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોગ્ર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૬.	સહાયક એકાઉન્ટન્ટ	<p>(૧) પુસ્તકાલયની તમામ નાણાંકીય વ્યવસ્થા અને આનુષ્ઠાંકિક તમામ કામગીરી. (૨) પુસ્તકાલયનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવું. (૩) વાર્ષિક અંદાજપત્રને લગતા સંભવિત પ્રશ્નો અને ઉત્તરો તૈયાર કરવા. (૪) અંદાજપત્રના અનુસંધાનમાં દરરોજાના જે તે ખર્ચના બિલો બજેટ મુજબ ચેક કરવા અને તે અંગેની કાર્યવાહી કરવી.પુસ્તકાલયના તમામ પ્રકારના ખર્ચના ચેક,ડાફ્ટ તેમજ રોકથી બિલોનું પેમેન્ટ કરવું. (૫) ચેક થી થયેલા બિલોની નોંધ તૈયાર કરવી. (૬) દર માસે તેમજ અ.સ્યુ.કોપેરિશનના સરક્યુલરો પ્રમાણે પુસ્તકાલયના શિક્ષયુલ કર્મચારીઓ/રોઝંદા કર્મચારીઓને પગાર તેમજ અન્ય રકમની ચૂકવણી કરવી. (૭) રોઝંદા ખર્ચના રોકડ વાઉચર, તથા નોંધ વાઉચર ઉપરથી ખતવણી કરવી અને તે અંગેની કામગીરી કરવી. (૮) માસિક કાચુ સરવૈયુ તૈયાર કરવું તેમજ આવક-જાવક તેમજ કેશફલો તૈયાર કરવો. (૯) દરમાસે મેળવવાની થતી ગ્રાન્ટ અંગે જરૂરી કાર્યવાહી કરવી. (૧૦) બેંકના છિસાબો રાખવા, બેંકોના તમામ ખાતા પુસ્તકાલયની ખાતાવહી સાથે દરમાસે મેળવવા. (૧૧) ઈન્વેસ્ટમેન્ટ અંગેની તમામ જવાબદારી સંભાળવી જેમકે રોકાણ, વ્યાજ, પુન:રોકાણ અંગે જુદીજુદી બેંકોમાં રૂબરૂ જઈ કાર્યવાહી કરવી. (૧૨) એકાઉન્ટને લગતા તમામ પ્રકારના રજીસ્ટરો,પેટા રજીસ્ટરો જેવા કે અનપેચીડ પગાર,ઓન્ટાક્ટ ડિપોઝીટ,ઓડિટોરીયમ ડિપોઝીટ,ટેનર ડિપોઝીટ, ઈન્વેસ્ટમેન્ટ રજીસ્ટર,ચેકબુક રજીસ્ટર વિગેરે લગતી કામગીરી કરી, વાર્ષિક રીપોર્ટ તૈયાર કરવો. (૧૩) વર્ષના અંતે તમામ રજીસ્ટરોની મેળવણી કર્યા બાદ પાકુ સરવૈયુ તૈયાર કરવું. (૧૪) રોઝંદા ચેક પેમેન્ટ બિલોનું ચેકથી પેમેન્ટ કરવા, ચેકબુકમાં મેયરશ્રી અથવા સેટ,કમિનીના ચેરમેનશ્રી અને ગ્રંથાપાલ પાસે ચેકબુકોમાં સહીઓ લેવા માટે જરૂરી રેકૉર્ડ સાથે લઈ જઈ રૂબરૂમાં બતાવવા. (૧૫) પુસ્તકાલયના એકાઉન્ટને લગતા તમામ ઓડિટ વાંધાઓનો સમયસર જવાબ તૈયાર કરી વાંધાઓનો નિકાલ સમયમયદામાં થાય તેવી કાર્યવાહી કરવી. (૧૬) પુસ્તકાલયના કર્મચારીઓ/અધિકારીઓના ઈન્કમટેક્ષને લગતી તમામ બાબતો. (૧૭) પ્રિ-ઓડિટ, પુસ્તકાલયના તમામ વિભાગો દ્વારા થતી ખરીદી, રીપેરીંગ તથા વહીવટને લગતી બાબતોના આવતા બિલોની મંજૂરી મેળવવી, મંજૂરી અંગેના વ્યવસ્થાપક મંડળના દરાવો, પાર્ટી સાથેની શરતો અનુસાર બીલો, મંજૂર થયાના પ્રમાણપત્રો, બીલના નાણાંની ચૂકવણી, સક્ષમ સત્તાની મંજૂરી, દરાવો અનુસારી ચકાસણી કરી વાઉચરો બનાવવા તેમજ બિલ રજીસ્ટરે નોંધી, પ્રિ-ઓડિટ-અમદાવાદ ખુનિસિપલ કોર્પો.માં રૂબરૂમાં પાસ કરાવવા લઈ જવા. આ બિલોમાં કોઈપણ ઓડિટ વાંધા આવે તો જે તે બ્યક્ટિ/વિભાગ પાસે સ્પષ્ટતા થવા મોકલવા અપવા અને સ્પષ્ટતા આવેથી પાસ થયા બાદ જે તે રજીસ્ટરે જમા લઈ જે તે બ્યક્ટિ/વિભાગ તરફ નાણાં ચૂકવણીના કાર્ય માટે મોકલવા અંગેની કાર્યવાહી કરવી. (૧૮) પુસ્તકાલયના વડા ગ્રંથાપાલશ્રી તરફથી નાણાંકીય બાબતો અને એકાઉન્ટને લગતી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે કામગીરી સમયમયદામાં કરવાની રહેશે.</p>	<p>(૧) છિસાબહાર રજીસ્ટર (૨) રોજમેળ (૩) પેમેન્ટ થયેલ કેશ વાઉચરની ફાઈલો (૪) પરચુરણ રસીદ બુકો (૫) બેંક પેમેન્ટ માટેના બેંક વાઉચર (૬) કેશ વાઉચર ફાઈલ (૭) નોંધવહી (૮) ખાતાવહી (૯) કર્મચારીઓ તેમજ પેન્શનરોને દરમાસે પેમેન્ટ કરવા માટેના બેંક સ્ટેમેન્ટની ફાઈલ (૧૦) ઈન્વેસ્ટમેન્ટ બાબતે ડિપોઝીટની ફાઈલ (૧૧) પુસ્તકાલયના ટ્રસ્ટીડ તેમજ રજીસ્ટ્રેશનની ફાઈલ (૧૨) પુસ્તકાલયના બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ બાબતે પોલીસીની ફાઈલ (૧૩) એકાઉન્ટ વિભાગમાં આવતા સરક્યુલરોની ફાઈલ (૧૪) એકાઉન્ટ વિભાગને લગતા વ્ય.મં.ના દરાવ તેમજ કાર્યવાહીની ફાઈલ (૧૫) ઈન્વેસ્ટમેન્ટ રજીસ્ટર રજીસ્ટર ગ્રાન્ટ (૧૬) ટેનર ડિપોઝીટ રજીસ્ટર (૧૭) કેન્ટ્રેક્ટ ડિપોઝીટ રજીસ્ટર (૧૮) ઓડિટોરીયમ ડિપોઝીટ રજીસ્ટર (૧૯) કેશ ફ્લો રજીસ્ટર (૨૦) ચેકબુક સ્ટેટ્બુક રજીસ્ટર (૨૧) અનપેડ પગાર અનપેડ પેન્શન રજીસ્ટર (૨૨) ટેમ્પરરી તસ્લમત રજીસ્ટર (૨૩) જે તે ડિપોઝીટ લેઝ રજીસ્ટર (૨૪) માસિક છિસાબો તથા સરવૈયા રજીસ્ટર (૨૫) પુસ્તકાલયના વાર્ષિક છિસાબો તથા વાર્ષિક સરવૈયા રજીસ્ટર (૨૬) પુસ્તકાલયના કર્મચારીઓના પોફેશનલ ટેક્ષ તેમજ ઈન્કમટેક્ષની રકમ બેંકમાં જમા કરવામાં આવેલ છે તે અંગેની ફાઈલ (૨૭) કર્મચારીઓના ઈન્કમટેક્ષની વાર્ષિક રીટર્ન ફાઈલ (૨૮) પુસ્તકાલયની વાર્ષિક મંજૂર થયેલ ગ્રાન્ટ પૈકી દર માસે કેશફ્લો મુજબ મેળવવાની ગ્રાન્ટની ફાઈલ</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક	
૧૭.	હેડકલાર્ક (વહીવટી શાખા)	(૧) એસ્ટાબિલસમેન્ટ વિભાગમાં બનતા તમામ પ્રકારના પગારબિલો, પુરવણીબિલો, જી.પી.એફ.એડવાન્સ ચુકવણીના બિલો, તથા અન્ય પેશગોઓ અંગેના બિલોની ચકાસણી કરવી અને તે અંગેની નોંધો જે તે અધિકૃત રેકૉર્ડ રખાયાની ખાતી કરી પાસ થયા બાદ ચુકવણી થાય તે જોવું. (૨) પુસ્તકાલયના તમામ કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ અને તે માટે આપાયેલા અભિપ્રાય તપાસવા. રજા માટે ભલામણો કરવી અને સર્વિસબુકમાં શિડયુલ નોટેડ, રજીસ્ટરે રખાયેલા રજાના રેકૉર્ડ બરાબર છે કે કેમ તેની ખાતરી કરી ચેક કરવા. (૩) જી.પી.એફ. ક્રાપાત તથા એડવાન્સ ક્રાપાતના રજીસ્ટરે, જમા-ઉધારના છિસાબની ચકાસણી કરવી. (૪) નિવૃત થતાં અથવા મરણ પામેલા કર્મચારીઓના કેસમાં તેઓને મળવાપાત્ર જે તે રકમોની ચુકવણી નિયમ અનુસાર સમય મર્યાદામાં થાય તે અંગેની કાર્યવાહી કરવી. પુસ્તકાલયના કર્મચારીઓ, અધિકારીઓની સેવાકીય બાબતોમાં જરૂર પડે લેબર ઓફિસર અને લીગલ અને નાણાં ખાતાનો અભિપ્રાય મેળવવો અને આનુષંખીક તમામ પ્રકારની કામગીરી કરવી. (૫) પુસ્તકાલયમાં હેડકલાર્ક કષાએ વહીવટ અને વ્યવસ્થાને લગતી તમામ બાબતોનો પત્રવ્યવહાર કરવો. (૬) પુસ્તકાલયમાં વહીવટી રેકૉર્ડની જીણવણી કરવી અને ખાતાના વડા અથવા સક્ષમ સત્તા મંજૂરી સિવાય બહાર ન જાય તે જોવું જ્યારે પણ કોઈપણ માહિતી અથવા ટોક્યુમેન્ટ માંગે ત્યારે તે પુરુ પાડવાની કામગીરી કરવી. (૭) પુસ્તકાલયના કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી/બધતી અંગે ભારત સરકાર અને રાજ્ય સરકારના નિતી નિયમો અનુસાર રોસ્ટર અંગેની કાર્યવાહી અને તેને આનુષંખીક તમામ બાબતો. (૮) પુસ્તકાલયના કાયમી / રોઝના કર્મચારીઓના મજૂર કષી., લેબર કોર્ટ, ઈન્કવાયરી અંગે ચાલતા કેસો અને અન્ય કોર્ટના કેસોનો અભ્યાસ કરી જરૂરી માહિતી તૈયાર કરવી, માર્ગદર્શન આપવું, મેળવવું તેમજ કોર્ટેમાં હાજરી આપવી. (૯) પુસ્તકાલયના તમામ જગ્યાઓના ભરતીના નિયમો તથા સિનીયોરીટી લીસ્ટ તૈયાર કરવું. (૧૦) પુસ્તકાલયમાં ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને મળવાપાત્ર લાભો ચુકવવા, રહેમરાહે નોકરી અંગેની તમામ બાબતો. (૧૧) પુસ્તકાલયના કર્મચારીઓના એસ.એલ.આર. તૈયાર કરવવા અને ચકાસણી કરવા બાબતો. (૧૨) પુસ્તકાલયમાં જગ્યાઓ ઉભી કરવી, ભરતી કરવી તેમજ પગાર ધોરણો અંગેની તમામ માહિતી તૈયાર કરવી અને મંજૂરી અર્થે રજૂ કરવી. (૧૩) પુસ્તકાલયના ગ્રંથપાલ વહીવટી અને વ્યવસ્થાકીય અન્ય કોઈપણ બાબતોની કામગીરી મૌખિક કે લેખિત સૌંપે તે કામગીરી કરવાની રહેશે.	ઉપરોક્ત તમામ બાબતો નોટેંગ (રીપોર્ટિંગ) કરીને કાગળો સાથે ફાઈલો તૈયાર કરી ઓફિસ સુપ્રિટેન્ટ, સહાયક ગ્રંથપાલ (વહીવટ) મારફતે ગ્રંથપાલશી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવાની રહેશે.	(૧) રોસ્ટર રજીસ્ટરો (૨) રોસ્ટર અંગેના જે તે ખાતે લખેલ પત્રોની ફાઈલ (૩) વ્ય.મં.ના છરાવની પ્રોસીડરિંગની ફાઈલ (૪) અ.ભ્ય. કોર્પો.ના વહીવટી સરક્યુરોની ફાઈલ (૫) ઓડિટેબલ રેકૉર્ડની સિક્કા બુક (૬) રોજગાર નિયામકની કચેરી ખાતે લખેલ પત્રોની ફાઈલો (૭) પુસ્તકાલયના કર્મચારીઓના સ્કુલ લિવિંગ સર્ટી.ની ફાઈલ (૮) મેડીકલ રીએમ્બર્સમેન્ટના અભિપ્રાયની ફાઈલ
૨૬.	સિનીયર કલાર્ક	(૧) એસ્ટાબિલસમેન્ટ વિભાગમાં બનતા તમામ પગારબિલો, પુરવણીબિલો, જી.પી.એફ.એડવાન્સ ચુકવણીના બિલો, તથા અન્ય પેશગોઓ અંગેના બિલોની ચકાસણી કરવી અને તે અંગેની નોંધો જે તે અધિકૃત રેકૉર્ડ રખાયાની ખાતી કરી પાસ થયા બાદ ચુકવણી થાય તે જોવું. (૨) પુસ્તકાલયના તમામ કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ અને તે માટે આપાયેલા અભિપ્રાય તપાસવા. રજા માટે ભલામણો કરવી અને સર્વિસબુકમાં શિડયુલ નોટેડ, રજીસ્ટરે રખાયેલા રજાના રેકૉર્ડ બરાબર છે કે કેમ તેની ખાતરી કરી ચેક કરવા. (૩) જી.પી.એફ. ક્રાપાત તથા એડવાન્સ ક્રાપાતના રજીસ્ટરે, જમા-ઉધારના છિસાબની ચકાસણી કરવી. (૪) નિવૃત થતાં અથવા મરણ પામેલા કર્મચારીઓના કેસમાં તેઓને મળવાપાત્ર જે તે રકમોની ચુકવણી નિયમ અનુસાર સમય મર્યાદામાં થાય તે અંગેની કાર્યવાહી કરવી. પુસ્તકાલયના કર્મચારીઓ, અધિકારીઓની સેવાકીય બાબતોમાં જરૂર પડે લેબર ઓફિસર અને લીગલ અને નાણાં ખાતાનો અભિપ્રાય મેળવવો અને આનુષંખીક તમામ પ્રકારની કામગીરી કરવી. (૫) પુસ્તકાલયમાં હેડકલાર્ક કષાએ વહીવટ અને વ્યવસ્થાને લગતી તમામ બાબતોનો પત્રવ્યવહાર કરવો. (૬) પુસ્તકાલયમાં વહીવટી રેકૉર્ડની જીણવણી કરવી અને ખાતાના વડા અથવા સક્ષમ સત્તા મંજૂરી સિવાય બહાર ન જાય તે જોવું જ્યારે પણ કોઈપણ માહિતી અથવા ટોક્યુમેન્ટ માંગે ત્યારે તે પુરુ પાડવાની કામગીરી કરવી. (૭) પુસ્તકાલયના કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી/બધતી અંગે ભારત સરકાર અને રાજ્ય સરકારના નિતી નિયમો અનુસાર રોસ્ટર અંગેની કાર્યવાહી અને તેને આનુષંખીક તમામ બાબતો. (૮) પુસ્તકાલયના કાયમી / રોઝના કર્મચારીઓના મજૂર કષી., લેબર કોર્ટ, ઈન્કવાયરી અંગે ચાલતા કેસો અને અન્ય કોર્ટના કેસોનો અભ્યાસ કરી જરૂરી માહિતી તૈયાર કરવી, માર્ગદર્શન આપવું, મેળવવું તેમજ કોર્ટેમાં હાજરી આપવી. (૯) પુસ્તકાલયના તમામ જગ્યાઓના ભરતીના નિયમો તથા સિનીયોરીટી લીસ્ટ તૈયાર કરવું. (૧૦) પુસ્તકાલયમાં ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિતોને મળવાપાત્ર લાભો ચુકવવા, રહેમરાહે નોકરી અંગેની તમામ બાબતો. (૧૧) પુસ્તકાલયના કર્મચારીઓના એસ.એલ.આર. તૈયાર કરવવા અને ચકાસણી કરવા બાબતો. (૧૨) પુસ્તકાલયમાં જગ્યાઓ ઉભી કરવી, ભરતી કરવી તેમજ પગાર ધોરણો અંગેની તમામ માહિતી તૈયાર કરવી અને મંજૂરી અર્થે રજૂ કરવી. (૧૩) પુસ્તકાલયના ગ્રંથપાલ વહીવટી અને વ્યવસ્થાકીય અન્ય કોઈપણ બાબતોની કામગીરી મૌખિક કે લેખિત સૌંપે તે કામગીરી કરવાની રહેશે.		

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૮.	હેડ કલાર્ક (મેન્ટેનન્સ) (ખાલી જગ્યા)	<p>(૧) પુસ્તકાલયમાં તમામ પ્રકારના મેન્ટેનન્સ, રીપેરીંગ ખરીદી અંગેની જરૂરી કાર્યવાહી કરવી આ કામગીરી કરવા માટેના ભાવો મંગાવવા, ટેન્ડર ઈશ્યુ કરવા, તુલનાત્મકપત્રક તૈયાર કરવા, ખર્ચની મંજૂરી માટે જે તે કક્ષાએ રજૂ કરવા, મંજૂરી મેળવ્યા બાદ ખરીદી, રીપેરીંગ અને જાળવણી અંગેની કામગીરી કરવી, ખરીદેલી બાબત ડેડસ્ટોક રજીસ્ટરે જમા લેવા અને જે તે વ્યક્તિ/વિભાગને યોગ્ય સત્તાથી મંજૂરી મેળવી જાળવણી કરવી. (૨) કન્ટીજન્સી આઈટમો, જમા-ઉધાર કર્યા અંગેની જરૂરી નોંધો જે તે રજીસ્ટરે રાખ્યી તથા તેના બેલેન્સ તૈયાર કરવા. (૩) જુની વપરાશમાં ન લઈ શકાય તેવી આઈટમોને રદ કરવા અંગેની કાર્યવાહી કરવી. જે તે સક્ષમ સત્તા સમક્ષ રીપોર્ટ તૈયાર કરી રજૂ કરવા, રદ થયા પછી કન્ડમ રજીસ્ટરે જમા લેવાની અને તેના નિકાલ અંગેની કાર્યવાહી કરવી મંજૂરી મેળવી ભાવો મંગાવી વેચાણ કર્યા બાદ આવકની રકમ જે તે વિભાગમાં જમા કરાવવી.</p> <p>(૪) પુસ્તકાલયમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ પ્રકારની સ્ટેશનરી, પ્રિન્ટિંગ મટીરીયલ્સ તથા પ્રિન્ટિંગ અંગેની તમામ કામગીરી. (૫) મેન્ટેનન્સને લગતો સમગ્ર પત્રવહાર કરવો, અને મેન્ટેનન્સ ને લગતી તમામ ફાઈલોની જાળવણી કરવી. મેન્ટેનન્સને લગતી તમામ બાબતોના બિલોની ચુકવણી કરવા અંગેની કાર્યવાહી કરવી. (૬) પુસ્તકાલયમાં જુદા-જુદા વિભાગોમાં ઇન્ટિરીયર ડેકોરેશનને લગતી તમામ બાબતો. (૭) પુસ્તકાલયમાં તમામ વિભાગોની સફાઈ, જરૂરિયાત અનુસાર વિભાગોને બદલવા, જરૂરી ફર્નિચર, રેકોર્ડ ખસેડવો અને ગોડવવા અંગેની બાબતો. (૮) પુસ્તકાલય ભવન વિસ્તરણ, અન્ય સુવિધાઓ અને વ્યવસ્થાકીય આનુષંગિક તમામ બાબતો સંભાળવી. પુસ્તકાલયના તમામ સાધન સામગ્રીની ચીજવસ્તુઓની જાળવણી અને તે અંગેની તમામ કાર્યવાહી કરવી. (૯) શાખા પુસ્તકાલયોની મેન્ટેનન્સ અંગેની તમામ બાબતો સંભાળવી અને તેને આનુષંગિક તમામ કામગીરી કરવી. (૧૦) પુસ્તકાલયના વડા ગ્રંથપાલશ્રી મેન્ટેનન્સ, સંબંધી અન્ય કોઈપણ વ્યવસ્થાકીય કામગીરી સૌંપે તે કામગીરી આપને કરવાની રહેશે. ઉપરોક્ત તમામ બાબતો નોટીંગ (રીપોર્ટિંગ) કરીને મૂળ કાગળો સાથે ફાઈલ તૈયાર કરી ઓફિસ સુપ્રિટેન્ડન્ટ, સહાયક ગ્રંથપાલ (વહીવટ) મારફત ગ્રંથપાલશ્રી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવાની રહેશે.</p>	<p>(૧) ટેડ સ્ટોક રજીસ્ટર (૨) કન્ટીજન્સી રજીસ્ટર (૩) કન્ટીજન્સી ઈશ્યુ રજીસ્ટર (૪) કન્ડમ રજીસ્ટર (૫) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયોમાં સફાઈ કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ (૬) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલય વિજયનગર સિક્યુરિટી સર્વિસ અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ (૭) ટેલિફોન રજીસ્ટર (૮) વિજણી રીપેરીંગ કામગીરી અંગે રજીસ્ટર (૯) પુસ્ત.ના એ.સી. મશીન, વોટર કુલર, ઝેરોક્સ મશીન રીપેરીંગ તેમજ સર્વિસ અંગેની કોન્ટ્રાક્ટ ફાઈલ (૧૦) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં પ્રિન્ટિંગની કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટની ફાઈલ (૧૧) પુસ્તકાલયના મેન્ટેનન્સ અને રીપેરીંગ અંગેના કામોની ફાઈલો (૧૨) પુસ્તકાલયમાં શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે ફોટોગ્રાફ, વિડિયોગ્રાફી કરાવવા અંગેની વાર્ષિક ફાઈલ (૧૩) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં વિજણી રીપેરીંગ કામગીરી અંગેની ફાઈલ (૧૪) પુસ્તકાલયના ઈન્ટરકોમ રીપેરીંગ તેમજ સર્વિસીંગ અંગેની ફાઈલ (૧૫) પુસ્તકાલયના ભવન વિસ્તરણની ફાઈલ (૧૬) શાખા પુસ્તકાલયના પ્રેશન તેમજ ગ્રાન્ટ અંગેના પત્રવહારની ફાઈલ (૧૭) સેન્ટ્રલ સ્ટોર્સની સ્ટેટેમેન્ટ મુજબ મંજૂર થયેલ કન્ટીજન્સીની ફાઈલ (૧૮) મેન્ટેનન્સ વિભાગને લગતી વ્યવસ્થાપક મંજુના ઠરાવોની ફાઈલ (૧૯) અ.મ્યુ. કોર્પો.ના મેન્ટેનન્સ વિભાગને લગતા સરક્યુલરની ફાઈલ (૨૦) ઈન્ટેન્ટ બુક</p>

શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૧૮.	સીનિયર કલાર્ક (ખાલી જગ્યા)	(૧) જનરલ પ્રોવિડન્ડ ફંડને લગતી બાબતો (૨) પેશગીઓ (૩) કર્મચારીઓના પગાર અંગેની બાબતો	(૧) જનરલ પ્રો.ફંડ માસિક રજીસ્ટર (૨) જનરલ પ્રો.ફંડ વાર્ષિક રજીસ્ટર
૨૬.	સિનીયર કલાર્ક કામગીરી સંભાળે છે.	(૪) પગારધોરણના એવોઈ અંગેની માહિતી. (૫) વહીવટી કામગીરી (૬) પેન્શન અંગેની બાબતો (૭) હેડકલાર્ક-વહીવટી શાખા, અને સહાયક ગ્રંથપાલ (વહીવટ) તરફથી સૌંપવામાં આવે તેવી બાબતો.	(૩) જનરલ પ્રો.ફંડ એડવાન્સ રજીસ્ટર (૪) ડી.એ. પી.એફ. ટેમજ એવોઈ તફાવતનું રજીસ્ટર (૫) જનરલ પ્રો.ફંડનું સરવૈયા રજીસ્ટર (૬) સ્ટાફ વેલ્ફેર ફંડ લોન અંગે (અ.મ્યુ. કોર્પો. તરફથી રજીસ્ટર) (૭) કર્મચારીઓએ ઉપાડેલ જનરલ પ્રો.ફંડના અભિપ્રાયના ફોર્મની ફાઈલ (૮) નિવૃત્તા/રાજીનામું/મરણના જનરલ પ્રો.ફંડના ચૂકવેલ બીલોની ફાઈલ (૯) સ્ટાફ વેલ્ફેર ફંડ લોન મંજૂર થયેલ ફોર્મની ફાઈલ (૧૦) જી.પી.એફ. અંગેના સરક્યુલરની ફાઈલ

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૦.	હેડકલાઈક (મહિલા/બા.ક્રિ.વિ.) (જગ્યા ખાલી)	(૧) મહિલા વિભાગ (૨) બાળકિશોર વિભાગ (૩) રમકડાંગૃહ (૪) બાળ વાચન અને વિસ્તરણ સેવાઓ (૫) ગ્રંથ પ્રાપ્તિ અને આયોજન (૬) પુસ્તક પસંદગી (૭) વાંચન સેવાકેન્દ્રો (૮) મહિલા વિદ્યાર્થી વાચન સેવાઓ (૯) એજયુકેશનલ એન્ડ વોકેશનલ ગાઈડન્સ વિભાગ (૧૦) સર્જનશિલા (૧૧) ગ્રંથ ગોઠવણી (૧૨) સામયિક પ્રાપ્તિ અને આનુષાંગિક બાબતો (૧૩) રેફરન્સ વિભાગ (૧૪) ગ્રંથ મેળવણી (૧૫) વર્ગીકરણ - સૂચિકરણ (૧૬) સંદર્ભ સેવાઓ (૧૭) ગ્રંથ સંસ્કરણ (૧૮) ગ્રંથપાલશી તરફથી સોંપવામાં આવે તેવી બાબતો	(૧) બા.ક્રિ.વિ. તથા મહિલા વિભાગના ઈશ્યુ થયેલ પુસ્તકોની આંકડાકીય માહિતીનું રજીસ્ટર (૨) બા.ક્રિ.વિ. તથા મહિલા વિભાગમાં આવતા વાચકોની હાજરી અંગેની આંકડાકીય માહિતીનું રજીસ્ટર (૩) સામયિક-નાંધણી રજીસ્ટર (૪) રદ/બાઈનીંગ રજીસ્ટર (૫) બાળકો પાસેથી પરત ન આવેલ પુસ્તકો માટે કરેલ પત્રવ્યવહારનું રજીસ્ટર (૬) ભ્યુ. સ્કૂલોમાં પુસ્તક વાચન સેવાકેન્દ્રો માટે મોકલાવેલ પુસ્તકોની યાદીની ફાઈલ તેમજ તે અંગે કરવામાં આવેલ પત્રવ્યવહારની ફાઈલ (૭) મહિલા વિભાગના પુસ્તકો અતિદેય માટે જમા લેવામાં આવતી ટિકિટોની નોંધ અંગેનું રજીસ્ટર (૮) મહિલા વિભાગમાંના જમા પુસ્તકોનું ઓડિટ-ચેકિંગ માટે તૈયાર કરેલ રજીસ્ટર

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૧.	પરિગ્રહણ વિભાગ હેડ કલાર્ડ	<p>૧. પુસ્તક ખરીદી અને અંગેની તમામ બાબતો</p> <ul style="list-style-type: none"> - ટેન્ડર, તુલનાત્મક પત્રક, પુસ્તક પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવા, પત્ર વ્યવહાર, એપ્રુવલ, બુક સિલેક્શન સ્લીપો, ચકાસણી, પુસ્તક-ઓર્ડર, ભૌતિક ચકાસણી, પુસ્તક ડિમાન્ડ, બીલોની ચકાસણી, બીલ અનુસાર પુસ્તકોની ગોઠવણી, એક્સેશન, પુસ્તકો ટેકનિકલ વિભાગમાં મોકલવા, બીલોની ચૂકવણી, પ્રિ-ઓડિટ વાંધાઓનો નિકાલ, ઓડિટ વાંધાઓ, બેટ પુસ્તકો, અંગ્રણ સામગ્રીની નોંધણી, વર્ગીકૃત થયેલા પુસ્તકોની સ્લીપો અને પરિગ્રહણ પત્રકમાં નોંધણી, સ્લીપોની ગોઠવણી, પરિગ્રહણ પત્રકમાં વર્ગીકૃત નંબરો નોંધવા <p>૨. પુસ્તક ખરીદી અંગેની આંકડાકીય માહિતી</p> <p>૩. વર્જિન્કરણ અને સૂચિકરણ માટે ટેકનીકલ વિભાગને મોકલવી</p> <p>૪. આંકડાકીય માહિતી તૈયાર કરવી</p> <p>૫. પુસ્તક ખરીદી અંગેના ઠરાવો લખવા</p> <p>૬. સહાયક ગ્રંથપાલ અને ઓફિસ સેકેટરી સાથે સંપર્કમાં રહી આ વિભાગની સેવાઓ અસરકારક બનાવવી.</p> <p>૭. ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તે તમામ બાબતો.</p>	<p>(૧) પરિગ્રહણ રજીસ્ટર</p> <p>(૨) બિલબુક રજીસ્ટર</p> <p>(૩) એપ્રુવલ રજીસ્ટર</p> <p>(૪) બેટ આવેલા પુસ્તકોનું રજીસ્ટર</p> <p>(૫) ટેકનિકલ કામગીરી માટે આપવામાં આવતા પુસ્તકોની નોંધણીનું રજીસ્ટર</p> <p>(૬) વેપારીઓના ભાવોનું તુલનાત્મક પત્રકની ફાઈલ</p> <p>(૭) પુસ્તક પસંદગી સમિતિના એજન્ડાની ફાઈલ</p> <p>(૮) પુસ્તક પસંદગી સમિતિના ઠરાવોની ફાઈલ</p> <p>(૯) મંજૂર થયેલા વેપારીઓના ભાવો અંગેના ઠરાવોની ફાઈલ</p>
૫૦.	એટેન્ડન્ટ લાયબ્રેરી		
૩૫.	ટાઇપીસ્ટ		

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૨.	વાચનાલય વિભાગ	<ul style="list-style-type: none"> (૧) વાચનાલય વિભાગ (૨) સામયિક વિભાગ (૩) સામયિક નોંધણી <ul style="list-style-type: none"> - લવાજમ ભરવા-અંકો મેળવવા-પત્ર વ્યવહાર - સામયિક બાઈન્ડીંગ અંગે-વર્તમાનપત્રો-સામયિકોની ગોઠવણી-શાખા પુસ્તકાલયો, વિભાગોને અંકો મોકલવા (૪) વર્તમાનપત્રો-સામયિકના પસ્તીના વેચાણ અંગે (૫) વર્તમાનપત્રો-સામયિકો મંગાવવા માટે વેપારી પાસે ભાવપત્રક મંગાવવા તેમજ પુસ્તક પસંદગી સમિતી સમક્ષ રજુ કરવા. 	<ul style="list-style-type: none"> (૧) સામયિક લવાજમ રજીસ્ટર (૨) સામયિક બિલ નોંધણી રજીસ્ટર (૩) સામયિક બાઈન્ડીંગ રજીસ્ટર (૪) સામયિક બેટ રજીસ્ટર (૫) આંતર-ગ્રંથાલય લેવડ દેવડ (સામયિક) ફાઈલ (૬) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલય માટે મંગાવવામાં આવતા વર્ગમાનપત્રો તેમજ સામયિકોના ટેન્ડરો તેમજ તુલનાત્મક પત્રકની ફાઈલ
૪૫. ૬૮.	એટેન્ડન્ટ લાયબ્રેરી	<ul style="list-style-type: none"> (૧) વાચકોને જૂના સામયિકો-વર્તમાનપત્રો (ફાઈલ) તેમની માંગણી મુજબ આપવા, તેની વ્યવસ્થિત કમાનુસાર ગોઠવણી કરવી. (૨) દૈનિક વર્તમાનપત્રો-સામયિકો વિભાગમાં ગોઠવવા. (૩) દૈનિક વર્તમાનપત્રો-સામયિકોને વાચકો નુકશાન ન કરે તેની દેખરેખ રાખવી. 	<ul style="list-style-type: none"> (૭) પુસ્કતાલય તેમજ શાખા પુસ્કતાલયની પસ્તી વેચાણ અંગેની ફાઈલ (૮) મંજૂર થયેલ ત્રણ વર્ષની સામયિકોની યાદીની ફાઈલ
૧૧૩.	માણી	<ul style="list-style-type: none"> (૧) દૈનિક વર્તમાનપત્રો તેમજ સામયિકો પર પુસ્તકાલયના સિક્કા લગાવવા. (૨) વર્તમાનપત્રો-સામયિકોનું ફાઈલીંગ તેમજ પસ્તી વેચાણને આનુષ્ઠાંગિક કામગીરી (૩) વાચનાલય-સામયિક વિભાગમાં સફાઈકામ કરવું તેમજ ફર્નિચરની સફાઈ અને ગોઠવણી કરવી. (૪) ગ્રંથપાલશ્રી તેમજ સહા.ગ્રંથપાલશ્રી દ્વારા સોંપવામાં આવે તે કામગીરી. 	<ul style="list-style-type: none"> (૯) સામયિકના લવાજમની પહોંચ અંગેની ફાઈલ (૧૦) પુસ્તકાલયમાં ન આવેલ સામયિકના રિમાઇન્ડર પત્રો અંગેની ફાઈલ (૧૧) સામયિક નોંધણી કાર્ડ (૧૨) મનીઓર્ડ કરેલા સામયિકોની વિગત અંગેની ફાઈલ (૧૩) વેપારીઓના આવેલ પત્રોની ફાઈલ

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
	આપ-લે વિભાગ		
૨૩.		૧. આપ-લે વિભાગની આંકડાકીય માહિતી ૨. અતિદેય અંગેની બાબતો ૩. રજીસ્ટરો-પત્રકોમાં નોંધણી ૪. પુસ્તક નુક્સાની દંડ વસુલાત અંગેની બાબત ૫. વાચકો દ્વારા ખોવાયેલા પુસ્તકો બાબત ૬. પુસ્તક કિંમત રીકવરી બાબત ૭. આપ-લે વિભાગમાં ખોવાયેલ પુસ્તકની ટિકીટો અંગે હુલ્લીકેટ ટિકિટ આપવા બાબત. ૮. આંતર ગ્રંથાલય લેવડ દેવડ બાબત ૯. જમા ન થયેલા પુસ્તકો અંગે સભ્યો તેમજ જામિનદારોને પત્રવ્યવહાર ૧૦. કલેઇમકાર્ડ અંગેની બાબતો ૧૧. સહાયક ગ્રંથપાલના સંપર્કમાં રહી આ વિભાગની સેવાઓ અસરકારક બની રહે તે પ્રકારની કામગીરી ૧૨. પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી અને સહાયક ગ્રંથપાલશ્રી (વહીવટ) અન્ય જે પણ કામગીરી સૌંપે તે કામગીરી કરવાની રહેશે.	(૧) દૈનિક ઈશ્યુ રજીસ્ટર (૨) અતિદેય રજીસ્ટર (૩) અતિદેય સ્ટોક રજીસ્ટર (૪) ડચ્યુ-ટેટ નોટબુક (૫) છિસાબની નોટબુક (૬) આજીવન પુસ્તક ઈશ્યુ રજીસ્ટર (૭) સ્ટાફ પુસ્તક ઈશ્યુ રજીસ્ટર (૮) મ્યુ. કાઉ. તેમજ મ્યુ. અધિકારીશ્રીઓને પુસ્તક ઈશ્યુ કરવા માટેનું રજીસ્ટર (૯) સંસ્થાકીય/વ્યક્તિગત/અધિકારીશ્રીઓને પુસ્તક ઈશ્યુ કરવા માટેનું રજીસ્ટર (૧૦) બુક રિપેસ રજીસ્ટર (૧૧) સભ્યને/જામિનદારોને બાકી પુસ્તક જમા કરાવવા અંગે પત્ર લખવા અંગેનું રજીસ્ટર (૧૨) ખોવાયેલ ટીકીટો અંગેની ફાઈલ (૧૩) ખોવાયેલ ટીકીટો હુલ્લીકેટ બનાવી આપવાની અરજી અંગેની ફાઈલ (૧૪) કલેઇ-કાર્ડ તેમજ તે અંગેનું રજીસ્ટર (૧૫) પોસ્ટેજ તેમજ અતિદેય એકાઉન્ટ વિભાગ ખાતે જમા કરાવેલ પહોંચની ફાઈલ
૩૬.	ટાઈપિસ્ટ		
૪૫.	એટેન્ડન્ટ લાયબ્રેરી		
૪૭.			
૪૮.			

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૭.	સિનીયર કલાર્ક બિલ કલાર્ક	(૧) પગાર બીલો - પૂરવણી બીલો, એવોર્ડ તફાવતના બીલો, મૌંઘવારી તફાવતના બીલો (૨) એલ.ટી.સી. (૩) રજા-પગાર (૪) નિવૃત્ત કર્મચારીઓની હેણી રકમ - ગ્રેજ્યુઇટી, પેન્શન, કોમ્પ્યુટર પેન્શન, રજા રૂપાંતર (૫) અવસાન પામેલા કર્મચારીઓના હેણાની આશ્રિતોને ચૂકવણી. (૬) કોર્ટ-કચેરીઓમાં ચાલતા કેસોમાં માહિતી પૂરી પાડવી (૭) વ્યવસાયવેરો (૮) કર્મચારીઓની અનામત જગ્યાઓ-રોસ્ટરો (૯) ઇન્કમટેક્ષ (૧૦) કર્મચારીઓની દરેક પ્રકારની રજાઓ (૧૧) ઓડિટ (૧૨) મેડિકલ - ટી.બી., મેટરનીટી, ફેમીલી પ્લાનિંગ (૧૩) બીલ કલાર્ક તરીકેની કામગીરીમાં જરૂરી રજિસ્ટરો-પત્રકો તૈયાર કરવા-નોંધો કરવી. (૧૪) હેડ કલાર્ક અને સહાયક ગ્રંથપાલ (વહીવટ) સાથે સંપર્કમાં રહી નાણાંકીય અને વહીવટી કામગીરી વધુ કાર્યક્ષમ બને તેવા પ્રયત્નો કરવા. (૧૫) ગ્રંથપાલશ્રી તરફ સૌંપવામાં આવે તેવી તમામ બાબતો.	(૧) વર્ગ-૨ તથા વર્ગ-૩ના કર્મચારીઓના ડ્યુટીલીવની ફાઈલ (૨) એલ.આઈ.સી.ની ફાઈલ (૩) ઇન્કમટેક્ષની ફાઈલ (૪) સર્વિસ બોન્ડની ફાઈલ (૫) કર્મચારીઓની વધુ અભ્યાસ મેળવવા અંગેના બાન્ડની ફાઈલ (૬) પગારબીલના કોમ્પ્યુટરડેટા અંગેની ફાઈલ (૭) ફેસ્ટીવલ એડવાન્સ, ફૂટ ગ્રેઇન એડવાન્સ, સ્ટાફ વેલફેર, જી.પી.એફ. એડવાન્સ, સ્ટાફ વેલફેર લોન, એલ.આઈ.સી., હાઉસીંગ લોન અંગેની ફાઈલ (૮) ચલણ બુક (૯) ઉચ્ચતર પગારધોરણના રજીસ્ટરની ફાઈલ (૧૦) અંદાજિત એસ્ટાબિલિશમેન્ટ બજેટ શિડ્યુલ (૧૧) પુસ્તકાલય તથા શાખા પુસ્તકાલયના હાજરી પત્રકો (૧૨) પગારબીલો (૧૩) પેન્શનરોના બિલો તથા પૂરવણી બિલો (૧૪) બિલો નોંધવાનું રજીસ્ટર

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૮.	કલાર્ક કમ કેશિયર (સિનીયર કલાર્ક) (જગ્યા ખાલી)	<ol style="list-style-type: none"> ૧. પુસ્તકાલયમાં આવતી રોકડ આવક જાવકનો હિસાબ ૨. રોજમેળ ૩. કર્મચારીઓ-અધિકારીઓના પગાર, પૂરવણી બીલો, ઇ.પી.એફ., પેશાગીઓ, સ્ટાફ વેલફર, વાહન ખર્ચ જેવી ચૂકવણી ૪. તાકિદની જરૂરિયાત અનુસાર રોકડ ખરીદીના બીલોની ચૂકવણી ૫. એકાઉન્ટ વિભાગની જે પણ કામગીરી એકાઉન્ટન્ટ સોંપે તે કામગીરી કરવાની રહેશે ૬. ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે. 	-

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૨૮.	સિનીયર કલાર્ક (મેન્ટેનન્સ કલાર્ક)	<p>૧. કન્ટીજન્સી-સ્ટેશનરી-ડેડસ્ટોક આઈટમોની ખરીદી.</p> <p>૨. ઇન્સેન્ટ ભરવા.</p> <p>૩. બજારભાવે ખરીદી.</p> <p>૪. વાર્ષિક સ્ટેશનરી - કન્ટીજન્સીની જરૂરીયાત માટે ભાવો મંગાવવા.</p> <p>૫. કન્ટીજન્સી રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર નોંધણી.</p> <p>૬. પુસ્તકાલય, શાખા પુસ્તકાલયો અને ફરતા પુસ્તકાલયોના મેન્ટેનન્સ, રીપેરીંગ, ખરીદી અંગેની કાર્યવાહી.</p> <p>૭. પુસ્તકાલયમાં જુદા જુદા વિભાગોની જરૂરીયાત અનુસાર કન્ટીજન્સી સ્ટેશનરીની ખરીદી, ફાળવણી.</p> <p>૮. ઉપયોગમાં ન લઈ શકાય તેવી ડેડસ્ટોક કન્ટીજન્સી આઈટમો પુસ્તકાલયના રેકોર્ડ પરથી રદ કરાવવી.</p> <p>૯. પુસ્તકાલયમાં ભંગાર જેવી હાલતમાં પડી રહેલી વસ્તુઓની હરાજ કરી નિકાલ કરવો.</p> <p>૧૦. પુસ્તકાલય ભવન અને આનુષ્ઠાનિક તમામ મેન્ટેનન્સ.</p> <p>૧૧. પુસ્તકાલયભવનમાં સફાઈ, સ્વચ્છતા અને સુશોભનનું કાર્ય કરાવવું.</p> <p>૧૨. પુસ્તકાલયના વિકાસમાં વિસ્તરણ અંગેના સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની કામગીરી.</p> <p>૧૩. ગ્રંથપાલશ્રીની સૂચનાથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે કામગીરી સંભાળવાની રહેશે.</p>	<p>(૧) ડેડ સ્ટોક રજીસ્ટર (૨) કન્ટીજન્સી રજીસ્ટર</p> <p>(૩) કન્ટીજન્સી ઈશ્યુ રજીસ્ટર (૪) કન્ડમ રજીસ્ટર</p> <p>(૫) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયોમાં સફાઈ કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ (૬) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલય વિજયનગર સિક્યુરિટી સર્વિસ અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટ ફાઈલ (૭) ટેલિફોન રજીસ્ટર (૮) વિજળી રીપેરીંગ કામગીરી અંગે રજીસ્ટર (૯) પુસ્ત.ના એ.સી. મશીન, વોટર કુલર, ઝેરોક્ષ મશીન રીપેરીંગ તેમજ સર્વિસ અંગેની કોન્ટ્રાક્ટ ફાઈલ (૧૦) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં પ્રિન્ટિંગની કામગીરી અંગે વાર્ષિક કોન્ટ્રાક્ટની ફાઈલ (૧૧) પુસ્તકાલયના મેન્ટેનન્સ અને રીપેરીંગ અંગેના કામોની ફાઈલો (૧૨) પુસ્તકાલયમાં શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે ફોટોગ્રાફ, વિડિયોગ્રાફી કરાવવા અંગેની વાર્ષિક ફાઈલ (૧૩) પુસ્તકાલય તેમજ શાખા પુસ્તકાલયમાં વિજળી રીપેરીંગ કામગીરી અંગેની ફાઈલ (૧૪) પુસ્તકાલયના ઈન્ટરકોમ રીપેરીંગ તેમજ સર્વિસીંગ અંગેની ફાઈલ (૧૫) પુસ્તકાલયના ભવન વિસ્તરણની ફાઈલ (૧૬) શાખા પુસ્તકાલયના પરેશાન તેમજ ગ્રાન્ટ અંગેના પત્રવ્યવહારની ફાઈલ (૧૭) સેન્ટ્રલ સ્ટોર્સની સ્ટેટમેન્ટ મુજબ મંજૂર થયેલ કન્ટીજન્સીની ફાઈલ (૧૮) મેન્ટેનન્સ વિભાગને લગતા વ્યવસ્થાપક મંડળના ઠરાવોની ફાઈલ (૧૯) અ.મ્યુ. કોર્પો.ના મેન્ટેનન્સ વિભાગને લગતા સરક્યુલરની ફાઈલ (૨૦) ઇન્સેન્ટ બુક</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩૪.	પ્રી-ઓડિટ વિભાગ લાયબ્રેરી એટેન્ડન્ટ કામગીરી સંભાળે છે	<p>૧. ઈભ્રેશ કેશના બિલો બનાવવા</p> <p>૨. પુસ્તકાલયમાં આવેલ પુસ્તકો ખરીદીના બિલો બનાવવા</p> <p>૩. જે તે બિલો કપાત નીતિ વિષયક બાબતોના વાંધા, રજી. એડી યાદી જે તે વિભાગના જવાબ રજી.માં નોંધી પાસ કરાવવા મોકલવા</p> <p>૪. ઈભ્રેશના સંદર્ભમાં આવેલ બિલો પ. ખર્ચના બિલો બનાવી ઓડિટ ખાતે મોકલવા</p> <p>૫. પ્રો-પાસ કરેલ બિલોની માહિતી રાખી જે તે ઠરાવો થયા બાદ ઓડિટ ખાતે મોકલવા</p> <p>૬. પોસ્ટેજ ટીકીટો ખરીદી રજી. નોંધી બિલો બનાવવા</p> <p>૭. ઈ.પ્રેશ ખાતે કરેલા ખર્ચ ઈ. કેશ રજી. બનાવી બિલો બનાવવા</p> <p>૮. મેડી રીએભર્સના બિલો બનાવવા</p> <p>૯. બહાર ખાતે આવેલ પત્રોનું ઈન્વર્ટ કરવું</p> <p>૧૦. વિભાગને લગતા વ્ય. મંડળના ઠરાવોની ફાઈલ રાખવી</p> <p>૧૧. ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી તમામ બાબતો.</p>	<p>(૧) ગ્રંથાલય ઠરાવ બુક</p> <p>(૨) બજેટ બુક</p> <p>(૩) જાવક રજીસ્ટર</p> <p>(૪) પોસ્ટેજ રજીસ્ટર</p> <p>(૫) પ્રી-ઓડિટ રજીસ્ટર</p> <p>(૬) ઈભ્રેશ કેશ રજીસ્ટર</p> <p>(૭) ઈન્વર્ટ રજીસ્ટર</p> <p>(૮) પ્રી-ઓડિટ વાંધાનું રજીસ્ટર</p> <p>(૯) મેડીકલ રીએભર્સમેન્ટ રજીસ્ટર</p> <p>(૧૦) પ્રી-ઓડિટને લગતા વ્ય. મંડળના ઠરાવની ફાઈલ</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩૪.	ઇવેન્ટ પ્રોગ્રામર	<p>૧. કાર્યક્રમો</p> <ul style="list-style-type: none"> - સાહિત્યિક - સાંસ્કૃતિક - બાળ કિશોરના કાર્યક્રમો - રમકડા <p>૨. પત્ર વ્યવહાર</p> <p>૩. પ્રેસ</p> <p>૪. પ્રોગ્રામ રજિસ્ટરો-પત્રકો</p> <p>૫. કાર્યક્રમ માટે જરૂરી સાધન સામગ્રી</p> <p>૬. નાણાંકીય બાબતો</p> <p>૭. ઓડિટોરીયમ હોલ</p> <p>૮. કાર્યક્રમાં ભાગ લેનાર વ્યક્તિઓ</p> <ul style="list-style-type: none"> - વ્યક્તિ, સંસ્થાના નામ, સરનામા, ટેલીફોન નંબરો - શ્રોતાઓના રસના વિષયો સાથે નામ, સરનામા, ટેલીફોન નંબરો. <p>૯. પ્રાસંગિક પ્રદર્શનો</p> <ul style="list-style-type: none"> - આર્ટ - પુસ્તકો <p>૧૦. રમકડાંગૃહ</p> <p>૧૧. સુશોભન</p> <p>૧૨. ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવે તેવી તમામ બાબતો.</p> <p>૧૩. પ્રિ-ઓડિટ વિભાગની કામગીરી.</p>	<p>(૧) કાર્યક્રમો અંગેની માહિતીનું રજીસ્ટર</p> <p>(૨) ઓડિટોરીયમ ભાડા આપવાની માહિતીનું રજીસ્ટર</p> <p>(૩) ફોટો રજીસ્ટર</p> <p>(૪) સ્વાગત તેમજ પુરસ્કાર અંગે લાવેલ પુસ્તકોનું જમા રજીસ્ટર</p> <p>(૫) રમકડાં રજીસ્ટર</p> <p>(૬) પ્રદર્શન અન્વયે વાચકોના અભિપ્રાયો અંગેનું રજીસ્ટર</p> <p>(૭) કાર્યક્રમો અંગેની ફાઈલ</p> <p>(૮) પ્રેસનોટ અંગેની ફાઈલ</p> <p>(૯) પત્રવ્યવહારની ફાઈલ</p> <p>(૧૦) ઓડિટોરીયમ ફોર્મની ફાઈલ</p> <p>(૧૧) અગત્યના કાગળોની ફાઈલ</p> <p>(૧૨) ગુજરાતમાં આવેલા પુસ્તકાલયોની યાદીની ફાઈલ</p> <p>(૧૩) સ્યુ. કાઉન્સિલરશ્રીની યાદીની ફાઈલ</p> <p>(૧૪) સાહિત્યકારો/લેખકો/કવિમિત્રોના નામ સરનામાની તેમજ ફોર્મની ફાઈલ</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩૫.			
૩૬.	ટાઇપીસ્ટ	<ol style="list-style-type: none"> ૧. પુસ્તકાલયમાં ટાઈપ અંગેની તમામ કામગીરી. ૨. પુસ્તકોના આદેશો, સ્લીપો, તેમજ તમામ પ્રકારનો પત્ર વ્યવહાર. ૩. પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળના કામો, એજન્ડા, ઠરાવો ટાઈપ કરવા અંગેની કામગીરી. ૪. સ્ટેનશીલ કટ કરવી, સાયકલો સ્ટાઇલ કોપીઓ કાઢવા અંગેની કામગીરી. ૫. પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજ ભાષામાં ટાઈપ રાઈટર મશીન, ઈલેક્ટ્રોનિક ટાઈપ રાઈટર મશીન, કોમ્પ્યુટર ઉપર ટાઈપ અંગેનું કામ કરવાનું રહેશે અને જરૂરી નકલો મેળવી આપવાની રહેશે. ૬. ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે તમામ કામગીરી કરવી. 	

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩૮.	મશીન ઓપરેટર	<p>૧. ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રોનિક્સ મશીનોની સંભાળ</p> <p>૨. મેન્ટેનન્સ વિભાગ મારફતે મરામતકામ અને વાર્ષિક કોન્ફ્રેક્ટ</p> <p>૩. મશીનોની ટેકનિક અને મિકેનિઝમનો અભ્યાસ કરી ઓપરેટ કરવા</p> <p>૪. મશીનો ચાલુ હાલતમાં રાખવા</p> <p>૫. કર્મચારીઓ અને વાયકોને ઝેરોક્ષ સેવાઓ પૂરી પાડવી</p> <p>૬. સાહિત્યિક - સાંસ્કૃતિક પ્રોગ્રામમાં આ ઉપકરણનો ઉપયોગ કરવો અને તે સંબંધી બાબતો</p> <p>૭. ટોકિંગ લાયબ્રેરી અને પ્રતિલિપિ સેવા સંભાળવી</p> <p>૮. ચાલુ હાલતમાં ન હોય તેવા મશીનોનો નિકાલ કરવા જરૂરી કાર્યવાહી કરવી</p> <p>૯. મશીન ચાલુ રાખવા જરૂરી સાધન સામગ્રી, સ્ટેશનરી મેળવવા કાર્યવાહી કરવી</p> <p>૧૦. વાયક સેવાઓ પૂરી પાડવી</p> <p>૧૧. ડોક્યુમેન્ટેશન અને રેફરન્સ સેવાઓની કામગીરી સંભાળવી</p> <p>૧૨. પુસ્તકાલય ભવનનું સુશોભન</p> <p>૧૩. ગ્રંથપાલશ્રી તરફથી સોંપવામાં આવેતી તેવી બાબતો</p>	<p>(૧) પુસ્તકાલયના ઉપયોગ અર્થે અને વાયકોને કાઢી આપેલ ઝેરોક્ષ અંગેનું રજીસ્ટર</p> <p>(૨) ઝેરોક્ષ અંગેની ફીની પહોંચબુક</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૩૮.	સર્વેચર	<ol style="list-style-type: none"> અમદાવાદ ખ્ય. કોર્પો. દ્વારા આપવામાં આવતી સેવાઓ અને ઉપલબ્ધ માહિતીથી નગરજનોને માહિતગાર કરવા. કોમ્પ્યુનિટી રીસર્ચ સેન્ટર અન્વયે બાળકો અને નાગરિકોના સર્વાંગી પાસાઓનું સર્વેક્ષણ કરવું. પુસ્તકાલયોમાં વાચકોના રસના વિષયની વાચનસામગ્રી ખરીદી શકાય તે હેતુથી સર્વે કરી પુસ્તકાલયોને રીપોર્ટસ આપવો. પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી અને સહાયક ગ્રંથપાલશ્રી (વહીવટ) અન્ય જે પણ કામગીરી સૌંપે તે કામગીરી કરવાની રહેશે. વાચનાલય વિભાગમાં કામગીરી કરવાની રહેશે. 	-

શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અદિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગાનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગાનું પત્રક
૪૧.	જુનિ.કોમ્પ્યુટર કમ કલાર્ક	<p>૧. પુસ્તકાલયનો ઉપયોગ કરતા ઉપભોક્તા અને વાચકોની માહિતીની તેટા એન્ટ્રી કરવી.</p> <p>૨. પુસ્તકાલયમાં સંગ્રહ પામેલી વાચન સામગ્રીની વર્ગીકૃત સૂચી-ગ્રંથનામ, લેખક, વિષય અનુસાર કોમ્પ્યુટરમાં તેટા એન્ટ્રી કરવી.</p> <p>૩. મા.જે. પુસ્તકાલય અને શાખા પુસ્તકાલયો ઉપરાંત ફરતા પુસ્તકાલયોની માહિતીની તેટા એન્ટ્રી કરવી.</p> <p>૪. પુસ્તકાલયની વહીવટી, ટેકનીકલ, નાણાંકીય, નીતિ વિષયક બાબતોની માહિતી કોમ્પ્યુટરમાં ફીડ કરવી, નકલો કાઢી આપવી.</p> <p>૫. કર્મચારીઓને કોમ્પ્યુટર અંગેની જાણકારી આપવી.</p> <p>૬. પુસ્તકાલયની આંકડાકીય માહિતીની તેટા એન્ટ્રી કરવી.</p> <p>૭. કોમ્પ્યુટર વિભાગમાં જરૂરી સોફ્ટવેર, પ્રોગ્રામ્ઝિંગ અંગેની કાર્યવાહી કરવી.</p> <p>૮. ગ્રંથપાલશીના આદેશથી અન્ય જે પણ કામગીરી સૌંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે.</p>	

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૪૯.	એટેન્ડન્ટ લાયબ્રેરી (રિન્યુઅલ વિભાગ)	૧. સભ્યપદ નોંધણી કરવી ૨. સભ્યપદ અરજીફોર્મ અંગેની બાબતો ૩. સભ્યપદ વર્ગીકરણ કરવું ૪. સભ્યપદ આઈકાર્ડ / કાર્ડ બનાવવા ૫. સભ્યપદ લવાજમનો હિસાબ કરવો ૬. સભ્યપદ અંગેનો વાર્ષિક અહેવાલ બનાવવો ૭. સભ્યપદ મેળવવા વાયકોને માહિતી આપવી ૮. ગ્રંથપાલશ્રી તેમજ સહાયક ગ્રંથપાલશ્રી દ્વારા સૌંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે.	(૧) હિસાબની નોટબુક (૨) સભ્યપદ નોંધણી રજીસ્ટર (૩) અરજીપત્રક સ્ટોક રજીસ્ટરો (૪) સભ્યપદ અરજીફોર્મ (૫) સભ્યવર્ગીકૃત રજીસ્ટર (૬) સભ્યપદ રેકર્ડ રજીસ્ટર (૭) અનામત પુસ્તક રજીસ્ટર (૮) અગત્યના પત્રોની ફાઈલ (૯) સભ્યપદ લવાજમ પહોંચબુકો
૪૦.	મ્યુ. એટેન્ડન્ટ		

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૪૨ થી ૬૮	એટેન્ડન્ટ લાયબ્રેરી	(૧) વર્ગાકરણ અનુસાર પુસ્તકો ગોઠવવા (૨) ગ્રંથભંડારમાંથી રેદ-બાઈન્ડિંગ તેમજ ટેરમેટરી અંગેના પુસ્તકો અલગ કરવા (૩) વાયક સભ્યોને પુસ્તક શોધવામાં માર્ગદર્શન આપવું તેમજ પુસ્તકો શોધવામાં મદદ કરવી (૪) પુસ્તક આપ-લે વિભાગમાં પરત આવેલા પુસ્તકો ગ્રંથભંડારમાં લઈ જવા અને જે તે જય્યાએ ગોઠવવા (૫) પુસ્તક આપ-લે વિભાગમાં પુસ્તકો ઈશ્યુ કરવા, પરત લેવા અને આવેલા જે તે અતિદેયનો હિસાબ કરવો (૬) પુસ્તક આપ-લે વિભાગમાંથી આપવામાં આવતા કલેઇડ કાર્ડ અંગેના પુસ્તકો ગ્રંથભંડારમાંથી શોધવા (૭) પુસ્તક આપ-લે વિભાગમાં અતિદેય રજીસ્ટર, ઇન્ટરલોન રજીસ્ટર, અતિદેય ટિકિટોના હિસાબનું રજીસ્ટર, પરત ન થયેલ પુસ્તકો અંગે વાયકો તેમજ જામીનદારોને પત્ર વ્યવહાર કરવો (૮) સભ્યપદ નોંધણી અંગેની સમગ્ર કામગીરી સંભાળવી (૯) સામયિક-વર્તમાનપત્રોની નોંધણી, ગોઠવણી તેમજ પસ્તી વેચાણ અંગેની કામગીરી (૧૦) વાયનાલય વિભાગમાં આવતા વાયકોની માગણી મુજબ જૂના વર્તમાનપત્રો, સામયિકો જરૂરિયાત મુજબ શોધીને આપવા (૧૧) પુસ્તકાલયની સામાન્ય પ્રકારની તમામ સેવાઓ (૧૨) પુસ્તક ગોઠવણી માટેના ગાઈડ કાર્ડ, ગોઠવણીના ચાર્ટ અને વાયકોને માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવી. (૧૩) બાઈન્ડિંગ વિભાગની તમામ કામગીરી (૧૪) સતત નિરીક્ષણ (૧૫) પુસ્તકો-સામયિકોની ભૌતિક ચકાસણી (ફીજીકલ વેરીફીકેશન) (૧૬) અનુલય સેવા/રેડી રેફરન્સ (૧૭) ગ્રંથભંડારના આંતરિક વિભાગની ગોઠવણી (૧૮) ટેડસ્ટોક - સારસભાળ (૧૯) જૂ. કલાર્કની અવેજીમાં વહીવટી અને નાણાંકીય સેવાઓ સંભાળવી (૨૦) ગ્રંથપદર્શન માટે ગ્રંથભંડારમાંથી પુસ્તકો શોધવા અને ગોઠવવા (૨૧) પ્રચાર અને પ્રસારના કાર્યો (૨૨) ગ્રંથ સંસ્કરણના કાર્યો કરવા (પીઠ પછી, માથાપછી અને પુસ્તકના અંદરના ભાગે વર્ગાક-સ્થાનાંક વગેરે લખવા) (૨૩) ન્યુ એરાઇવલ્સ સેક્શનની ગોઠવણી (૨૪) ફરતાં પુસ્તકાલયોની સેવાઓ (૨૫) પ્રિ-ઓડિટ વિભાગની કામગીરી (૨૬) પરિગ્રહણ વિભાગની કામગીરી (૨૭) ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે અન્ય કામગીરી કરવાની રહેશે.	-

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૪૩. થી	શાખા પુસ્તકાલયો એટેન્ડન્ટ લાયબ્રેરી	(૧) વર્ગીકરણ અનુસાર પુસ્તકો ગોઠવવા (૨) ગ્રંથભંડારમાંથી ૨૯-બાઈન્ડીંગ તેમજ ડેરમેટરી અંગેના પુસ્તકો અલગ કરવા (૩) વાયક સભ્યોને પુસ્તક શોધવામાં માર્ગદર્શન આપવું તેમજ પુસ્તકો શોધવામાં મદદ કરવી (૪) પુસ્તક આપ-લે વિભાગમાં પરત આવેલા પુસ્તકો ગ્રંથભંડારમાં લઈ જવા અને જે તે જગ્યાએ ગોઠવવા (૫) પુસ્તક આપ-લે વિભાગમાંથી આપવામાં આવતા કલેઇઝ કાર્ડ અંગેના પુસ્તકો ગ્રંથભંડારમાંથી શોધવા (૬) પુસ્તકાલયની સામાન્ય પ્રકારની તમામ સેવાઓ (૭) પુસ્તક ગોઠવણી માટેના ગાઈડ કાર્ડ, ગોઠવણીના ચાર્ટ અને વાયકોને માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવી. (૮) સતત નિરીક્ષણ (૯) અનુલય સેવા/રેડી રેફરન્સ (૧૦) ગ્રંથભંડારના આંતરિક વિભાગની ગોઠવણી (૧૧) ગ્રંથપ્રદર્શન માટે ગ્રંથભંડારમાંથી પુસ્તકો શોધવા અને ગોઠવવા (૧૨) પ્રચાર અને પ્રસારના કાર્યો (૧૩) ગ્રંથ સંસ્કરણના કાર્યો કરવા (પીઠ પઢ્ઠી, માથાપઢ્ઠી અને પુસ્તકના અંદરના ભાગે વર્ગીક-સ્થાનાંક વર્ગેરે લખવા) (૧૪) ન્યુ એરાઈવલ્સ સેક્શનની ગોઠવણી (૧૫) ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સૌંપવામાં આવે તે અન્ય કામગીરી કરવાની રહેશે.	-
૪૬. ૬૩. ૬૭. ૩૭. ૮૮. ૫૦. ૮૫. ૮૬. ૮૭. ૧૦૦. ૧૦૩. ૧૧૫.	સફાઈ કામદાર ટાઈપીસ્ટ પટાવાળા ફરાસ સફાઈ કામદાર		

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૪૪.	એટેન્ડન્ટ લાયબ્રેરી	(૧) વર્ગિકરણ અનુસાર પુસ્તકો ગોઠવવા (૨) ગ્રંથભંડારમાંથી રદ-બાઈન્ડિંગ તેમજ ટેરમેટરી અંગેના પુસ્તકો અલગ કરવા (૩) વાચક સભ્યોને પુસ્તક શોધવામાં માર્ગદર્શન આપવું તેમજ પુસ્તકો શોધવામાં મદદ કરવી (૪) પુસ્તક આપ-લે વિભાગમાં પરત આવેલા પુસ્તકો ગ્રંથભંડારમાં લઈ જવા અને જે તે જગ્યાએ ગોઠવવા (૫) પુસ્તક આપ-લે વિભાગમાંથી આપવામાં આવતા કલેઇઝ કાર્ડ અંગેના પુસ્તકો ગ્રંથભંડારમાંથી શોધવા (૬) પુસ્તકાલયની સામાન્ય પ્રકારની તમામ સેવાઓ (૭) પુસ્તક ગોઠવણી માટેના ગાઈડ કાર્ડ, ગોઠવણીના ચાર્ટ અને વાચકોને માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા કરવી. (૮) સતત નિરીક્ષણ (૯) અનુલય સેવારેડી રેફરન્સ (૧૦) ગ્રંથભંડારના આંતરિક વિભાગની ગોઠવણી (૧૧) ગ્રંથપ્રદર્શન માટે ગ્રંથભંડારમાંથી પુસ્તકો શોધવા અને ગોઠવવા (૧૨) પ્રચાર અને પ્રસારના કાર્યો (૧૩) ગ્રંથ સંસ્કરણના કાર્યો કરવા (પીઠ પદ્ધી, માથાપદ્ધી અને પુસ્તકના અંદરના ભાગે વર્ગીક્રિસ્ટનાંક વગેરે લખવા) (૧૪) ન્યુ એરાઈવલ્સ સેક્શનની ગોઠવણી (૧૫) ગ્રંથપાલશ્રીના આદેશથી અન્ય જે પણ કામગીરી સોંપવામાં આવે તે અન્ય કામગીરી કરવાની રહેશે.	-
૪૭.	ગ્રંથભંડાર		
૪૮.	રેફરન્સ વિભાગ		
૫૯.			
૬૫.			
૬૬.			

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૫૧.	એટેન્ડન્ટ લાયબ્રેરી (બાઈન્ડીંગ વિભાગ)	<p>૧. ગ્રંથભંડારમાંથી આવેલ ફાટી ગયેલ કે ઉપયોગમાં ન આવી શકે તેવા જે તે પુસ્તકો બાઈન્ડીંગ માટે તેમજ રદ કરવા માટે અલગ કરવા</p> <p>૨. બાઈન્ડીંગ અંગેના પુસ્તકોની નોંધ ટ્રીપ્લીકેટ રજીસ્ટરમાં કરી તેના પાના પ્રમાણે બંડલો બનાવવા</p> <p>૩. વર્ષ દરમ્યાન જુદા જુદા પ્રકારના પુસ્તકો બાઈન્ડીંગ કામ અંગે જે તે વેપારીઓ પાસે કામ કરાવવા માટે ભાવ મંગાવવા તેમજ જે તે આવેલ ભાવો મંજૂર કરવા માટે વ્યવસ્થાપક મંડળ સમક્ષ રજૂ કરવા</p> <p>૪. જે તે માન્ય બાઈન્ડરને પુસ્તકો બાઈન્ડીંગ કરાવવા માટે ઓર્ડર આપવો અને બાઈન્ડીંગ માટે પુસ્તકો આપવા.</p> <p>૫. બાઈન્ડીંગ થઈને પુસ્તકો પરત આવે ત્યારે આપેલ ઓર્ડર મુજબ પરત આવેલ પુસ્તકો ચકાસવા.</p> <p>૬. બાઈન્ડીંગ થઈને આવેલ પુસ્તકોનું જે બીલ આવ્ય હોય તેની ચૂકવણી અંગેની કામગીરી કરવી</p> <p>૭. રદ કરવા યોગ્ય પુસ્તકોનું ટુલ્પીકેટ રજીસ્ટરમાં નોંધ કરવી</p> <p>૮. રદ થયેલ પુસ્તકોને જે તે સંસ્થાઓએ પુસ્તકોની માંગણી કરી હોય તેમણે ગ્રંથપાલશ્રીના આદેશ મુજબ બાઈન્ડીંગ તેમજ રદની પ્રક્રિયા અનુસારિક પત્ર વ્યવહાર કરવો.</p> <p>૯. ગ્રંથપાલશ્રી તરફથી સૌંપવામાં આવે તેવી તમામ બાબતો.</p>	<p>(૧) પુસ્તકાલયના જુદા જુદા વિભાગોના પુસ્તકો તેમજ સામયિકો બાઈન્ડીંગ કરાવવા માટે</p> <p>(૨) સરક્યુલરથી ભાવો મંગાવવા માટેના પત્રોની ફાઈલ</p> <p>(૩) આવેલ ભાવોનું તુલનાત્મક પત્રક, મંજૂર થયેલ જે તે વેપારીના ભાવો, બ્ય. મંડળના ઠરાવ અંગેની ફાઈલ</p> <p>(૪) પુસ્તકો બાઈન્ડીંગ કરાવવા માટે નોંધવામાં આવતું ટ્રીપ્લીકેટ બાઈન્ડીંગ રજીસ્ટર</p> <p>(૫) પુસ્તકો રદ કરવા માટે ટુલ્પીકેટ રદ રજીસ્ટર</p> <p>(૬) રદ થયેલાં પુસ્તકોનું નોંધણી માટેનું રદ રજીસ્ટર</p> <p>(૭) રદ થયેલાં પુસ્તકો બેટ આપવા માટે અન્ય સંસ્થા દ્વારા આવેલ પત્રોની નોંધ માટેનું રજીસ્ટર</p> <p>(૮) બેટ આપેલાં પુસ્તકો અંગેના પત્રોની ફાઈલ</p> <p>(૯) બાઈન્ડીંગ કરેલ પુસ્તકોના બિલો નોંધવાનું રજીસ્ટર</p> <p>(૧૦) વાંધા અંગેની ફાઈલ</p> <p>(૧૧) અગત્યના કાગળ અંગેની ફાઈલ</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોગર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૬૧.	ફરતા પુસ્તકાલયો એટે.લાયબ્રેરી મ્યુ. એટેન્ડન્ટ	(૧) ફરતા પુસ્તકાલયની વાન જે તે સેવાકેન્દ્રો પર નિયમીત સમયસર સેવા આપે તે મુજબ વ્યવસ્થા કરવી. (૨) સભ્યપદ નોંધણી (૩) ઉપયોગમાં ન લઈ શકાય તેવા પુસ્તકો રદ કરવા યાદી બનાવવી વ્યવસ્થાપક મંડળ સમક્ષ મુકવા કાર્યવાહી કરવી. (૪) પુસ્તકો વાચકોને ઈશ્યુ કરવા તેમજ પરત મેળવવા. (૫) બાઈન્ડીંગ અંગેની કામગીરી કરવી (૬) વાનના મેન્ટનન્સ અને રીપેર્સ અંગેની કામગીરી (૭) વાનનો ઈન્શ્યોરેન્સ, આર.ડી.ઓ.પાસિંગને આનુષાંગિક કામગીરી (૮) ડીજલ-ઓર્ડિલ વિગેરેના બિલો તેમજ સભ્યપદ / અરજફોર્મનો હિસાબ કરવો. (૯) અરજફોર્મ સ્ટોકપત્રક બનાવવું. (૧૦) પુસ્તકો પરત મેળવવા પત્રવ્યવહાર કરવો. (૧૧) ઈશ્યુ થયેલ પુસ્તકો તેમજ સભાસદોને વર્ગીકૃત માહિતી અને વાર્ષિક અહેવાલ અંગે. (૧૨) ગ્રંથાલયમાંથી પુસ્તકો વાનમાં મુકવા તેમજ પુસ્તકો વ્યવસ્થિત ગોઠવવા. (૧૩) વાચકો દ્વારા ખોવાયેલા પુસ્તકો અંગે રીપ્લેશ લેવા કે અનામત પુસ્તક કિંમત વસુલ કરવી. (૧૪) પુસ્તકોનું ગ્રંથસંસ્કરણ (પીટ્ટી, માથાપટ્ટી અને સ્થાનાંક લખવા) (૧૫) ગ્રંથ સંસ્કરણ (પેસ્ટીંગ, સિક્કા) કરવા.	(૧) રિપેરીંગ તેમજ ડીજલ રજીસ્ટર (૨) સભ્યપદ રજીસ્ટર (૩) સભ્યપદ પહોંચબુકો (૪) દૈનિક ઈશ્યુ રિપોર્ટની ફાઈલ (૫) સભ્યપદ અરજફોર્મ સ્ટોક રજીસ્ટર (૬) સભ્યપદ અરજફોર્મ (૭) હિસાબની નોટ (૮) લોગબુક
૭૮.	ડ્રાઇવર	(૨) વાન સફાઈ કરવી. (૩) ડ્રાઇવરને સાઈડ બતાવવામાં સહાય કરવી. (૪) પુસ્તકો આપ-લેના કાર્યમાં મદદ કરવી. (૫) અરજફોર્મનું વેચાણ કરવું. (૬) ગ્રંથપાલશ્રી તેમજ સહા. ગ્રંથપાલ દ્વારા સોંપવામાં આવે તે કામગીરી કરવાની રહેશે.	
૮૧.	પટાવાળા/ફરાસ		
૮૨.			
૮૩.			

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૭૭.	ભ્યુઝિયમ એટેન્ડન્ટ	<p>૧. પુસ્તકાલયમાં આર્ટ અને પિકચર ગેલેરીની સેવાઓ.</p> <p>૨. બાળકિશોર વિભાગમાં બાળ સંગ્રહાલયની સેવાઓ.</p> <p>૩. પેપર કલીપીંગ અને ગોઠવણી.</p> <p>૪. ગ્રંથ પ્રદર્શન, ચાર્ટ પ્રદર્શન સેવાઓ.</p> <p>૫. રેડી રેફરન્સ સર્વિસીઝ.</p> <p>૬. અનુલયસેવા - માહિતી સેવા.</p> <p>૭. એજયુકેશનલ - વોકેશનલ ગાઈન્ડસ સેવાઓ.</p> <p>૮. પેન્ફલેટિસ ડિસ્પલે.</p> <p>૯. ડિઝીટલ લાયબ્રેરીની સેવાઓ.</p> <p>૧૦. વાચક સેવાઓ.</p> <p>૧૧. બ્રેલ અને ટોકિંગ લાયબ્રેરી સર્વિસીઝ.</p> <p>૧૨. પ્રતિલિપી સેવાઓ.</p> <p>૧૩. આર્ટ અને પિકચર્સના ઉપકરણોની સારસંભાળ.</p> <p>૧૪. કોમ્પ્યુટર અને ઇન્ફરમેશન ટેકનોલોજી વિભાગની સેવાઓ.</p> <p>૧૫. પુસ્તકાલયભવન સુશોભન સેવાઓ.</p> <p>૧૬. ગ્રંથપાલશ્રીની સુચનાથી અન્ય જે પણ કામગીરી સૌંપવામાં આવે તે તમામ કામગીરી.</p>	<p>(૧) પેપર કલીપીંગ અંગેની ફાઈલ</p> <p>(૨) અમદાવાદ/સ્થાનિક ઈતિહાસ અંગેના પુસ્તકોની યાદી</p> <p>ગ્રંથાલય શાખ અભ્યાસક્રમ</p> <p>(૩) એડમિશન ફોર્મ અંગેની ફાઈલ</p> <p>(૪) એડમિશન રજીસ્ટર</p> <p>(૫) એડમિશન ફી પહોંચબુક</p> <p>(૬) અભ્યાસક્રમ અંગેના પુસ્તકોનું રજીસ્ટર</p> <p>(૭) વિદ્યાર્થીઓને ઈશ્યુ કરેલ પુસ્તકનું રજીસ્ટર</p> <p>(૮) હિસાબની નોટબુક</p> <p>(૯) સીડી સભ્યપદ ડિપોজીટ ટેમ્પ લવાજમ પહોંચબુક</p> <p>(૧૦) સીડી સભ્યપદ રજીસ્ટર</p> <p>(૧૧) સીડી સભ્યપદ અનામત પરત રજીસ્ટર</p> <p>(૧૨) સીડી નોંધણી રજીસ્ટર</p> <p>(૧૩) હિસાબની નોંધ</p>

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્દો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૮૦.	ડાઈવર	૧. ફરતું બાળ પુસ્તકાલય, ફરતુ મહિલા પુસ્તકાલય, સાયન્સ એન્ડ ટેકનોલોજી મોબાઇલ લાયબ્રેરીના નિયત કરેલા રૂટો પ્રમાણે સમયસર વાહનો ચલાવવા, નિયત સ્ટેન્ડો ઉપર વાહનો ઉભા રાખવા. ૨. વાહનોની સફાઈ - સારસંભાળ રાખવી. ૩. વાહનોનું પાસીંગ, ટેક્ષ ભરવા, વિમો ભરવા. ૪. વાહનોનું મેન્ટેનન્સ. ૫. પેટ્રોલ / ડિઝલ પુરાવવું. વપરાશની નોંધ રાખવી. ૬. વાહનોનું સુશોભન.	૧. લોગ બુક
૮૧.			
૮૨.			

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૨ - અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો
પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૬ - પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

ક્રમ	હોદ્ડો	સત્તાઓ / ફરજો	દસ્તાવેજોના વર્ગોનું પત્રક
૮૩ થી	વર્ગ-૪ પટાવાળા	૧. પુસ્તકાલયમાં ફર્નિચરની સફાઈ	-
૮૪ ૮૮ થી	ફરાસ માળી સફાઈ કામદાર	૨. પુસ્તકાલયમાંથી ખ્ય. કોર્પોરેશન કે અન્ય સ્થળે ટપાલ લઈ જવાનું કામ, સામયિક મેગેઝીનનું લવાજમ ભરવાનું કે પોસ્ટ ઓફિસમાં મનીઓર્ડર કરવા અંગે.	
૮૩ ૮૫ થી		૩. નવા આવતા પુસ્તકોના ગ્રંથસંસ્કાર - પેસ્ટિંગ, સિક્કા મારવા અંગેનું કામ ૪. પુસ્તકાલયના જે તે વિભાગમાંથી પુસ્તકો લાવવા તેમજ લઈ જવા, ફાઈલિંગ કરવું. જે તે રેકોર્ડની વ્યવસ્થિત ગોઠવણી કરવી.	
૧૦૬ ૧૧૧ ૧૧૩ ૧૧૫ થી		૫. માળીએ પુસ્તકાલયના ગાર્ડનના ઝાડ-પાન, લોન વગેરેની જગ્યાવણી કરવી. ગાર્ડનમાં પાણી મૂકવાની કામગીરી કરવી	
૧૧૬		૬. પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી તેમજ સહાયક ગ્રંથપાલશ્રીના આદેશ મુજબ જે તે કામગીરી કરવાની રહેશે.	

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-ઓક્ટીવ ડિસ્કલોઝર નં. ૩
દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ

શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૩

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

૩:૧ અમદાવાદ ખ્ય. કોર્પોરેશન, સેન્ટ્રલ ઓફિસ, નાણાં ખાતુ અને અન્ય ખાતાઓએ નિયત કરેલ નિતીનિયમો અને કાર્યપદ્ધતિનો અમલ કરવામાં આવે છે.

૩:૨

૧. બી.પી.એમ.સી. એક્સ્ટ્રીક્ચર
૨. અ.ખ્ય.કોર્પો. મેન્યુઅલ
૩. મા.જે. પુસ્તકાલય ટ્રસ્ટ ડીઝ
૪. મા.જે. પુસ્તકાલય નિયમાવલી

૩:૩ **NIL**

૩:૪ (૧) નિર્ણય લેવા માટે વહીવટી વિભાગમાં

- હેડકલાર્ક
- ઓફિસ સુપ્રિ. / એકાઉન્ટન્ટ
- સહાયક ગ્રંથપાલ
- ગ્રંથપાલ
- અ.ખ્ય. કોર્પો.ના અધિકારીઓ / A.M.C. / Dy. M.C.
- વ્યવસ્થાપક મંડળ

(૨) પુસ્તક ખરીદી અંગે

- વિભાગ ઈન્ચાર્જ
- સહાયક ગ્રંથપાલ
- ગ્રંથપાલ
- પુસ્તક પસંદગી સમિતી

૩:૫ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

- અ.ખ્ય. કોર્પો. સ્ટેન્ડિંગ કમિટી
- અ.ખ્ય. કોર્પો. જનરલ બોર્ડ

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૪-૫

પુસ્તકાલયના કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો તથા કાર્યો બજાવવા માટેના
નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ, દફ્તરો

શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૪-૫

પુસ્તકાલયના કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો તથા કાર્યો બજાવવા માટેના
નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ, દફ્તરો

૪ મા.જે. પુસ્તકાલય અંગે અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન મુજબની કાર્યપદ્ધતિ અનુસાર નિયત કરવામાં આવેલ ધોરણો તથા સેન્ટ્રલ ઓફિસ દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતી સ્થાયી સુચનાઓ મુજબના ધોરણો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.

૫ : ૧ પુસ્તકાલયના કાર્યો બજાવવા માટે નીચે મુજબના નિયમો, વિનિમયો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને દફ્તરોને અનુસરવામાં આવે છે.

૧-૧ : મા.જે. પુસ્તકાલય ટ્રસ્ટ ડિઝની

૧-૨ : મા.જે. પુસ્તકાલય નિયમાવલી

૧-૩ : બી.પી.એમ.સી. એક્ટ,
અમદાવાદ મહાનગર પાલિકા, અમદાવાદ.

૧-૪ : અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન - મેન્યુઅલ
અમદાવાદ મહાનગર પાલિકા, અમદાવાદ.

૧-૫ : નાણાં ખાતુ, સરક્યુલર નં. ૨૦ તા. ૨૧-૬-૮૮
કર્મચારીની રજાઓ અંગેના નિયમો
અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ.

૧-૬ : અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન
સેન્ટ્રલ ઓફિસ, નાણાં ખાતુ અને અન્ય ખાતાઓએ
નિયત કરેલ નીતિ-નિયમો અને કાર્ય પદ્ધતિનો અમલ કરવામાં આવે છે.

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલીસબ્રિજ, અમદાવાદ-૬.

સામાન્ય નિયમો

શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

(સ્થાપના વર્ષ : ૧૫ એપ્રિલ, ૧૯૩૮)

-: નિયમો :-

પુસ્તકાલય ખુલ્લં રહેવાનો સમય

૧. શેઠ મા.જી. પુસ્તકાલય - મુખ્ય પુસ્તકાલયનું વાચનાલય સવારના ૭.૩૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. (જાહેર રજા સિવાય)

રવિવાર તથા અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશને મંજૂર કરેલ જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં શાખા પુસ્તકાલય વિજયનગર તથા હિમતલાલ પાર્કના જુદા જુદા વિભાગોનો સમય નીચે મુજબ રહેશે.

માહે માર્યથી ઓક્ટોબર

- આપ-દે વિભાગ સવારના ૭.૩૦ થી સાંજના ૭.૩૦
- વાચક સત્યપદ નોંધણી અને બાલ-કિશોર વિભાગ સવારના ૭.૩૦ થી સાંજના ૭.૩૦
- માહે નવેમ્બર થી ફેબ્રુઆરીમાં તમામ વિભાગોનો સમય સવારે ૮ થી સાંજના ૭.૩૦ કલાક સુધીનો રહેશે.
- શાખા પુસ્તકાલય કાલુપુર અને નરોડાનો સમય સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૦નો રહેશે.
- શાખા પુસ્તકાલય સરસપુર અને અમરાઈવાડી વાચનાલયનો સમય સવારના ૧૦.૩૦ થી ૬.૧૦ તમામ શાખા પુસ્તકાલયો શુક્વાર અને જાહેરરજાના દિવસે બંધ રહેશે.
- શાખા પુસ્તકાલય હિમતલાલ પાર્ક - આંબાવાડી પુસ્તકાલયનો સમય માર્ય થી ઓક્ટોબર સવારના ૭.૩૦ થી રાત્રે ૮.૦૦ અને નવેમ્બરથી ફેબ્રુઆરી સવારના ૮.૦૦ થી રાત્રે ૮.૦૦
- આત્મા સાયંસ એન્ડ ટેકનોલોજી લાયબ્રેરીનો સમય સોમવારથી શુક્વાર સવારના ૭.૩૦ થી સાંજના ૧૦.૦૦ કલાક અને શાનિવારે સવારના ૭.૩૦ થી સાંજના ૨.૩૦ કલાક.
- ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સુબોધ સાગર સુરિશ્વરજી મહારાજશ્રી લાયબ્રેરી - વાસણા પુસ્તકાલયનો સમય માર્ય થી ઓક્ટોબર સવારના ૭.૩૦ થી રાત્રે ૮ અને નવેમ્બરથી ફેબ્રુઆરી સવારના ૮ થી રાત્રે ૮.

-: દાખલ થવાના અને બીજા નિયમો :-

૨. દરેક કોમ તથા ધર્મના માણસો પુસ્તકાલયનો લાભ લઈ શકશે, પરંતુ અવ્યવસ્થિત, અસ્થિર મગજના, નશામાં હોય તેવી કોઈ પણ વ્યક્તિને દાખલ થવા દેવામાં આવશે નહિ.
- નોંધ : આ સંબંધમાં ગ્રંથાલયીની ગેરહાજરી દરમ્યાન તેમના મદદનીશનો નિર્ણય છેવટનો ગણાશે.
૩. પુસ્તકાલયમાં ધુમ્રપાન, ગૂટકા ચાવવાની, થૂંકવાની કે મોટેથી વાત કરવાની સખત મનાઈ રહેશે. બીજા વાચક કે સત્ય વાંધો ઉઠાવે તો તેવા સંજોગોમાં મૌન પાળવું આવશ્યક ગણાશે.
૪. પુસ્તકાલયનો લાભ લેવા આવનાર દરેક દરવાજે પગી કાઉન્ટર પર રાખેલા પત્રકમાં પોતાનું નામ સ્પષ્ટ અક્ષરે લખવું પડશે. પુસ્તકાલયના નિયમો પાળવા પોતે કબૂલ થાય છે એવી ખાતરી આપેલી ગણાશે. પત્રકમાં પોતાનું નામ નહિ લખનારને દાખલ થવા દેવામાં આવશે નહિ તેમજ તે અંગેનો ગ્રંથાલયી (અથવા તેમની ગેરહાજરી દરમ્યાન તેમના મદદનીશનો) નિર્ણય છેવટનો ગણાશે.
૫. લાકડી, ઓવરકોટ, છત્રી, બેગ, થેલો, કોઈ પણ પ્રકારની થેલી, પુસ્તકો તથા બીજી જે ચીજો પુસ્તક આપ-દે કરનાર કારકુન બહાર રાખવા જગ્યાવે તે બહાર રાખ્યા પછી જ અંદર દાખલ થઈ શકશે. ગ્રંથાલયમાં ફરી દાખલ થવા ઈચ્છા દરેક સત્યે ઘેર વાંચવા માટે લીધેલાં પુસ્તકો બહાર મૂકીને જ અંદર આવવું આવશ્યક રહેશે.

૬. કોઈપણ વાચક સત્યને પ્રાણીઓ સાથે લઈ અંદર દાખલ થવા દેવામાં આવશે નહિ.
૭. પુસ્તકાલયમાં સંપૂર્ણ શાંતિ જાળવવી જોઈશે.
૮. નવાં પુસ્તકો મંગાવવા માટેની સૂચનાઓ ખાસ પત્રકમાં આપેલી વિગતો ભરીને સત્યો કરી શકશે.
૯. પુસ્તકાલયના નિયમોનું પાલન નહિ કરનાર સત્યની ટિકિટનો ઉપયોગ ગ્રંથાલયી ગમે ત્યારે બંધ કરી શકશે, તેમજ તેમને પુસ્તકો આપવાની, વાચનાલય તથા અધ્યયન વિભાગનો ઉપયોગ કરવાની મનાઈ પણ કરી શકશે, પણ આવા સત્યો અથવા વાચકો વ્યવસ્થાપક મંડળ સમક્ષ પોતાની હકીકતો રજૂ કરી ગ્રંથાલયીના નિર્જય સામે અપીલ કરી શકશે.
૧૦. પુસ્તકાલયમાં પુસ્તકો તથા બીજી માલમિલકતને નુકસાન કરવા બદલ તથા વાચન સામગ્રી ખોવા બદલ નુકસાન કરનાર જે તે વાચક સત્ય જવાબદાર ગણાશે, અને તેમણે તે પુસ્તકાલયમાં નવાં વસાવી આપવાં પડશે. ખોવાયેલું પુસ્તક બજારમાં અલભ્ય હોય તો તે નવું ખરીદવા માટેની હાલની પૂરેપૂરી દોઢી કિંમત તથા તે મેળવવાનો ખર્ચ ભરપાઈ કરી આપવો પડશે અને જો આવું પુસ્તક મેળવવાનું અશક્ય થઈ પડશે તો ગ્રંથાલયીને એવા પુસ્તકની જે કિંમત નક્કી કરે તે વાચક સત્યે તાત્કાલિક ભરી દેવાની રહેશે. પુસ્તકાલયના એક આખા સેટમાંથી કોઈ પણ એક પુસ્તકને પણ નુકસાન કર્યું હશે અગર ખોવાયું હશે તો આખો સેટ નવો વસાવી આપવો પડશે. અથવા આખા સેટની હાલની દોઢી કિંમત ભરવાની રહેશે.

-: અધ્યયન વિભાગ :-

૧૧. ગ્રંથાલયીની પરવાનગી સિવાય ચિત્રો કે સ્કેચની પ્રતિકૃતિ કરી શકાશે નહિ.
૧૨. પુસ્તકાલયના કોઈપણ પુસ્તક, સામયિક કે નકશા પર કોઈ જાતનું લખાણ લીટા કે નોંધ કરી નુકશાન કરી શકશે નહિ.
૧૩. આપ-લે વિભાગમાંના પુસ્તકોમાંનું નવલકથાઓ સિવાયનું કોઈ પણ પુસ્તક વપરાશમાં નહિ હોય ત્યારે અધ્યયન વિભાગમાં બેસી વાંચવા માટે માગી શકાશે, આપ-લે વિભાગમાંથી જો આવા પુસ્તકની માંગણી આવશે તો તે તાત્કાલિક પરત કરવું પડશે; પરંતુ કોઈ પણ સંજોગોમાં તે તથા અધ્યયન વિભાગનાં પુસ્તકોમાંનું કોઈ પણ પુસ્તક અધ્યયન વિભાગની બહાર વાચકથી લઈ જઈ શકાશે નહિ.
૧૪. અધ્યયન વિભાગમાં કોઈ પણ વ્યક્તિને નોટબુક, ડાયરી તથા અન્ય કાગળો લઈ જવા દેવામાં આવશે નહિ. આ બાબતમાં ગ્રંથાલયી અથવા તેમની ગેરહાજરીમાં તેમના મદદનીશનો નિર્ણય છેવટનો તથા બંધનકર્તા ગણાશે.
૧૫. અધ્યયન વિભાગમાંથી બહાર જતાં પહેલાં વાચકોએ પુસ્તક, એટલાસ, સામયિક વગેરે જે કાંઈ ઉપયોગ કરવા લીધું હોય તે અધ્યયન વિભાગમાં હાજર રહેલા પુસ્તકાલયના કર્મચારીને પાછુ સૌંપવું અને તે અંગેની તે કર્મચારીને પરત આખ્યા અંગેની રજીસ્ટરમાં સહી લેવી. જો તે પ્રમાણે સહી લેવાશે નહિ તો તેની જવાબદારી સત્યને શિરે રહેશે.

-: આપ-લે વિભાગ :-

૧૬. પુસ્તકાલયના સત્યોને જ પુસ્તકાલયની બહાર વાંચવા માટે પુસ્તકો આપી શકાશે. સત્ય થવા ઈચ્છનારે નક્કી કરેલા ફોર્મ ઉપર અરજી કરવી પડશે. અરજી સાથે પોતાના રહેઠાણના પૂરાવાની ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઈઝના પોતાના બે ફોટો આપવા તથા પરિશિષ્ટમાં જણાવેલા જામીનદારોમાંથી કોઈ પણ એકની પાસે જામીનગીરીનું ફોર્મ ભરાવી લાવવું પડશે. જામીનગીરી આપનાર જામીનદાર રહેવાનું ના પાડે અગર તેમનું અવસાન થાય તો તેવા સત્યોને તેટલી મુદ્દત માટે જ સત્ય તરીકે ગણવામાં આવશે.
૧૭. અરજી તથા જામીનગીરીનું ફોર્મ ભરીને સત્યે તે ગ્રંથાલયી અથવા તેમના મદદનીશને આપવું પડશે. જામીનદારની સહીના ખરાપણાની ખાતરી કરી લઈ, અરજી મળ્યા પછી અરજી કરનારને મા.જે. પુસ્તકાલયમાં કોમ્પ્યુટરાઈઝ્ડ

કાર્ડ અને શાખા પુસ્તકાલયોમાં ટીકીટો આપવામાં આવશે. ટિકિટ આખ્યા પહેલાં સભ્યે ટિકિટો ઉપર તથા ઓળખપત્ર પર પોતાની પૂરી સહી કરવી પડશે.

જામીનગીરી આપનાર તરીકે જેમને માન્ય રાખ્યા છે તેઓ અરજીપત્રક ભરી સભ્ય થઈ શકશે.

૧૮. પુસ્તકાલયમાં વાચક તરીકે સભ્યપદ મેળવવા જે તે વાચક સભ્યપદ ફી નું ધોરણ નીચે પ્રમાણેનું રહેશે.

ક્રમ વાચક સભ્યપદનો પ્રકાર	સભ્યપદની મુદ્દત	સભ્યપદ નિપોઝીટ રૂ. (રીફિનેબલ)	સભ્યપદ લવાજમ રૂ.	ઓળખપત્ર આપવામાં આવશે	વાચક ટિકિટો આપવામાં આવશે

૧. વાચનાલય અને સામાચિક વિભાગના વાચકો	-	-	મુક્ત પ્રવેશ	-	-
૨. વધુસ્કૃ વાચક	વાર્ષિક	૩૦૦	૨૦૦.૦૦	૧	૨
વધુસ્કૃ વાચક	આજીવન	-	૧૫૦૦.૦૦	૧	૪
૩. બા.ક્રિ.વિ.ના વાચકો (૧૪ વર્ષ સુધી)	વાર્ષિક	૩૦૦.૦૦	૨૦૦.૦૦	૧	૨
	આજીવન	-	૧૫૦૦.૦૦	૧	૪

ડિજિટલ લાયબ્રેરી

૧. વધુસ્કૃ વાચક અને બાળકો (૧૪ વર્ષ સુધી)	વાર્ષિક	૧૫૦.૦૦	૧૫૦.૦૦	૧	-
	આજીવન	-	૫૦૦	૧	-

૧. ઉપરોક્ત વ્યવસ્થાનો અમલ મા.જે. પુસ્તકાલય, શાખા પુસ્તકાલયો, ડિજિટલ લાયબ્રેરી અને ફરતા પુસ્તકાલયોમાં કરવામાં આવેલ છે.

૨. મહિલાઓ, વિદ્યાર્થીઓ, વિશિષ્ટ વાચકોને પણ વધુસ્ક વિભાગના જ કાર્ડ આપવામાં આવશે.

૧૯. એક વર્ષ માટે સભ્યપદ મેળવનાર વાચક સભ્યને બે પુસ્તકો આપવામાં આવશે અને વાચકને એક સાથે બે પુસ્તકો વાંચવા મળી શકશે. વાચક સભ્ય પુસ્તકો બહાર લઈ જવા માટેની અરજી કોઈ પણ કારણો જણાવ્યા સિવાય ગ્રંથાલયી નામંજૂર કરી શકશે. આજીવન વાચક સભ્યને એક સાથે ચાર પુસ્તકો મેળવી શકશે.

૨૦. સભ્યોને તેમની ટિકિટના બદલામાં જ પુસ્તકો આપવામાં આવશે. સભ્ય પુસ્તક પાછું આપે ત્યારે તેમને ટિકિટ પાછી આપી દેવામાં આવશે; પણ જો ઠરાવેલી મુદ્દતની અંદર પુસ્તક પાછું નહિ આપવામાં આવ્યું હોય તો પુસ્તકનો અતિદેય તથા એને લગતી માહિતી આપવા માટે મોકલાવેલી સૂચનાનો ટપાલખર્ચ સભ્ય આપે તે પછી જ તેમને ટિકિટ પાછી આપવામાં આવશે.

૨૧. કોઈ પણ સભ્ય પોતાની ટિકિટ બીજાને વાપરવા આપી શકશે નહિ.

૨૨. સામાચિકો, કોશો, રેફરન્સ વિભાગ, રેડી રેફરન્સના પુસ્તકો તથા બીજા અધ્યયન વિભાગનાં પુસ્તકો પુસ્તકાલયની બહાર આપવામાં આવશે નહિ.

૨૩. માત્ર પુસ્તકાલયના સભ્યોને જ પુસ્તક ભંડારમાં દાખલ થવા દેવામાં આવશે. પુસ્તકાલયમાં રાખેલી સૂચિ ઉપરથી પોતાને જોઈતાં પુસ્તકોની વિગતો પુસ્તક-માગણીની ચિહ્ની પર નોંધી પુસ્તક આપનાર સેવકને આપવાથી તે પુસ્તકો મેળવી શકશે. અથવા વાચક જાતે ગ્રંથભંડારમાંથી પુસ્તક શોધીને મેળવી શકશે.

૨૪. પુસ્તક લેતી વખતે એ સારી હાલતમાં છે કે નહિ તે સભ્યે તપાસી લેવું અને જો સારી હાલતમાં ન હોય તો તે તરફ ગ્રંથાલયી અથવા તેમની ગેરહાજરીમાં તેમના મદદનીશનનું ધ્યાન દોરવું. જો તે પ્રમાણે કરવામાં નહિ આવે તો

પુસ્તક પાછું આપતી વખતે જે સ્થિતિમાં હશે તે સ્થિતિની જવાબદારી સત્યને શિરે રહેશે, અને તે અંગે ગ્રંથાલયી નક્કી કરે તે મુજબની નુકસાની ભરપાઈ કરી આપવી પડશે.

૨૫. વાંચવા લીધેલાં પુસ્તકોના તિથિપત્રકમાં છેલ્લે દર્શાવેલી તારીખે મોડામાં મોડાં પુસ્તકાલયમાં આપી દેવાં જોઈશે. પુસ્તક વધારે દિવસ માટે રાખવું હોય તો તેની અગાઉની મુદ્દત પૂરી થયા પહેલાં તારીખ ફરી નોંધાવી જવાથી રિન્યુ કરી શકશે. જો કોઈ અન્ય સત્ય તરફથી બહાર ગયેલા પુસ્તક માટે માગણી થઈ હશે તો એ બીજી વાર મળશે નહીં કે રિન્યુ થશે નહીં. વળી કોઈ પણ પુસ્તક બીજી વાર નહીં આપવાની સત્તા ગ્રંથાલયીની રહેશે.
- ક. બહારગામ ગયેલા સત્યો પોતાને નામે લીધેલાં પુસ્તકો પુસ્તકાલયમાં આવી બતાવ્યા સિવાય પુસ્તક જમા કરાવવાની મુદ્દત પૂરી થયા પહેલાં બહારગામથી પોસ્ટ દ્વારા ખબર આપી ફરીથી એક જ વાર ઠરાવેલી વધારાની મુદ્દત પૂરતાં પોતાની પાસે રાખી શકશે. મુદ્દત વધારી ન આપવાની સત્તા ગ્રંથાલયીની રહેશે.
- ખ. તિથિપત્રકમાં છેલ્લી દર્શાવેલી તારીખની અંદર પુસ્તક પાછું આપવામાં નહિ આવે તો દરરોજનાં રૂ. ૩.૦૦ પ્રમાણે દરેક પુસ્તક દીઠ અતિદેય લેવામાં આવશે. પરંતુ ગુણદોષ અને વિવેકબુદ્ધિને આધારે અંશતઃ અથવા સંપૂર્ણ અતિદેય માફ કરવાની તમામ સત્તા ગ્રંથપાલશ્રીને રહેશે.
- ગ. જે પુસ્તક માટે બીજા સત્યોની લેખિત માગણી આવી હશે તે પુસ્તક જે સત્ય લઈ ગયા હશે તેમને તે પુસ્તક માટે નક્કી કરેલી મુદ્દતમાં પુસ્તકાલયમાં પાછું આપી જવાની સૂચના આપવામાં આવશે. પાછું ન આપી જનાર સત્ય પાસેથી તે મુદ્દત બાદ દરેક પુસ્તક દીઠ રોજના રૂ. ૩.૦૦ પ્રમાણે અતિદેય લેવામાં આવશે.
- ધ. પુસ્તક-અતિદેય વધારેમાં વધારે પુસ્તકની કિંમતની બમણી રકમથી વધારે લેવામાં આવશે નહિ.
૨૬. દરેક પુસ્તક, પુસ્તક આપ-લે કરનાર કારકુનને પાછું આપવું જોઈશે, અને પુસ્તકને નુકસાન થયેલું માલૂમ પડશે તો પુસ્તક લઈ જનાર સત્યે અથવા તેના જામીનદારે તે નુકસાન ભરપાઈ કરી આપવું પડશે, અથવા તો નવી નકલ અથવા નવો સેટ પૂરો પાડવો પડશે. નવું પુસ્તક અથવા નવો સેટ પૂરો પાડ્યેથી નુકસાન પામેલું પુસ્તક અથવા સેટ લઈ જવાનો તે સત્યને છક્ક રહેશે. આવી બાબતોમાં પુસ્તકોની અને સેટની આવૃત્તિ અને પ્રકાશન-વર્ષનો આગ્રહ રાખવામાં આવશે.
- જે સત્યથી પુસ્તક ખોવાયું હોય તેઓ જો તે પુસ્તકની કિંમત, ગ્રંથાલયી નક્કી કરે તે ભરપાઈ કરી જશે તો તે તારીખથી તે પુસ્તક ઉપર અતિદેય ચડશે નહિ, પણ જો પુસ્તકાલયનું ખોવાઈ ગયેલું પુસ્તક ફરી મળી આવે અને પરત આપે તો તેના ઉપર આખા સમયને માટે અતિદેય લેવામાં આવશે. જો આ પુસ્તક સત્યે ભરેલી રકમમાંથી પુસ્તકાલયમાં મંગાવી લેવામાં આવ્યું હશે તો સત્યને પાછળથી મળેલું પુસ્તક સ્વીકારવામાં આવશે નહિ.
- સત્યથી ખોવાયેલા પુસ્તકની દોઢી કિંમત સત્ય દ્વારા ભરપાઈ થયા બાદ પુસ્તકની નવી નકલ જો પુસ્તકાલય દ્વારા મંગાવી લીધી હશે તો અથવા સેટના ખોવાઈ ગયેલા કોઈ પણ એક પુસ્તક બદલ નવો આખો સેટ પુસ્તકાલયે મંગાવી લીધો હશે તો આ સંજોગોમાં પુસ્તકાલયમાંથી એ પુસ્તક કે સેટ ઉપર પુસ્તકાલયની માલિકી રદ કર્યાનો સિક્કો મરાવી લેવો, જેથી ભવિષ્યમાં એ પુસ્તક કે સેટની માલિકીની બાબતમાં ગેરસમજ ઊભી ન થાય અને આ પુસ્તક અથવા સેટ વાચક સત્ય લઈ જઈ શકશે.
૨૭. પુસ્તકાલયમાંથી બહાર ગયેલાં પુસ્તકો પર પોતાનો છક્ક નોંધાવવા માટે સત્યોએ એક કાર્ડમાં પોતાને જોઈતા પુસ્તકની વિગતો નોંધી તેના પર પોસ્ટની ટિકિટ લગાવી પુસ્તક આપ-લે કરનાર કારકુનને તે કાર્ડ આપવું. પુસ્તક પુસ્તકાલયમાં પાછું આવ્યેથી તે બાબતની જાણ તે સત્યને ગ્રંથાલયી તરફથી આપવામાં આવશે, અને આ ખબરમાં જણાવેલી મુદ્દત સુધી એ પુસ્તક તે સત્યને માટે ત્રણ દિવસ રાખી મૂકવામાં આવશે.
૨૮. સત્યો કે જામીનદારોએ બદલાયેલા સરનામાની જાણ એક અઠવાડિયામાં પુસ્તકાલયમાં કરવાની રહેશે.
૨૯. પુસ્તકાલયના વાચક સત્ય ગમે તે દિવસથી થઈ શકશે, પરંતુ સત્યપદની મુદ્દત પૂર્ણ થયેથી નવેસરથી સત્યપદ

મેળવવાનું રહે છે. આ નિયમ આજીવન વાચક સભ્યોને લાગુ પડશે નહિ.

૩૦. પોતાની ટિકિટ ઉપર બહાર ગયેલાં પુસ્તકો તથા પુસ્તકાલયની લેણી પડતી રકમો અને સભ્ય તરીકેની ટિકિટો પાછી આપી જવામાં આવે નહિ ત્યાં સુધી સભ્યોને પુનઃ સભ્યપદ આપવામાં આવશે નહિ. જો કોઈ સભ્ય પોતાનાં પુસ્તકો અથવા તો તેની દોઢી કિંમત પુસ્તકાલયમાં આપી નહિ જાય તો પુસ્તકોની દોઢી કિંમત, તે અંગેનો અતિદેય, ટપાલખર્ચ વગેરેની જવાબદારી જામીનદારની રહેશે.
૩૧. જે સભ્યો સભ્ય તરીકે રહેવા નહિ માગતા હોય અથવા કાયમને માટે શહેર છોડી જવાના હોય તેમણે પોતાની વાચક ટિકિટો ગ્રંથાલયીને પાછી આપી તે રદ કરાવવી; આમ ન કરવામાં આવે અને તેમની ટિકિટો ઉપર બીજા કોઈ પુસ્તકો લઈ જશે તો પણ તે સભ્ય તથા તેમના જામીનદાર તે પુસ્તકો માટે જવાબદાર ગણાશે.
૩૨. કોઈ સભ્ય પોતાની ટિકિટ ખોઈ નાખે અથવા ગુમાવે તો તેમણે ગ્રંથાલયને તે બાબતની લેખિત જાણ કરવી જોઈશે. આ પછી ત્રણ મહિના બાદ ખોવાઈ ગયેલી ટિકિટ ઉપર ગયેલાં, કે જનારાં પુસ્તકોની પોતાની જવાબદારી સ્વીકાર્યનો બાંહેથરી પત્ર લખી આપ્યા પછી તેમને સભ્ય તરીકે ચાલુ રહેવા જે તે નિયત કરેલો ચાર્જ લઈ નવી હુલ્લીકેટ ટિકિટ આપવામાં આવશે.
૩૩. કોઈ પણ વ્યક્તિ એક જ નામ ઉપર, એકથી વધુ વખત સભ્યપદ નોંધાવી શકશે નહિ; આમ છતાં પણ જો કોઈ પણ વ્યક્તિએ એકથી વધુ વખત એક જ નામ ઉપર વાચક સભ્યપદ નોંધાવ્યું હશે તો તે તમામ સભ્યપદ રદ કરવાનો ગ્રંથાલયીને અધિકાર રહેશે.
૩૪. ગ્રંથાલયીની પરવાનગી સિવાય ચૌદ વરસની અંદરની કોઈ પણ વ્યક્તિ પુસ્તકાલયના વયસ્ક સભ્ય થઈ શકશે નહિ.

સર્વસાધારણ

ઉપરના નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળનો રહેશે.

-: જામીનદારો :-

- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન કાઉન્સિલરશ્રીઓ તેમજ તમામ કમિટીઓ તથા મ્યુ. સ્કુલ બોર્ડ, અ.મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ, વી.એસ. હોસ્પિટલ બોર્ડ અને શેઠ મા.જે. પુસ્તકાલય બોર્ડના ચેરમેનશ્રીઓ અને બોર્ડ મેબરશ્રીઓ તેમજ આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી લાયબ્રેરી (મણીનગર)ના બોર્ડ મેબરશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ તથા સભ્યશ્રીઓ
- ગુજરાત સરકારના માન. મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા કેન્દ્ર સરકારના માન. મંત્રીશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ
- અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તથા તેની સંલગ્ન તમામ સ્વાયત્ત સંસ્થાઓના વર્ગ-૧ તથા તેની ઉપરના તમામ અધિકારીશ્રીઓ
- ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ માન્ય કોલેજેના આચાર્યશ્રીઓ
- અમદાવાદ શહેરમાં આવેલ તમામ સરકાર માન્ય શાળાઓના આચાર્યશ્રીઓ

શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: વાચનાલયનો ઉપયોગ કરતા વાચકો માટેના નિયમો :-

૧. પાગલ, નશો કરેલી કે ચેપી રોગથી પિડાતી કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.
૨. વાચનાલયમાં પ્રવેશતા કોઈપણ વાચકને પોતાની સાથે પાળેલા પશુ-પક્ષી, બેગ, થેલી, છત્રી, લાકડી, વિસ્ફોટક પદાર્થ કે પ્રવાહી, ઘાતક પદાર્થ કે પ્રવાહી જેવી કોઈપણ વસ્તુ લઈ જવા દેવામાં આવશે નહીં.
૩. વાચનાલયમાં ધુમ્રપાન, તમાકુ, ગુટકા જેવા માદક તત્વોનો નિષેધ છે.
૪. વાચનાલયમાં ગમે ત્યાં થૂકવું નહીં. પાન ખાઈને પિચકારી મારવી નહીં. ગંદકી કરવી નહીં.
૫. વાચનાલયમાં દરેક વાચકે બીજા વાચકને તકલીફ ન થાય તે રીતે વિચારી સંપૂર્ણ શાંતિ જાળવવાની રહેશે.
૬. વાચનાલયમાં વાચન કરતા અન્ય વાચકોને વાચન ધ્યાનભંગ ન થાય તે માટે મોબાઈલ ફોન સ્વીચ ઓફ રાખવો.
૭. વાચનાલયમાં દરેક વાચકે શિસ્ત, સંયમ અને સંભ્યતાથી બેસી વાચન કરવાનું રહેશે.
૮. બીજી જરૂરી ચર્ચા, મોટેથી વાતો કરવી, મોટા અવાજે બોલવું, ઘાંટા પાડવા, ખોટી ફરિયાદો કરવી, વાચકો અને કર્મચારીઓ સાથે અસંભ્ય વર્તન કરનારને વાચનાલયમાં બેસવા દેવામાં આવશે નહીં.
૯. વાચનાલયમાં માત્ર વાચન માટે જ પ્રવેશ આપવામાં આવતો હોવાથી બીજી જરૂરી સમય પસાર કરવા બેસી રહેવું, આંખો બંધ કરીને ઊંઘવા જેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી નહીં.
૧૦. સામયિક રજીસ્ટ્રેશનરૂમમાં અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ વાચકે પ્રવેશ કરવો નહીં. કોઈપણ વાચન સામગ્રીની માગણી હોય ત્યારે પુસ્તકાલયના કર્મચારીને જણાવવાનું રહેશે.
૧૧. વર્તમાનપત્ર - સામયિક જ્યાંથી મેળવ્યું હોય ત્યાંજ મૂકવાનું રહેશે.
૧૨. વર્તમાનપત્ર - સામયિકમાં કોઈપણ પ્રકારનું લખાણ, લીટા, બોક્સ કે અન્ય રીતે બગાડ કરી શકાશે નહીં.
૧૩. કોઈપણ વાચન સામગ્રીમાંથી પાના ફાડવા, ફોટા ફાડવા, પાના ખરાબ કરવા, બાઈન્ડીંગને નુકશાન પહોંચાડવા જેવી કોઈપણ પ્રવૃત્તિ કરી શકાશે નહીં.
૧૪. વર્તમાનપત્રો - સામયિકો રેક્સ પર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો અને જૂના કોઈપણ અંકોની જરૂરિયાત હોય તો ડિમાન્ડ સ્લીપ ભરીને કર્મચારીને આપવાથી જરૂરી અંકો વધુમાં વધુ બે અંકોની મર્યાદામાં પૂરા પાડવામાં આવશે.
૧૫. કોઈપણ વાચક વર્તમાનપત્ર - સામયિકના અંકોને નુકશાન કરશે તો ગ્રંથપાલશ્રીની સૂચના અનુસાર જે તે અંક નવો લાવીને આપવાનો રહેશે અથવા ગ્રંથપાલશ્રી નક્કી કરે તે નુકશાનીની રકમ ભરપાઈ કરવાની રહેશે.
૧૬. જૂના વર્તમાનપત્રોના અંકો અથવા સામયિકના અંકોની માંગણી કરનાર વાચકે પુસ્તકાલયનું વાચક સંભ્યપદ ધરાવવું જરૂરી છે.
૧૭. જે તે દિવસના વર્તમાનપત્રોનો ઉપયોગ કરતા વાચકોને અન્ય વાચકોને વાચન લાભ મળી શકે તે હેતુથી દસ મિનિટથી વધુ સમય વાંચન માટે બેસવા દેવામાં આવશે નહીં.
૧૮. દરરોજના નવા મળેલા સમાયિક-અંકોની નોંધ વાચનાલયના નોટીસ બોર્ડ પર મૂકવામાં આવતી હોય છે. આથી આ બાબતે અન્ય કોઈ પૂછ્યા કરવી નહીં.
૧૯. પુસ્તકાલય અને વાચન સામગ્રી આપની પોતાની સહિયારી છે આપણે વાંચીએ અને બીજાઓને વાંચવા દઈએ.
૨૦. વાચનાલય સંબંધી અન્ય કોઈ મુશ્કેલીઓ હોય તો સામયિક વિભાગના ઈન્ચાર્જનો સંપર્ક કરવો.

શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: ડિજિટલ લાયબ્રેરીના સામાન્ય નિયમો :-

૧. ડિજિટલ લાયબ્રેરીના સભ્ય થનાર વ્યક્તિએ નિયત અરજીફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સાથે એક ફોટોગ્રાફ તેમજ રહેઠાણનો પૂરાવો આપવાનો રહેશે.

સભ્યપદની મુદ્દત સભ્ય બન્યા તારીખથી એક વર્ષના બ્લોક વર્ષની રહેશે.

૨. ડિજિટલ લાયબ્રેરીનો સમય સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૬.૦૦ કલાક સુધીનો રહેશે.

૩. ડિજિટલ લાયબ્રેરીમાં સભ્ય થનાર વાચકે નીચે મુજબની સભ્ય ફી તેમજ ડિપોઝીટ ભરવાની રહેશે.

વાચક	ડિપોઝીટ	લવાજમ	આજવન
વયસ્ક	૧૫૦/-	૧૫૦/-	૫૦૦/-
બાળ વાચક (૬ થી ૧૪)	૧૫૦/-	૧૫૦/-	૫૦૦/-

૪. ડિજિટલ લાયબ્રેરી દ્વારા પૂરી પાડવામાં આવેલ સી.ડી. (કોમ્પેક્ટ ડિસ્ક) વધુમાં વધુ ૧૪ દિવસ રાખી શકાશે. તેનાથી વધુ સમય માટે રાખવા બદલ રોજના રૂ. ૩/- સી.ડી. દીઠ અતિદેય (મોડાઈ) આપવાનો રહેશે.

૫. ડિજિટલ લાયબ્રેરી દ્વારા પૂરી પાડવામાં આવેલ સી.ડી. સભ્યએ ચેક કરીને લઈ જવાની રહેશે. સી.ડી. ઈશ્યુ થયા પછી તેને કંઈ પણ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સભ્યની રહેશે. પુસ્તકાલય નક્કી કરે તે મુજબ સભ્યએ નુકશાન ભરપાઈ કરી આપવાનું રહેશે, અથવા તો નવી ઓરીઝનલ સી.ડી. પૂરી પાડવાની રહેશે.

૬. સભ્યપદની મુદ્દત પુરી થયા બાદ ભરેલી ડિપોઝીટ પાછી મેળવવાની માંગણી થયા પછી એક માસની અંદર પરત આપવાની તજવીજ થશે. ડિપોઝીટની રસીદ અરજ સાથે સામેલ રાખવાની રહેશે તેથી ડિપોઝીટની રસીદ સાચવીને રાખવી.

૭. કોઈ પણ વ્યક્તિ એક જ નામ ઉપર એકથી વધુ વખત સભ્યપદ નોંધાવી શકશે નહીં. આમ છતાં પણ જો કોઈ વ્યક્તિએ એકથી વધુ વખત એક જ નામ ઉપર સભ્યપદ નોંધાવું હશે તો તે તમામ સભ્યપદ રદ કરીને અનામત (ડિપોઝીટ) જમ કરવાનો અવિકાર પુસ્તકાલયને રહેશે.

૮. જો કોઈ સભ્ય પોતાની કોમ્પેક્ટ ડિસ્ક અથવા તેની કિંમત પુસ્તકાલયમાં ભરપાઈ ન કરે તો તે અંગે થયેલ અતિદેય તેમજ ટપાલખર્ય વગેરે ભરપાઈ કરવાની જવાબદારી જે તે સભ્યની રહેશે.

૯. સભ્યથી ખોવાઈ ગયેલ ટિકિટની હુલ્લીકેટ ટિકિટ કાઢી આપવામાં આવશે નહીં. વરસાદથી કે અન્ય રીતે નુકશાન પામેલ ટિકિટ પરત આપવાથી નિયત ફી ભરીને હુલ્લીકેટ ટિકિટ આપવામાં આવશે.

૧૦. ખોવાઈ ગયેલ ટિકિટ ઉપર પણ કોઈ સભ્ય સી.ડી. લઈ ગયેલ હશે તો પણ તેની જવાબદારી કાર્ડ ધરાવનાર સભ્યની રહેશે.

૧૧. પુસ્તકાલયના સામાન્ય નિયમો તેમજ ઈશ્યુ રીટર્નના નિયમો ડિજિટલ લાયબ્રેરીના વાચકોને પણ લાગુ પડશે.

-: વાતાનુકૂલિત ઓડિટોરીયમના ઉપયોગ માટેના નિયમો :-

સામાન્ય :

- ઓડિટોરીયમનો હેતુ ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિ માટેનો છે. પુસ્તકાલય દ્વારા યોજવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો અતે યોજવામાં આવે છે.
- ગ્રંથાલય વિસ્તરણ પ્રવૃત્તિનું આયોજન ગ્રંથાલય પોતે કરશે અથવા ઉપરોક્ત હેતુ સાથે સુસંગત હેતુઓ માટે અન્ય સંસ્થાઓ સાથે સંયુક્ત આયોજન કરી શકશે.
- 'સંસ્થા' આયોજનમાં જોડાનાર સંસ્થાને વિશિષ્ટ નિયમો લાગુ પડશે નહીં.
- સંયુક્ત આયોજનમાં જોડાવવું કે કેમ તે અંગેની સ્વીકૃતિ કે અસ્વીકૃતિનો નિર્ણય ગ્રંથપાલ કરશે.

વિશિષ્ટ :

ગ્રંથાલય અભિગમ કેળવવામાં સહાયભૂત બની રહે તેવી તમામ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિ માટે કોઈપણ સંસ્થા ઓડિટોરીયમના ઉપયોગ માટે અરજી કરી શકશે તેમજ નીચે જણાવેલ નિયમો બંધનકર્તા રહેશે.

- વપરાશ કરવાની ઈચ્છા ધરાવનાર સંસ્થાએ નિયત અરજીપત્રકમાં પુરી માહિતી સાથે પ્રોગ્રામના એક અઠવાડિયા અગાઉ અરજી કરવી પડશે.
- વપરાશનો સમય સવારના ૮-૦૦ થી રાત્રીના ૮-૦૦ સુધીનો રહેશે.
- પુસ્તકાલયસેવાઓને કોઈપણ મુશ્કેલીઓ કે અવરોધ ઉભો ન થાય તે રીતે ઓડિટોરીયમનો ઉપયોગ કરવાનો રહેશે.
- ઓડિટોરીયમ વાપરવા રાખનારે બેઠક માટેની વ્યવસ્થા : ખુરશીઓ, પાથરણા, સ્ટેજ આયોજન પોતે કરવાની રહેશે.
- ઓડિટોરીયમમાં પીણા, હળવો નાસ્તો, ભોજન કરી શકશે નહીં.
- વપરાશ દરમ્યાન પુસ્તકાલયની કોઈપણ મિલ્કત કે સાધનોને નુકશાન થશે તો તેની સધણી જવાબદારી ઓડિટોરીયમ વાપરનારની છે, અને નુકશાનાની રકમ ગ્રંથપાલશ્રી નક્કી કરશે જે ડિપોઝિટની રકમમાંથી કાપી લેવામાં આવશે.
- કોઈપણ જાતની ગંદકી થાય તે રીતે ઓડિટોરીયમનો ઉપયોગ કરવો નહીં. વાપરવા રાખનારે કાર્યક્રમ પુરો થયા પછી ઓડિટોરીયમમાં દરેક જગ્યાએ સફાઈ કરાવવાની રહેશે.
- ઓડિટોરીયમમાં લાઉંડ સ્પીકરના ઉપયોગથી લાયબ્રેરીના વાચકોને ખલેલ પહોંચે નહીં તે જોવાનું રહેશે.
- ઓડિટોરીયમના વપરાશ માટે વાપરનાર વ્યક્તિ : સંસ્થા કોઈપણ વ્યક્તિ પાસેથી ટીકીટો કે અન્ય કોઈ સ્વરૂપે રકમ ઉધરાવી શકશે નહીં, કે આનુષ્ઠાંગિક એવી કોઈપણ પ્રવૃત્તિ કરી શકશે નહીં.
- કાર્યક્રમ ચાલુ હોય ત્યારે પુસ્તકાલયના ગ્રંથપાલશ્રી કે કોઈપણ અધિકારીશ્રી ઓડિટોરીયમમાં દાખલ થાય તો ઓડિટોરીયમ વાપરનારે યોગ્ય સહકાર આપવાનો રહેશે.
- પુસ્તકાલયના લાઉંડ સ્પીકરનો ઉપયોગ કરી શકશે.
- ઓડિટોરીયમ વાપરવા ઈચ્છનાર વ્યક્તિ/સંસ્થાએ અરજીપત્રક સાથે રૂ. ૨૫૦૦/- ફી (અંકે રૂપિયા પચ્ચીસ સો પુરા) ડિપોઝિટ રૂ. ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) ભાડું અગાઉથી ભરવાના રહેશે. તેમજ વીજળી ખર્ચ પણ ભરવાનો રહેશે.
- ઓડિટોરીયમના ઉપયોગના નિયમોમાં ફેરફાર કરવાનો પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળનો હક્ક અભાવિત છે.

❖ જ્ઞાન વિહાર વિદ્યાર્થી વાચનાલયના નિયમો ❖

૧. આ વિભાગ સવારના ૮.૦૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી ખૂલ્લો રહેશે.
૨. જ્ઞાન વિહાર વિદ્યાર્થી વાચનાલયનો ઉપયોગ કરવા ઈચ્છતા વાચકે પુસ્તકાલયનું સત્યપદ મેળવવાનું રહેશે.
૩. આ વિભાગનો ઉપયોગ કરતી વખતે પુસ્તકાલય તરફથી સત્યપદ માટે આપવામાં આવેલ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
૪. આ વિભાગમાં વાચક પોતાના પુસ્તકો સાથે રાખ્યો શકશે. ખાસ સંજોગોમાં પુસ્તકાલયના પુસ્તકોની જરૂરિયાત રહે તો ઈશ્યુ કાઉન્ટર પર પોતાની વાચક ટીકીટ પર પુસ્તકો ઈશ્યુ કરાવી સાથે રાખ્યો શકશે.
૫. પુસ્તકાલય તરફથી નિયત કરેલા અરજિફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને ગ્રંથાલયીની મંજૂરી મેળવ્યા બાદ આ વિભાગનો ઉપયોગ કરી શકશે.
૬. કોઈ પણ સંજોગોમાં એક જ વાચક એકથી વધુ બેઠક વ્યવસ્થા રોકી શકશે નહિં.
૭. વાંચનાલયમાં સંપૂર્ણ શાંતિ જાળવવાની રહેશે.
૮. આ વિભાગમાં સ્વચ્છતા અને પવિત્રતા જાળવાય તે જોવાની સૌ કોઈ વાચકની ફરજ રહેશે.
૯. આ વિભાગમાં ધુમ્રપાન, ગુટકા, તંબાકુ, પાન, નશાકારક પદાર્થ કે પ્રવાહી ઉપરાંત જલનશીલ સ્ફોટક પદાર્થ કે પ્રવાહી સાથે રાખવું કે તેનો ઉપયોગ કરવો નિષેધ રહેશે.
૧૦. વાંચન કક્ષનો ઉપયોગ કરતા વાચકે પોતાની સાથે બેગ, બગલથેલો, દફતર, વોટરબેગ, નાસ્તાનો ડબો વિગેરે સાથે લાવવું નહીં.
૧૧. વાચનાલયમાં કોઈપણ પ્રકારનો નાસ્તો, ભોજન, ઠંડા કે ગરમ પીણા લઈ જઈ શકશે નહિં.
૧૨. વિદ્યાર્થી વાચનાલયમાં વિદ્યાર્થી વાચકો માટે પુસ્તકાલય તરફથી સૂચવવામાં આવેલ નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.
૧૩. આ વિભાગનો ઉપયોગ કરતા વાચકો દ્વારા પુસ્તકાલયની માલ-મિલકત, ફર્નિચર, લાઈટ અને વાચન સામગ્રીનું કંઈ પણ નુકશાન થશે તો જે તે વાચક પાસેથી વસ્તુલાત કરવામાં આવશે.
૧૪. વિષય નિષ્ણાતો, સંશોધકો, પત્રકારો, સાહિત્યકારો આ વિભાગનો વાંચન માટે ઉપયોગ કરી શકશે.
૧૫. આ વિભાગનો વાંચનકક્ષ તરીકેનો ઉપયોગ નિઃશુલ્ક છે.
૧૬. વાંચનકક્ષમાં વાંચવાની મંજૂરી આપેલા વિદ્યાર્થી સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને બેસવા દેવામાં આવશે નહીં.
૧૭. અભ્યાસ કરવા માટે જે મુદ્તની મંજૂરી આપવામાં આવી હશે તે મુદ્તથી વધારે સમય માટે પ્રવેશ આપવામાં આવશે નહીં.
૧૮. દરેક વાચકે વાચનાલયમાં શિસ્ત અને સત્યતાથી બેસવાનું રહેશે.
૧૯. આ વિભાગનો ઉપયોગ કરતી વખતે પોતાની પાસેનો સેલફોન સ્વીચ ઓફ રાખવાનો રહેશે.
૨૦. પુસ્તકાલયના ગ્રંથાલયીને વાચકને વાંચન માટે મંજૂરી આપવી, મંજૂરી પાછી ખેંચી લેવી જેવા તમામ હક્કો અભાધિત રહેશે.

-શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય - સાહિત્યચોરાના નિયમો :-

૧. દર શનિવારે સાહિત્યચોરાના ઉપકમે સાહિત્યકારો-સાહિત્ય રસિકોની સભા પુસ્તકાલયમાં સાંજના સમયે મળશે.
૨. આ સાહિત્ય સભાનું સંચાલન ગ્રંથપાલ અથવા તેઓના પ્રતિનિધિ અથવા સાહિત્યકારોમાંથી કોઈ એક સભા સંચાલન કરશે. સંચાલન અંગેની સંપૂર્ણ સત્તાઓ ગ્રંથપાલની રહેશે.
૩. સાહિત્ય સર્જન, વિસ્તરણ અને વિતરણ અંગેના હેતુ સાથે આ ચોરો સંકળાયેલો હોવાથી સાહિત્યિક-સાંસ્કૃતિક વિષયો સિવાયના કોઈ પણ વિષયની ચર્ચા કરી શકાશે નહિં.
૪. આ સભામાં હાજર રહેનાર સૌ કોઈએ શિસ્ત જાળવવાની રહેશે. શિષ્ટ અને સૌજન્યશીલ ભાષા પ્રયોગ કરવાનો રહેશે.
૫. કોઈ પણ વ્યક્તિ, જૂથ, સંપ્રદાય, ધર્મ, રાજકીય પક્ષ, જ્ઞાતિ, જાતિ, મંડળ કે રાખ્યનું અહિત થાય, દુઃખ પહોંચે તેવો કોઈ પણ ભાષા પ્રયોગ કરી શકાશે નહિં.
૬. સાહિત્ય ચર્ચા અંગેનો ચોરો હોવાથી સભામાં હાજર રહેનાર દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાની સત્તા છે. પોતાના વિચારો બીજા પર થોપી બેસાડી શકાશે નહિં.
૭. સાહિત્ય સભામાં હાજર રહેનાર સૌ કોઈએ એકબીજા સાથે સહકાર અને સૌજન્ય પૂર્ણ વ્યવહાર કરવાનો રહેશે.
૮. આ સભામાં હાજર રહેનાર દરેકે સૌ પ્રથમ હાજરી પત્રકમાં પોતાનું નામ લખી ટૂંકી સહી કરવાની રહેશે.
૯. હાજરી પત્રકમાં સહી કરનારને પોતાના વિચારો રજૂ કરવા કમાનુસાર તક આપવામાં આવશે. કમ બંગ કરીને કોઈ પણ વ્યક્તિને અગ્રતા આપવામાં આવશે નહિં.
૧૦. દરેક સાહિત્યકારને વધુમાં વધુ ત્રણ મિનિટ ફાળવવામાં આવશે. સમય મર્યાદાને ધ્યાનમાં લઈ પોતાને જે પણ કંઈ રજૂઆત કરવી છે તે ટૂંકાણમાં સ્પષ્ટ શબ્દોમાં કરવાની રહેશે.
૧૧. આ સાહિત્ય સભામાં દરેક પોતાની મૌલિક ફૂતિ ગુજરાતી, હિન્દી, ઉર્ડૂ, અંગ્રેજી, સાંસ્કૃત કોઈ પણ એક ભાષામાં રજૂ કરી શકશે. બીજા કોઈ સાહિત્યકારની રચના રજૂ કરી શકાશે નહિં.
૧૨. દર શનિવારે અલગ અલગ વિષયની રચનાઓ માટે જહેરાત કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી વિષય ઉપર જ રચનાઓ રજૂ કરવાની રહેશે.
૧૩. સાહિત્યચોરાની સભામાં દરેક સાહિત્યકારોને માત્ર ત્રણ મિનીટ સમયની ફાળવણી કરી હોવાથી કોઈ પણ પ્રકારની ભૂમિકા, પ્રાથમિક પરિચય કે અન્ય મુક્તકો રજૂ ન કરતાં સીધે સીધી પોતાની મૌલિક રચના જ રજૂ કરવાની રહેશે.
૧૪. પુસ્તકાલયની સાહિત્યિક સભા હોવાથી તેની એક આગવી ગરિમા જણવાય તે રીતે ગુણવત્તાસભર, ઉચ્ચ કોટિની રચનાઓ રજૂ થાય તે રીતે દરેકે રચના રજૂ કરવાની રહેશે.
૧૫. સાહિત્યચોરામાં કોઈ પણ પ્રકારની ગંધ, પદ્ધ રચનાઓ રજૂ કરી શકાશે. પરંતુ અન્ય વધારે સાહિત્યકારોને તક આપી શકાય તે હેતુથી હવેથી ગાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
૧૬. કોઈ પણ સાહિત્યકાર પોતાની રચના રજૂ કરતા હોય ત્યારે અન્ય સાહિત્યકારોએ માત્ર સાંભળવાનું રહેશે. કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાની રહેશે નહિં.
૧૭. દરેક સાહિત્યકારનું માન-મર્યાદા જણવાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણ કર્યા સિવાય દરેકને પોતાની મૌલિક રચનાઓ રજૂ કરવાનો સમાન અધિકાર રહેશે.
૧૮. સાહિત્ય સભામાં શક્ય હોય ત્યાં સુધી દરેક સાહિત્યકાર-રચનાકારને રજૂઆત કરવાની તક આપવામાં આવશે. પરંતુ સમય મર્યાદા અથવા અન્ય સાહિત્યિક કાર્યક્રમોમાં માત્ર શ્રોતા તરીકે અથવા સાહિત્ય રસિક તરીકે બેસવાનું રહેશે.

૧૯. આ સાહિત્યસભામાં બહારથી આવેલા સાક્ષર સારસ્વતોનું સન્માન જળવાય તે રીતે માન-મોળો આપી તેઓના વિચારો રજૂ કરવા અગ્રતા આપવા અથવા પ્રાધાન્ય આપવા ગ્રંથપાલને સંપૂર્ણ સત્તા રહેશે.
૨૦. આ સાહિત્યસભા - સાહિત્યચોરાના નેજા નીચે મળતી હોવા છતાં કોઈ પણ વ્યક્તિ-સંસ્થાના પ્રચારાત્મક પ્રવૃત્તિ અથવા નકારાત્મક પ્રવૃત્તિથી દૂર રહેશે.
૨૧. સાહિત્યચોરામાં હાજરી આપતી કોઈ પણ વ્યક્તિ પ્રેસ સમક્ષ રજૂઆતો કરી શકશે નહિં.
૨૨. આ સાહિત્ય સભા - સાહિત્ય સર્જન, વિસ્તરણ, વિતરણ અને વેચાણ અંગેનું કાર્ય કરી શકશે.
૨૩. તમામ ભાષાના સાહિત્યકારો તેમજ નવોદિતોને ઉત્તેજન આપી તેઓને સાહિત્ય સર્જન તરફ વાળવા આ સાહિત્યચોરો પ્રયત્નશીલ રહેશે.
૨૪. જરૂરિયાતમંદ સાહિત્યકારોને સહાયરૂપ થવા જરૂરી પ્રયત્નો કરવામાં આવશે.
૨૫. સાહિત્યસભાના નિયમોનું પાલન નહિં કરનારને સાહિત્યિક સભામાં આવતા રોકવા અંગેની સંપૂર્ણ સત્તાઓ ગ્રંથપાલની રહેશે.

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-ઓક્ટીવ ડીસ્કલોગર નં. ૭

પુસ્તકાલયની નીતિ અથવા પુસ્ત.ના અમલીકરણના ઘડતરના સંબંધમાં
જનતાના સત્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા
રજૂઆત માટેની વિધમાન કોઈ ગોઠવણની વિગતો

શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર નં. ૭

નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સત્યો સાથે
સલાહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગત

- સજેશન બોક્સ - પુસ્તકાલય અંગેના કે પુસ્તકો અંગેના સજેશનનો વાચકો (જનતા) દ્વારા મળતા રહે છે.
- ફરિયાદ પોથી દ્વારા પુસ્તકાલય કે તેને આનુષાંગિક ફરિયાદો નાગરિકો દ્વારા મળે છે.
- પુસ્તક પસંદગીની પ્રક્રિયામાં ઉપયોગી થાય છે.
- વાચક સેવાઓની સુવિધાઓમાં વધારો કરી શકાય છે.
- પુસ્તકાલય વિસ્તરણ સેવાઓમાં સાહિત્યિક, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નાગરિકોના અમૂલ્ય સૂચનોનોન
લાભ પુસ્તકાલયને મળે છે.
- સાહિત્યકારો અને સાહિત્ય રસિકોની હાજરીમાં યોજવામાં આવતા સાહિત્યિક કાર્યક્રમો દ્વારા સાહિત્યિક
સર્જન અને નવોદિત સાહિત્યકારોને ઉત્તેજન મળે છે.

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર નં. ૮

પુસ્તકાલયના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે
અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ
અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા
તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ

-: શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ :-

નામ	ટેલિફોન નંબર	
શ્રી ગૌતમભાઈ નવલચંદ શાહ મેયરશ્રી તથા અધ્યક્ષ અની રાજમુગુટ સોસાયટી, નારણપુરા ચાર રસ્તા પાસે, નારણપુરા, અમદાવાદ - ૧૩.	ઓફિસ ૨૫૩૨૮૦૦૮ ૨૫૩૮૯૮૯૯ મોબાઈલ નં. : ૮૩૨૮૭ ૮૪૫૨૬,	૨૫૩૧૪ ૨૭૪૮૧૦૦૧
શ્રી પ્રવિષ્ણુમાર ભગવાનદાસ પટેલ સ્ટેન્ઝિંગ કમિટી ચેરમેનશ્રી સભ્ય, શેઠ મા.જે.પુ. વ્ય. મંડળ ૧૩, નળિંજ સોસાયટી વિભાગ-૧, સિવીલ કેન્દ્ર રોડ, શાહીબાગ, અમદાવાદ-૪.	૨૫૩૫૨૪૨૪ ૨૫૩૮૯૮૯૯/૬૦૬/૬૦૮ ફોન : ૦૭૯-૨૫૩૫૮૬૮૮	૮૩૨૮૭૮૪૫૫૭ ૮૩૨૮૭૮૪૫૨૪ ૨૨૬૮૨૪૧૧
ડૉ. જગદીશભાઈ ભોગીલાલ ભાવસાર ચેરમેનશ્રી, સ્ન્યુ. સ્કૂલબોર્ડ સભ્ય, શેઠ મા.જે.પુ. વ્ય.મંડળ ૧૭, શિવ-ગણેશ બંગલોઝ, થલતેજ, અમદાવાદ.	૨૬૪૨૩૫૮૩ મોબાઈલ : ૮૩૨૭૦ ૫૪૩૬૫	૨૬૦૮૭૯૮૦
સ્વ. શેઠ રસિકલાલ માણોકલાલ - (દાતા સભ્ય)		
ડૉ. હેમન્તભાઈ ભંડ વિદ્યાન સભ્ય, શેઠ મા.જે.પુ. વ્ય. મંડળ ૧૮૦૦, દેસાઈની પોળ, ખાડીયા, અમદાવાદ-૧.	મોબાઈલ નં. ૮૮૨૫૦ ૧૦૮૪૦	૨૨૧૪૪૩૬૧
શ્રીમતિ મીનાક્ષીબહેન ઉલ્લાસભાઈ દેસાઈ વિદ્યાન સભ્ય, શેઠ મા.જે.પુ. વ્ય. મંડળ જે-૨, બિરજુ એપાર્ટમેન્ટ્સ, આજાદ સોસાયટી પાસે, અમદાવાદ.	મોબાઈલ નં. ૮૮૮૮૭ ૪૨૧૨૦	૨૬૭૪૩૦૩૪
શ્રી દિલીપ એસ. ગોર ડે.સ્યુ. કમિશનરશ્રી, પૂર્વ ઝોન / લાયબ્રેરી	૨૫૩૫૪૩૮૩ ફોન : ૨૫૩૫૧૧૮૭ મોબાઈલ નં. ૮૩૨૭૦ ૩૮૭૨૦	૨૭૫૪૩૪૧૮
શ્રી અરુણભાઈ આર. પંડ્યા સ્ન્યુ. સેકેટરીશ્રી	૨૫૩૫૨૪૩૫, ૩૨૮૮૨૪૩૫ ૨૫૩૮૯૮૯૯/૬૦૭ મોબાઈલ નં. : ૮૭૭૬૦ ૧૮૫૮૮	

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: પુસ્તક પસંદગી સમિતિ :-

	નામ	ટેલિફોન નંબર
૧.	શ્રી જગદીશભાઈ ભોગીલાલ ભાવસાર માન. ચેરમેનશ્રી, મ્યુ. સ્કૂલબોર્ડ - (સભ્ય) ૧૭, શિવ-ગણેશ બંગલોઝ, થલતેજ, અમદાવાદ.	૨૫૩૫૨૦૮૦/૨૫૭૩૫૨૮૭ ૨૫૩૮૧૮૧૧/૬૧૧ મોબાઈલ: ૮૩૨૭૦૫૪૩૬૫
૨.	શ્રી હેમન્તભાઈ ભંડુ ૧૮૦૦, ટેસાઈની પોળ, ખાડીયા, અમદાવાદ- ૧.	મોબાઈલ નં. ૮૮૨૫૦ ૧૦૮૪૦ ૨૨૧૪૪૩૬૧
૩.	શ્રીમતિ મીનાક્ષીબેન ઉલ્લાસભાઈ દેસાઈ જે-૨, બિરજુ એપાર્ટમેન્ટ્સ, આજાદ સોસાયટી પાસે, અમદાવાદ.	મોબાઈલ નં. ૮૮૮૮૭૪૨૧૨૦ ૨૬૭૪૩૦૩૫

C : ૧ પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળ તેમજ પુસ્તક પસંદગી સમિતિમાં

- માત્ર વ્યવસ્થાપક મંડળના સભ્ય સાહેબો તેમજ પુસ્તક પસંદગી સમિતિના સભ્યો જ ભાગ લઈ શકે છે.
- વાયક સભાયો કે જનતા વ્યવસ્થાપક મંડળ કે પુસ્તક પસંદગી સમિતિમાં ભાગ લઈ શકતી નથી.
- પુસ્તક પસંદગી સમિતિમાં વાયકો કે જનતાના સજેશનોને ધ્યાનમાં લેવામાં આવે છે.
- વ્યવસ્થાપક મંડળ અને પુસ્તક પસંદગી સમિતિના ઠરાવો તૈયાર કરવામાં આવે છે.
- વ્યવસ્થાપક મંડળ કે પુસ્તક પસંદગી સમિતિના ઠરાવોની નકલ વાયકો (જનતા) નિયત રકમ પાના દીઠ રૂ. ૨/- ભરપાઈ કરવાથી મેળવી શકે છે.

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોઝર નં. ૮/૧૦
પુસ્તકાલયના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તકા

-: શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના કર્મચારીઓની માહિતી :-

(માહે : જુન '૧૬)

ક્રમ	એમ્પલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૧.	૧૧૮	ડૉ. બિપીનચંદ્ર જે. મોટી	ગ્રંથપાલ	૧	૧૫૬૦૦-૩૮૧૦૦ ૨૨,૮૨૦	ફોટ નં. ૮૨૪/૧, સેક્ટર-૭સી, પાથીકાશમ, ગાંધીનગર.	
૨.	૭	શ્રી લતાબેન જે. પંડ્યા	જુ.આ.લા.	૨	૮૩૦૦-૩૪૮૦૦ ૨૧,૮૯૦	૩/૫, શ્રીજી એપાર્ટમેન્ટ, આંગાંડ સોસાયટી બસ સ્ટેન્ડ પાસે, અમદાવાદ - ૧૫.	
૩.	૧૧	શ્રી કલ્પનાબેન સી. ગાંધી	ટેક. આસીસ્ટન્ટ	૩	૮૩૦૦-૩૪૮૦૦ ૧૭,૪૦૦	૪/૩૩/૩૮૩, શિવમ એપાર્ટમેન્ટ્સ, અખબારનગર પાસે, નવાવાડજ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩. ફોન : ૨૭૬૨૨૨૭૬	
૪.	૨૩	શ્રી મંજુલાબેન એચ. પટેલ	હેડ કલાર્ક	૩	૮૩૦૦-૩૪૮૦૦ ૧૫,૮૪૦	૪/૬૬/૭૮૭, શિવમ એપાર્ટમેન્ટ, વ્યાસવાડી પાસે, નવાવાડજ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.	
૫.	૨૪	શ્રી મયુરબેન એચ. નિનામા	હેડ કલાર્ક	૩	૮૩૦૦-૩૪૮૦૦ ૧૪,૨૮૦	૬૭, ચંદ્રલોક ટેનામેન્ટ, કિર્તીધામની સામે, વાવોલ, ગાંધીનગર. ફોન : ૮૮૦૮૨૬૫૩૧૫	
૬.	૧૪૨	શ્રી રષ્મેનકુમાર એમ. પટેલ	સહાયક એકાઉન્ટન્ટ	૩	ફિક્સ પગાર ૬,૬૦૦	ગામ - નગરાસણ, તા. કડી, જી. મહેસાણા-૩૮૨૭૧૫	

ક્રમ	એમ્પલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૭.	૨૭	શ્રી ગૌતમભાઈ એમ. પટેલ	સિનિયર કલાર્ક	૩	૮૩૦૦-૩૪૮૦૦ ૧૫,૮૪૦	અ/૮, શ્રીજિબાગ સોસાયટી, ને.હા. નં. ૮, ચારરસ્તા પાસે, મુ. બારેજા, તા. દસકોઈ, જી. અમદાવાદ - ૩૮૨૪૨૫.	
૮.	૨૮	શ્રી શર્મિષ્ઠાબેન કે. શાહ	સિનિયર કલાર્ક	૩	૮૩૦૦-૩૪૮૦૦ ૧૫,૧૦૦	૩૬/૧, હસમુખ કોલોની, સંઘવી હાઈસ્કુલ પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩.	
૯.	૩૩	શ્રી મહેશભાઈ ટી. ગોરિયા	સિનિયર કલાર્ક	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૪,૩૦૦	૧૨, પ્રેરણા સોસાયટી, ૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર, સેટેલાઈટ, અમદાવાદ - ૫૧. ફોન ૨૬૭૩૧૫૪૧	
૧૦.	૩૪	શ્રી સોનલબેન વી. ભડ્યુ	ઇવેન્ટ પ્રોગ્રામર	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૫,૮૪૦	૩૮, શારદાનગર સોસાયટી, નવા વિકાસગૃહ, પાલડી, અમદાવાદ - ૭.	
૧૧.	૩૫	શ્રી પ્રકાશચંદ્ર કે. જોધી	ટાઈપીસ્ટ	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૩,૮૬૦	એમ-૩/૩૨, શ્રીરંગ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર, નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.	
૧૨.	૩૬	શ્રી રંજનબેન એ. બોરીયા	ટાઈપીસ્ટ	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૨,૬૧૦	૩૦૩, અષ્ટ મંગલ એપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર સોસાયટી સામે, નિલય ફ્લેટની પાછળ, આંબાવાડી, અમદાવાદ-૬.	

ક્રમ	એમ્પલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૧૩.	૩૭	શ્રી રશ્મિકાબેન એ. કાપડીયા	ટાઇપીસ્ટ	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૨,૬૧૦	૨૭, કૃષ્ણકુંજ સોસાયટી, મંગલપાક પાસે, ગીતામંદિર રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૨૨. ફોન : ૨૫૩૮૧૪૭૬	
૧૪.	૩૮	શ્રી અશોકભાઈ કે. વર્મા	મશીન ઓપરેટર	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૪,૧૪૦	બી-૭, ન્યુ ઘનશ્યામ એપાર્ટમેન્ટ, મનન સોસાયટીની બાજુમાં, કાશીભા રોડ, રાણીપ, અમદાવાદ - ૩૮૨ ૪૮૦.	
૧૫.	૩૯	શ્રી હથબેન એસ. જોખી	સર્વેર	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૬૦	ખોટ નં. ૧૦/૨, સેક્ટર તએ ન્યુ, ગાંધીનગર.	
૧૬.	૪૦	શ્રી યોગેશકુમાર જે. પટેલ	ટેકનીકલ આસીસ્ટન્ટ	૩	૮૩૦૦-૩૪૮૦૦ ૧૧,૬૪૦	આઈ-૪૦૪, શુકન સીટી ન્યુ રાણીપ, અમદાવાદ-૮૧.	
૧૭.	૪૧	શ્રી પારસભાઈ જી. ભાવસાર	જુનિ. કોમ્પ્યુટર કમ કલાર્ક	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૮૦	૫૦, રામવાડી સોસાયટી, શાંતારામ હોલની સામે, નિર્ઝિયનગર, અમદાવાદ.	
૧૮.	૪૬	શ્રી દિલીપભાઈ એન. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૪,૬૪૦	૩૬૭/૫, ચાણકયપુરી, ઘાટલોડીયા, અમદાવાદ - ૬૧. ફોન : ૮૮૮૮૮૦૦૧૭૪	

ક્રમ	એમ્પ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૧૯.	૪૭	શ્રી કામનીબેન આર. રાજપૂત	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૪,૮૫૦	એ-૭, હરિહરાંદ સોસાયટી, સનફલાવર સ્કૂલની બાજુમાં, મલાવ-તળાવના ખાચામાં, જીવરાજપાર્ક, અમદાવાદ - ૫૧. ફોન : ૨૬૬૩૦૧૩૦	
૨૦.	૪૮	શ્રી ખોડીદાસ ડી. પરમાર	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૩,૩૮૦	એ/૮, માતૃભૂમિ સોસાયટી, બરોડા એક્સપ્રેસ હાઇવેની બાજુમાં, રામોલ, અમદાવાદ - ૩૮૨ ૪૪૮.	
૨૧.	૫૦	શ્રી દક્ષાબેન એ. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૩,૮૭૦	૮૦૩, હજરાની પોળ, વસ્ત ભુવન, સાંકડીશેરી, રાયપુર, અમદાવાદ-૧.	
૨૨.	૫૧	શ્રી પરેશકુમાર આઈ. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૩,૮૮૦	સી-૭, કણ્ણાવતી એપાર્ટમેન્ટ, શ્રદ્ધા પેટ્રોલ પંપ પાછળ, જજુસ બંગલા રોડ, બોડકદેવ, અમદાવાદ - ૫૪.	
૨૩.	૫૨	શ્રી નિતીનભાઈ બી. પટેલ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૩,૮૮૦	એ/૧/૨, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, કેશવબાગ વાડી પાછળ, નવાવાડજ, અમદાવાદ - ૧૩. ફોન : ૨૭૪૧૨૪૭૨	

ક્રમ	અમ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેજિક		
૨૪.	૫૩	શ્રી મોતીભાઈ એમ. દેસાઈ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	૨, કૃષ્ણાગ સોસાયટી, પિયુખનગર પાસે, વચ્ચાપુર રેલ્વે સ્ટેશન પાછળ, વેજલપુર, અમદાવાદ.	
૨૫.	૫૪	શ્રી ગાયત્રીબેન જે. જાદ્વ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	એ-૧૮૫, કૃષ્ણધામ સોસાયટી, ખારાવાલા ફેક્ટરી સામે, સુરભીપાર્કની બાજુમાં, વટવા રોડ, ઇસનપુર, અમદાવાદ.	હેન્ડીકેપ
૨૬.	૫૫	શ્રી સુશિલાબેન આર. સોલંકી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	બી-૩૫, ઊ.ગુ. બહુચર વિજય સોસા., શારદા સ્કુલ પાસે, વટવા રોડ, ઇસનપુર, અમદાવાદ.	
૨૭.	૫૬	શ્રી સરલાબેન કે. બરંડા	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	૪૭, ચંદ્રલોક સોસાયટી, કીર્તીધામની સામે, વાવોલ, ગાંધીનગર.	
૨૮.	૫૮	શ્રી મહેશગીરી એમ. ગોસાઈ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	સઈ શેરી, રામજ મંદિર પાસે, ખોખરા, મહેમદાવાદ, અમદાવાદ-૮.	
૨૯.	૫૯	શ્રી ઈશ્વરદાન એસ. મહેંદુ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	૨, ગોવિંદકૃપા ફ્લેટ, કેરિલા કોસીંગ પાસે, વટવા જી.આઈ.ડી.સી. રોડ, વિહુલનગર ટેકરા, અમદાવાદ.	
૩૦.	૬૦	શ્રી ગોવિંદભાઈ સી. ગોરીયા	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૧૪૦	કાચા છાપરામાં, લાલ બંગલા પાછળ, લો ગાર્ડન, અમદાવાદ.	

ક્રમ	એમ્પલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૩૧.	૬૧	શ્રી ભાવિનભાઈ એ. બ્રહ્મભટ્ટ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	૧૮, કૃષ્ણાંગર સોસાયટી, પો. સરસપુર, અમદાવાદ - ૧૮. ફોન : ૫૮૮૦૩૨૦૦	
૩૨.	૬૨	શ્રી આનંદભાઈ સી. પરદેશી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	એલ.એલ. ૭, શાંતિનાથ એપાર્ટમેન્ટ, વેજલપુર રોડ, વેજલપુર બસ સ્ટેન્ડ સામે, જીવરાજ પાર્ક, અમદાવાદ - ૫૧.	
૩૩.	૬૩	શ્રી વસંતબાળા કે. જોખી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૯૦	અમ-૪૧, કે.કે. નગર-૧, રમાપાઈ પાછળ, ઘાટલોડીયા, અમદાવાદ. ફોન : ૮૮૮૮૩૨૦૬૮૫	
૩૪.	૬૪	શ્રી અનિતાબેન એ. જોખી	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૮૦	૨, કેસરીયાળ નગર, વાસણા, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ફોન : ૨૬૬૧૧૨૮૭	
૩૫.	૬૬	શ્રી અનિતાબેન એમ. રાજગુરુ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૮૦	બી-૧૨, કૃષ્ણધામ એપાર્ટમેન્ટ, આરટેક્સ કમ્પાઉન્ડ, બાપુનગર, અ'વાદ.	
૩૬.	૬૭	શ્રી ભિનાકુમારી એ. બ્રહ્મભટ્ટ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૮૦	સી-૫/૧૧, સ્વાગત એપાર્ટમેન્ટ, કરુણા સોસાયટીની બાજુમાં, નવાવાડજ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.	
૩૭.	૬૮	શ્રી સંજીવકુમાર એન. શાહ	એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૯૦	૪-૪, આરોહી ફ્લેટ, ધૂમકેતુ માર્ગ, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭.	

ક્રમ	અમ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૩૮.	૧૨૧	શ્રી ગુજરાત આર. પટણી	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૫૨૦૦-૨૦૨૦૦ ૫૮૩૦	કે-૨૮/૩૨૬, શિવશક્તિ ઓપાર્ટમેન્ટ, અખબારનગર પાસે, નવાવાડ્ઝ, અમદાવાદ - ૩૮૦૦૧૩. ફોન : ૮૮૨૪૬૮૦૬૯૮	
૩૯.	૧૨૩	શ્રી કામિના એસ. સોલંકી	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૫૨૦૦-૨૦૨૦૦ ૫૮૩૦	લાંબા ગામ, ટીચર કોલોની પાઇળ, તા. દસ્કોઈ, જી. અમદાવાદ-૩૮૨૪૦૫ ફોન : ૮૭૨૩૦૪૬૬૮૮	
૪૦.	૧૨૪	શ્રી રેશમા એસ. પંચાલ	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૫૨૦૦-૨૦૨૦૦ ૫૮૩૦	૩૬૦૨, દરવાજાનો ખાંચો, પરબડી પાસે, કોટની રંગ, શાહપુર, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. ફોન : ૮૦૦૦૫૬૭૮૨૧	
૪૧.	૧૨૫	શ્રી પ્રેમિલાલેન કે. હઠીલા	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	એ-૨૭, ધનલક્ષ્મી ટેનામેન્ટ, નવસર્જન સ્કૂલ પાસે, જુની રેલ્વે લાઈન, રાણીપ, અમદાવાદ - ૩૮૨૪૮૦. ફોન : ૮૮૨૫૭૫૮૧૮૧	
૪૨.	૧૨૭	શ્રી પ્રક્ષાલેન એમ. અસારી	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૫૨૦૦-૨૦૨૦૦ ૫૮૩૦	ખોટ નં. ૮૨૮/૨, સેક્ટર-૫૩ી, ગાંધીનગર - ૩૮૨૦૦૬. ફોન : ૮૪૨૮૪૧૫૩૮૨	
૪૩.	૧૨૮	શ્રી મહેન્દ્રકુમાર ડી. હઠીલા	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૫૨૦૦-૨૦૨૦૦ ૫૮૩૦	ખોક નં. ૬૫૨, રૂમ નં. ૭, રેલ્વે કોલોની પાસે, મણીનગર, અમદાવાદ. ફોન : ૮૮૭૮૭૭૧૦૬૮૧	

ક્રમ	એમ્પ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૪૪.	૧૨૯	શ્રી વીજાબેન એમ. જાલા	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	એ-૧૮, ધનલક્ષ્મી ટેનામેન્ટ, નવસર્જન સ્કૂલ પાસે, જુની રેલ્વે લાઈન, રાણીપ, અમદાવાદ - ૩૮૨૪૮૦. ફોન : ૮૪૨૭૮૮૯૦૪૪	
૪૫.	૧૩૦	શ્રી ઉખાબેન ડી. પટેલ	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	એચ-૨૦૪, વિશ્વાસ સીટી-૫, વોડા ફોન બિલ્ડિંગ પાછળ, ગોતા ચારરસ્તા પાસે, એસ.જી. હાઇવે, અમદાવાદ - ૩૮૨૪૮૧ ફોન : ૮૮૭૯૯૦૦૦૭૮	
૪૬.	૧૩૧	શ્રી જ્યોત્સનાબેન કે. પંચાલ	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	એ-૧૦, વિશ્વકર્માનગર સોસાસ., બલોલનગર ચારરસ્તા પાસે, રાણીપ, અમદાવાદ - ૩૮૨૪૮૦. ફોન : ૮૭૩૭૮૮૭૮૬૦	
૪૭.	૧૩૨	શ્રી નિલેશકુમાર સી. ચૌધરી	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	૧૩૫૮/૧, સેક્ટર-૪૩ી, ગાંધીનગર. ફોન : ૮૮૨૫૬૭૫૬૦૩	
૪૮.	૧૩૩	શ્રી ભાગ્યેશ સી. પટેલ	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	૬૮, ગોકુલ સોસાયટી, આશિષ વિધાલય પાછળ, વટવા, અમદાવાદ-૩૮૨૪૪૦. ફોન : ૮૭૧૪૮૦૨૦૨૩	
૪૯.	૧૩૪	શ્રી ચેતનકુમાર એસ. પટેલ	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	પંચવટી પલુ નં. ૨, પુનમ કોમ્પ્લેક્સની બાજુમાં, ઊંઝા-૩૮૪૧૭૦. ફોન : ૮૮૭૪૨૨૮૮૩૦	

ક્રમ	અમ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેજિક		
૫૦.	૧૩૫	શ્રી નયન આર. ભાવસાર	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	૪૪/બી, ભાવસાર સોસાયટી, ભાવસાર હોસ્પિટ પાસે, નવાવાડજ, અમદાવાદ - ૩૮૦૦૧૩. ફોન : ૮૮૦૪૭૭૧૪૮૩	
૫૧.	૧૩૬	શ્રી હિરલ જે. મંડીવાલા	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	૧૦૬/૧, પારસુંજ સોસાયટી, ઉમિયા વિજય, સેટેલાઈટ રોડ, અમદાવાદ. ફોન : ૯૮૨૪૮૩૦૧૫૨	
૫૨.	૧૩૭	શ્રી દિતી બી. દુલેરા	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ-પે ૭,૨૦૦	બી/૨૮૧-૭, પાર્શ્વનાથ ટાઉનશીપ, કૃષ્ણાંગરની બાજુમાં, નવાનરોડા, અમદાવાદ. ફોન : ૯૬૦૧૭૧૬૫૮૧	
૫૩.	૧૩૮	શ્રી મનીષપુરી બી. ગોસ્વામી	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ પે ૭,૨૦૦	એમ-૮/૮૭, શીવમ એપાર્ટમેન્ટ સેક્ટર - ૨૪, ગાંધીનગર-૩૮૨૦૨૪	
૫૪.	૧૩૯	શ્રી ધવલકુમાર ડી. પટેલ	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ પે ૭,૨૦૦	એ-૨૨૨, રેશ્મા રો હાઉસ, વોટર કેનાલ પાસે, પુના મગોબ રોડ પર્વત પાટીયા, સુરત-૩૮૫૦૧૦	
૫૫.	૧૪૩	શ્રી ભાવેશકુમાર આર. પટેલ	સહાયક એટેન્ડન્ટ લાયબ્રેરી	૩	ફિક્સ પે ૬,૨૦૦	બી-૨૧૭, સૌરભપાઈ સોસાયટી, સમતા ફિલેટની પાછળ, બાલાજી રોડ, સુભાનપુરા, વડોદરા.	

ક્રમ	એમ્પલોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બોર્ડિંગ		
૫૬.	૭૭	શ્રી ભરતભાઈ સી. પટેલ	અયુઝ્યમ એટેન્ડન્ટ	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૧૦,૮૮૦	૮, દિનેશપાર્ક સોસાયટી, સાર્વજનિક હાઇસ્ક્વુલ પાસે, રાણીપ, અમદાવાદ - ૩૮૨૪૮૦. ફોન : ૨૭૫૨૬૮૮૮૮	
૫૭.	૭૮	શ્રી મુદ્દિતાબેન આર. શાહ	અયુઝ્યમ એટેન્ડન્ટ	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૮૦	૨૬, ન્યુ ભવાની સોસાયટી, રાધા સ્વામી સત્સંગ પાસે, પાણીની ટાંકી સામે, આર.ટી.ઓ. પાછળ, રાણીપ, અમદાવાદ. ફોન : ૬૫૪૩૬૪૨૫	
૫૮.	૮૨	શ્રી ચંદુભાઈ સી. પરમાર	ડ્રાયવર	૩	૫૨૦૦-૨૦૨૦૦ ૮,૬૮૦	ટી-૧, ૪ થે માળ, ભૂમિ એપાર્ટમેન્ટ, ભાવસાર હોસ્પિટ પાસે, નવાવાડજ, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.	
૫૯.	૮૩	શ્રી જગદીશભાઈ એચ. પરમાર	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૨૬૦	૬-૧૦૭, સમ્રાટ નગર, ઈસનપુર, અમદાવાદ.	
૬૦.	૮૪	શ્રી રમેશભાઈ એમ. ચૌહાણ	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૨૫૦	૩૭, ગુ.છ. બોર્ડ, નળસરોવર રોડ, ૫૦/૨, એલ.આઈ.જી. બ્લોક નં. ૧૦, સાણંદ.	
૬૧.	૮૮	શ્રી કૌટિલ્યભાઈ પી. ત્રિવેદી	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૪૩૦	સી-૧૦, ગણેશ ફ્લેટ, વખાપુર રેલ્વે સ્ટેશન પાસે, વેજલપુર, અમદાવાદ - ૫૧. ફોન : ૮૮૨૫૨૫૦૫૮૬	

ક્રમ	એમ્પ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૬૨.	૮૮	શ્રી નગીનભાઈ સી. પરમાર	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૪૦ ૯,૪૧૦	૬૬, આસોડીયા સોસાયટી, વિભાગ-૧, ભાર્ગવ રોડ, લીમડા સ્ટેશન સામે, મેઘાણીનગર, અમદાવાદ - ૧૬.	
૬૩.	૯૦	શ્રી અશ્વિનભાઈ એસ. સોની	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૪૦ ૯,૨૪૦	૩૬, ગુરુકૃપા સોસાયટી, રેલ્વેલાઈન પાસે, વેજલપુર, અમદાવાદ - ૫૧.	
૬૪.	૯૧	શ્રી શ્યામલાલ આર. મીણા	પટાવાળા	૪	૪૪૪૦-૭૪૪૦ ૯,૪૧૦	૪૧, શાબીના એપાર્ટમેન્ટ, ટેલિફોન ઓફિસ પાસે, એમ.જે. લાયબ્રેરી સામે, એલિસબ્રીજ, અમદાવાદ - ૬. ફોન : ૨૬૫૮૧૨૦૮	
૬૫.	૧૨૦	શ્રી ચંદ્રિકાબેન યુ. મકવાણા	પટાવાળા	૩	૪૪૪૦-૭૪૪૦ ૪,૮૮૦	૫૧૦, પટેલવાડી સામે, પાલડી, અમદાવાદ.	
૬૬.	૧૦૦	શ્રી મહુંમદ રફીક એ. પઠાણ	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૯,૬૦૦	૪૮૯, નાની સોદાગરની પોળના નાડે, જમાલપુર, અમદાવાદ - ૧. ફોન : ૮૩૭૭૨૧૬૧૪૬૭	
૬૭.	૧૦૧	શ્રી જીતેન્દ્રભાઈ એસ. વાધેલા	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૯,૬૦૦	૨૩, કુંદનભાગ સોસાયટી, બ્લોક નં. ૨૧ની બાજુમાં, કુંદનલાલની ચાલી પાસે, મેઘાણીનગર છેલ્લુ બસ સ્ટેન્ડ, અમદાવાદ.	
૬૮.	૧૦૨	શ્રી પ્રભુલાલ જી. પટેલ	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૯,૨૪૦	વસંત સ્મૃતિ, ગોલવાડ, ખાડિયા, ઘર નં. ૩૪૪, અમદાવાદ - ૧.	

ક્રમ	અમ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૬૮.	૧૦૩	શ્રી કૈલાસભાઈ એસ. રાણા	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૯૨૦	સાબરમતી પાવર હાઉસ, મિલન મંદીર પાછળ, શર્માજીની ચાલી, સાબરમતી, અમદાવાદ.	
૭૦.	૧૦૪	શ્રી કિર્તીભાઈ બી. રામી	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૭૪૦	૪૮૦, સાંકડી શેરી, નાનશાખવણી પોળ, માણેકચોક, અમદાવાદ-૧. ફોન : ૨૨૧૪૫૬૧૮ (પી.પી.)	
૭૧.	૧૦૫	શ્રી દિલીપસિંગ બી. રાહેર	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૪૮૦	૨૧૦, નાની સાળવી વાડ, સરસપુર, અમદાવાદ - ૧૮.	
૭૨.	૧૦૬	શ્રી પશાલાલ એચ. મીણા	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૬,૪૧૦	ડૉ. હેગડેવાર ભવન, જુના ઢોર બજાર, કાંકરીયા, અમદાવાદ.	
૭૩.	૧૦૭	શ્રી સવિતાબેન એમ. કુચારા	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૪૧૦	ડી-૧૫૫, પ્રભાકર ટેનામેન્ટ, જી.ડી. રોડ, સૈજપુર બોધા, અમદાવાદ - ૪૧.	
૭૪.	૧૦૮	શ્રી કમલેશકુમાર જી. પરમાર	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૪૧૦	૩, વિર માયા નગર સોસાયટી, ન્યુ સિવિલ પાછળ, કેમ્પ રોડ, શાહીબાગ, અમદાવાદ - ૪. ફોન : ૯૮૭૪૫૭૩૭૭૧	
૭૫.	૧૦૯	શ્રી જીતેજ્જભાઈ એસ. રાણા	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૭,૮૮૦	શર્માજીની ચાલી, રથી એપાર્ટમેન્ટ પાસે, પાવર હાઉસ, સાબરમતી, અમદાવાદ.	

ક્રમ	એમ્પ્લોઈ નં.	કર્મચારીનું નામ	હોદ્દો	વર્ગ	ગ્રેડ	રહેણાંકનું સરનામું ટેલીફોન નં.	રીમાર્ક્સ
					બેઝિક		
૭૬.	૧૧૦	શ્રી વિજયભાઈ સી. પરમાર	ફરાસ	૪	૪૪૪૦-૭૪૪૦ ૭,૮૮૦	૬૮, મેલારીકૃપા સોસાયટી, હાઈવે રોડ, પો. તા. કડી, જ. મહેસાણા. પીન - ૩૮૨૭૧૫.	
૭૭.	૧૧૨	શ્રી મંગલાવતી એન. રાજપુત	પાણીવાળા બહેન	૪	૪૪૪૦-૭૪૪૦ ૭,૮૮૦	નવી સિવિલ સામે, રણાંધોડ પુરા, શાન્તિદાસની ચાલી, અમદાવાદ.	
૭૮.	૧૧૪	શ્રી કિશોરભાઈ કે. રાજા	માળી	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૩૮૦	૫૫, ઉત્પલ સોસાયટી, નરોડા બેઠક, અમદાવાદ.	
૭૯.	૧૧૫	શ્રી રામચંદ્ર એમ. ચૌહાણ	સફાઈ કામદાર	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૭૮૦	હરિજનવાસ, ન્રિકમજીના મંદિર પાસે, આસ્ટોડિયા, અમદાવાદ.	
૮૦.	૧૧૬	શ્રી કમળાબેન સી. મકવાણા	સફાઈ કામદાર	૪	૪૪૪૦-૭૪૪૦ ૮,૪૯૦	૮, પ્રેરણા કો.ઓ.હ. સોસાયટી, સાગર એપાર્ટમેન્ટ સામે, ૧૩૨ ફુટ રીંગ રોડ ઉપર, શ્યામલ ચાર રસ્તા પાસે, જવરાજપાઈ, અમદાવાદ - ૫૧.	

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૧૧

પુસ્તકાલયની તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના
અહેવાલોની વિગતો દર્શાવતી તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.

મે. ચેરમેન સાહેબ,

સવિનય સાથે જણાવવાનું કે, આ સાથે પુસ્તકાલયના સને ૨૦૧૬-'૧૭ ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરું છું.

પુસ્તકાલયનું અંદાજીત કુલ ખર્ચ રૂ. ૮,૪૩,૦૦,૦૦૦/- (અંકે રૂ. નવ કરોડ તેતાળીસ લાખ પૂરા) આકારવામાં આવેલ છે.

પુસ્તકાલયની અંદાજીત કુલ આવક રૂ. ૫૪,૪૫,૦૦૦/- (અંકે રૂપિયા ચોઘણ લાખ પિસ્તાળીસ હજાર પૂરા) અંદાજવામાં આવેલ છે. જેથી પુસ્તકાલયની ખર્ચની ચોઘ્યી રકમ રૂ. ૮,૮૮,૫૫,૦૦૦/- (અંકે રૂપિયા આઠ કરોડ ઈંદ્રચાસી લાખ પંચાવન હજાર પૂરા) થાય છે. જે અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન પાસેથી ટ્રસ્ટડીડની કલમ-૮ અનુસાર સને ૨૦૧૬-'૧૭ ના વર્ષ માટે પુસ્તકાલયની ગ્રાન્ટની રકમ પેટે રૂ. ૮,૮૮,૫૫,૦૦૦/- (અંકે રૂપિયા આઠ કરોડ ઈંદ્રચાસી લાખ પંચાવન હજાર પૂરા) મેળવવાના થાય છે. તો તેથી વિદિત થઈ પુસ્તકાલયના સને ૨૦૧૬-'૧૭ ના વર્ષનું અંદાજપત્ર આપના વ્યવસ્થાપક મંડળ સમક્ષ રજૂ કરી તે અંગે યોગ્ય માર્ગદર્શન અને નિર્ણય મેળવી આપવા વિનંતી છે.

સહી : ડૉ. બિપીન જે. મોદી

ગ્રંથપાલ

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અમદાવાદ-૩૮૦૦૦૬.

વ્યવસ્થાપક મંડળ ઠરાવ નં. ૫૨ : ૨૦૧૫-૨૦૧૬

તા. ૨૩-૧-૨૦૧૬

ઠરાવ કર્યો કે, શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના ગ્રંથપાલશ્રીએ સને ૨૦૧૬-૧૭ના વર્ષના રજૂ કરેલ રૂ. ૮,૪૩,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા નવ કરોડ તેતાળીસ લાખ પૂરા)ના અંદાજીત ખર્ચ અને રૂ. ૫૪,૪૫,૦૦૦/- (અંકે રૂપિયા ચોપન લાખ પિસ્તાળીસ હજાર પૂરા)ની અંદાજેલ આવક અંગે બોર્ડમાં થયેલ ચર્ચા મુજબ અંદાજીત ખર્ચની રકમમાં નીચે જણાવેલ વિગતે નવીન આયોજનો માટે રૂ. ૨૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એકવીસ લાખ પૂરા)નો વધારો કરી કુલ અંદાજીત ખર્ચ રૂ. ૮,૬૪,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા નવ કરોડ ચોસઠ લાખ પૂરા)માંથી અંદાજીત આવકની રકમ રૂ. ૫૪,૪૫,૦૦૦/- (અંકે રૂપિયા ચોપન લાખ પિસ્તાળીસ હજાર પૂરા) બાદ કરતા ચોઘ્યી રકમ રૂ. ૮,૦૮,૫૫,૦૦૦/- (અંકે રૂપિયા નવ કરોડ નવ લાખ પંચાવન હજાર પૂરા) ટ્રસ્ટડીડની કલમ-૮ મુજબ અમદાવાદ ભૂનિસિપલ કોર્પોરેશન પાસેથી ગ્રાન્ટ તરીકે મેળવવાની ભૂ. કમિશનરશી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી મારફતે ભૂનિસિપલ કોર્પોરેશનની મંજૂરી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે.

(૧) 'અટલ' વિચાર મંચ : રૂ. ૨.૦૦ લાખ

નવોદીત કલાકારોને તેમની સાહિત્ય, કલા, કવન-પઠન તથા સામાજિક તથા રાજકીય પરિપ્રેક્ષ્યમાં વિચારોની અભિવ્યક્તિ માટે મંચ પૂરુષ પાડવા તેમજ સાંપ્રદાયિક વિષયો ઊપર પરિસંવાદના આયોજન માટે 'અટલ વિચાર મંચ' નો પ્રારંભ કરાશે.

(૨) મા.જે. પુસ્તકાલયના સ્થાપનાદિન નિમિત્તે 'ગ્રંથયાત્રા' નું તથા 'વાંચે અમદાવાદ' અભિયાનનું આયોજન : રૂ. ૨.૦૦ લાખ
શેઠ મા.જે. પુસ્તકાલયના સ્થાપના દિન (૧૫ એપ્રિલ) નિમિત્તે સમાજમાં ખાસ કરીને યુવા વર્ગની વાંચન પરતેની અભિવ્યક્તિ કેળવાય તેવા પ્રયત્નોના ભાગ રૂપે 'ગ્રંથયાત્રા' નું તેમજ 'વાંચે અમદાવાદ' અભિયાન અંતર્ગત શહેરની શાળા-મહાશાળાઓ તથા કોર્પોરેશન સંચાલિત વાચન કેન્દ્રોમાં વિશેષ અભિયાનનું આયોજન.

(3)	ઓડિટોરીયમમાં એલ.ઈ.ડી. ટીવી અને ડી.વી.ડી. પ્લેયર દ્વારા કાયમી કાર્યક્રમોનું આયોજન : દેશ દુનિયાની ભાતિગળ સંસ્કૃતિ તથા સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રગતિથી શહેરેજનોને અવગત કરાવવા એલ.ઈ.ડી. ટીવી અને ડી.વી.ડી. પ્લેયરની સુવિધા સાથે ઓડિયો વિજ્ઞ્યુઅલ પ્રેઝન્ટેશનની મા.જે. પુસ્તકાલયના ઓડિટોરીયમમાં કાયમી વ્યવસ્થાનું આયોજન.	રૂ. ૫.૦૦ લાખ
(4)	લાઈવ સ્કોલ (જીવંત પ્રસારણ)નું આયોજન : દેશ તથા દુનિયાના સાંપ્રત પ્રવાહોથી નગરજનો સતત માહિતગાર રહે તે માટે લાઈવ ન્યૂઝના સ્કોલ (જીવંત પ્રસારણ) માટેની કાયમી વ્યવસ્થાનું આયોજન.	રૂ. ૫.૦૦ લાખ
(5)	પ્રજાચક્ષુ બાળકો માટે રાષ્ટ્રગાન સ્પર્ધાનું આયોજન : શહેરના પ્રજાચક્ષુ બાળકો માટે ‘પંડિત સુખલાલજી’ તેમજ ‘શ્રી નીલકંઠરાય છત્રપતિ’ ની જન્મજયંતિના અનુસંધાને રાષ્ટ્રગાન સ્પર્ધાનું આયોજન.	રૂ. ૧.૦૦ લાખ
(6)	‘ટ્રાફિક અવેરનેસ’ માટે પરિસંવાદ તેમજ ‘પોસ્ટર મેકીંગ સ્પર્ધા’ નું આયોજન : શહેરમાં પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યાની લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી તથા તેના નિવારણ માટે ‘ટ્રાફિક અવેરનેસ’ પરિસંવાદ તથા શાળાના બાળકો માટે ‘પોસ્ટર મેકીંગ સ્પર્ધા’ નું આયોજન.	રૂ. ૧.૦૦ લાખ
(7)	‘ગરવા ગુજરાતી’ ના ફોટોગ્રાફસ અને માહિતી સાથેનું કાયમી પ્રદર્શન : ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો, કવિઓ, રાજકીય તથા સામાજિક આગેવાનોના ફોટોગ્રાફ તથા માહિતી સાથેનું ‘ગરવા ગુજરાતીઓ’ અંતર્ગત કાયમી પ્રદર્શનનું આયોજન.	રૂ. ૨.૦૦ લાખ
(8)	‘મહિલા-બાળ આરોગ્ય જાગૃતિ’ પરિસંવાદ : મહિલાઓ તથા બાળકોમાં આરોગ્ય વિશેની જાગૃતતા કેળવાય તે માટે ‘મહિલા તથા બાળ આરોગ્ય જાગૃતિ’ પરિસંવાદ તથા ‘મહિલા સશક્તિકરણ’ ના સંદર્ભમાં વિવિધ કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન.	રૂ. ૧.૦૦ લાખ
(9)	‘સ્માર્ટ સીટી અમદાવાદ’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન : સ્માર્ટ સીટી અમદાવાદ અંતર્ગત આંતર શાળાકીય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવું.	રૂ. ૧.૦૦ લાખ
(10)	સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ‘અભિહાસિક નારીપાત્રો’ વેશભૂષા-સ્પર્ધાનું આયોજન : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ‘અભિહાસિક નારીપાત્રો’ વેશભૂષા-સ્પર્ધાનું આયોજન કરવું. નવીન આયોજનના ખર્ચની કુલ રકમ રૂ. ૨૧,૦૦,૦૦૦/- થાય છે.	રૂ. ૧.૦૦ લાખ

સહી : કિશોરભાઈ રાડોડ

ખ્રુ. સેકેટરી

અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન,

અમદાવાદ.

સહી : ગૌતમભાઈ શાહ

ચેરમેન

વ્યવસ્થાપક મંડળ

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અમદાવાદ-૩૮૦૦૦૬.

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.

ગ્રંથપાલશ્રીએ રજૂ કરેલ સને ૨૦૧૬-૨૦૧૭ના બજેટના ખરડાની તારણા

સને ૨૦૧૬-૨૦૧૭માં ખર્ચની અંદાજીત રકમ	રૂ. ૮,૪૩,૦૦,૦૦૦/-
સને ૨૦૧૬-૨૦૧૭માં આવકની અંદાજીત રકમ	રૂ. ૫૪,૪૫,૦૦૦/-
સને ૨૦૧૬-૨૦૧૭માં ખર્ચની ચોખ્ખી રકમ	રૂ. ૮,૮૮,૫૫,૦૦૦/-
દ્રસ્ટદીઓની કલમ-૮ અનુસાર માંગવાની થતી ગ્રાન્ટની કુલ રકમ	રૂ. ૮,૮૮,૫૫,૦૦૦/-

અંકે રૂપિયા આઠ કરોડ અઠચાસી લાખ પંચાવન હજાર પૂરા.

પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળે તેમના ઠરાવ નં. ૫૨ : ૨૦૧૫-'૧૬

તા. ૨૩-૧-૨૦૧૬ અનુસાર નવીન આયોજનો સાથે સુધારેલ બજેટના ખરડાની તારણા.

સને ૨૦૧૬-૨૦૧૭માં ખર્ચની અંદાજીત રકમ	રૂ. ૮,૬૪,૦૦,૦૦૦/-
સને ૨૦૧૬-૨૦૧૭માં આવકની અંદાજીત રકમ	રૂ. ૫૪,૪૫,૦૦૦/-
સને ૨૦૧૬-૨૦૧૭માં ખર્ચની ચોખ્ખી રકમ	રૂ. ૮,૦૮,૫૫,૦૦૦/-
દ્રસ્ટદીઓની કલમ-૮ અનુસાર માંગવાની થતી ગ્રાન્ટની કુલ રકમ	રૂ. ૮,૦૮,૫૫,૦૦૦/-

અંકે રૂપિયા નવ કરોડ નવ લાખ પંચાવન હજાર પૂરા.

મ્યુ. કમિશનરશ્રીનો પત્ર, નાણાં ખાતુ (બજેટ વિભાગ)

નં. CA/MIS/SC/4 તા. ૨૭-૦૧-૨૦૧૬

સ્ટેન્ડિંગ કમિટીની તા. ૨૭-૦૧-૨૦૧૬ની મુલત્વી રહેલ મીટિંગ મંગળવાર તા. ૦૨-૦૨-૨૦૧૬ના રોજ
બપોરના ૧૨-૧૫ વાગે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં મળી હતી. તેમાં થયેલ ઠરાવની નકલ.

બાકી કામ નં.૮

ઠરાવ નં. ૧૨૫૨

સને ૨૦૧૫-૨૦૧૬

ઠરાવ કર્યો કે મ્યુ.કમિ.શ્રીના પત્ર નં. CA/MIS/SC/4 તા. ૨૭-૦૧-૨૦૧૬ની સઘળી હકીકતથી વિદિત
થઈ શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળના ઠરાવ નં. ૫૨/૨૦૧૫-૨૦૧૬,
તા. ૨૩-૦૧-૨૦૧૬માં જણાવ્યા અનુસાર શેઠ મા.જે. પુસ્તકાલયને સને ૨૦૧૬-૨૦૧૭ના વર્ષ માટે સામાન્ય
ખર્ચ અંગે મ્યુ.કોર્પો.ના રેવન્યુ એકાઉન્ટમાંથી નેટ રૂ. ૮૦૮.૫૫ લાખની રકમ ગ્રાન્ટ તરીકે આપવાની મંજૂરી
આપવા મ્યુ.કોર્પો.ને ભલામણ કરવામાં આવે છે.

સહી: અરૂણભાઈ આર. પંડ્યા
ઈન્ચાર્જ મ્યુ. સેકેટરી

સને ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે ગ્રંથપાલશ્રીએ રજૂ કરેલ અંદાજીત આવક અને ખર્ચની સંક્ષિમ માહિતી નીચે પ્રમાણે છે.

-: અંદાજીત આવક અને ખર્ચની માહિતી :-

આવક -

ક્રમ	વિગત	અંદાજીત રકમ	ટકાવારી
૧.	અમદાવાદ મ્યુ. કોર્પો.ની ગ્રાન્ટ	૮,૦૯,૫૫,૦૦૦	૮૪.૩૪%
૨.	પુસ્તકાલયની આવક	૫૪,૪૫,૦૦૦	૦૫.૬૫%
	કુલ આવક	૮,૬૪,૦૦,૦૦૦	૧૦૦.૦૦%

ખર્ચ -

ક્રમ	વિગત	૨૦૧૬-૧૭ના રજૂ કરેલા અંદાજો	૨૦૧૬-૧૭ની કુલ અંદાજીત ખર્ચની ટકાવારી
૧.	વાચન સામગ્રી		
	A. પુસ્તક	૪૫,૧૦,૦૦૦	૪.૬૮%
	B. સામયિકો - વર્તમાનપત્રો	૭,૧૪,૦૦૦	૦.૭૪%
	C. અગ્રંથ	૪,૪૦,૦૦૦	૦.૪૭%
	D. વિજ્ઞાણ માધ્યમ	૧,૨૫,૦૦૦	૦.૧૩%
		૫૮,૦૦,૦૦૦	૬.૦૨%
૨.	પુસ્તકાલય સેવા ખર્ચ	૫૪,૪૫,૦૦૦	૫.૬૫%
૩.	વહીવટી ખર્ચ	૧૮,૩૪,૦૦૦	૧.૬૦%
૪.	મેન્ટેનન્સ ખર્ચ	૧,૨૪,૫૦,૦૦૦	૧૨.૬૨%
૫.	કોમ્પ્યુટર, આઈટી લાયબ્રેરી ઓટોમેશન	૨૩,૨૫,૦૦૦	૨.૪૧%
૬.	એસ્ટાબિશમેન્ટ ખર્ચ (મહેકમ)	૬,૧૬,૦૦,૦૦૦	૬૩.૬૦%
૭.	પરચુરણ ખર્ચ	૪,૪૫,૦૦૦	૦.૪૬%
૮.	કેપીટલ ખર્ચ	૪૪,૦૦,૦૦૦	૪.૫૬%
૯.	વ્યવસ્થાપક મંડળે રજૂ કરેલ નવીન આયોજનો	૨૧,૦૦,૦૦૦	૨.૧૮%
		૮,૬૪,૦૦,૦૦૦	૧૦૦%

પત્રક - ‘એ’

સને ૨૦૧૬ સુધીના શિઅયુલ પરના જુદા જુદા હોદાની વિગત (જુન-૨૦૧૬)

ક્રમ	હોદ્દો	પે-બેન્ડ	વર્ગ	ગ્રેડ-પે	સ્પે. પે. રૂ.	ભરાયેલી ખાતી જગ્યાની જગ્યા	કુલ જગ્યા
						જગ્યાની જગ્યા	સંખ્યા
ટેકનિકલ કેડરની જગ્યાઓ :							
૧.	ગ્રંથપાલ	૧૫૬૦૦/૩૮૧૦૦	(વર્ગ ૧)	૬૬૦૦	સ્પે. પે રૂ. ૧૦૦૦/-	૧	- ૧
૨.	સહાયક ગ્રંથપાલ	૮૩૦૦/૩૪૮૦૦	(વર્ગ ૨)	૪૮૦૦		- ૩	૩
૩.	જુનિયર સહાયક ગ્રંથપાલ	૮૩૦૦/૩૪૮૦૦	(વર્ગ ૨)	૪૬૦૦	મોટર સાયકલ ભથ્થુ	૧	- ૧
૪.	ટેકનિકલ આસીસ્ટન્ટ	૮૩૦૦/૩૪૮૦૦	(વર્ગ ૩)	૪૨૦૦		૨	- ૨
૫.	જુનિયર ટેકનિકલ આસીસ્ટન્ટ	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૨૪૦૦		- ૨	૨
૬.	એટેન્ડન્ટ લાયબ્રેરી	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૧૬૦૦	૧ ફે. લ્યા. ઈ. રૂ. ૮૦/-	૨૫	૮ ૪૮
	એટેન્ડન્ટ લાયબ્રેરી (૧)	અ.ભ્ય. કોર્પો.માં	(વર્ગ ૩)	૧૬૦૦	૧ ફે. લ્યા. ઈ. રૂ. ૭૫/-		
	સહા. એટેન્ડન્ટ લાયબ્રેરી	ટેચ્યુ. પર ગયેલ					
		ઉચ્ચાક ફિક્સ વેતન	(વર્ગ ૩)	રૂ. ૭૨૦૦		૧૩	૨ -
વહીવરી કેડરની જગ્યાઓ :							
૭.	ઓફિસ સુપ્રિટેન્ડન્ટ	૮૩૦૦/૩૪૮૦૦	(વર્ગ ૨)	૪૬૦૦		- ૧	૧
૮.	સહાયક એકાઉન્ટન્ટ	૭૩૦૦/૩૪૮૦૦	(વર્ગ ૩)	રૂ. ૬૬૦૦		૧	- ૧
૯.	હેડ કલાર્ક	૮૩૦૦/૩૪૮૦૦	(વર્ગ ૩)	૪૨૦૦	૧ ફે. લ્યા. ઈ. રૂ. ૧૦૦/-	૨	૨ ૪
૧૦.	સિનિયર કલાર્ક	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૨૪૦૦	૧ કેશ એલા. રૂ. ૧૨૫/- ૧ ફે. લ્યા. ઈ. રૂ. ૫૫/- ૧ ફે. લ્યા. ઈ. રૂ. ૭૫/-	૩	૨ ૫
૧૧.	જુનિયર કોમ્પ્યુટર કમ કલાર્ક	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૧૬૦૦	-	૧ ૧	૨
આઈસોલેટેડ જગ્યાઓ :							
૧૨.	જુનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર	૮૩૦૦/૩૪૮૦૦	(વર્ગ ૩)	૪૪૦૦		- ૧	૧
૧૩.	ટાઇપીસ્ટ	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૨૪૦૦		૩	- ૩
૧૪.	ઇવેન્ટ પ્રોગ્રામર	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૨૪૦૦		૧	- ૧
૧૫.	મશીન ઓપરેટર	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૧૬૦૦		૧	- ૧
૧૬.	સર્વેયર	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૧૬૦૦		૧	- ૧
૧૭.	મ્યુઝિયમ એટેન્ડન્ટ	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૧૬૦૦		૨	- ૨
૧૮.	પ્રાયવર	૫૨૦૦/૨૦૨૦૦	(વર્ગ ૩)	૧૬૦૦		૧	૨ ૩
	પ્રાયવર (૧)	અ.ભ્ય. કોર્પો.માંથી ટેચ્યુ. પર આવેલ					
	પ્રાયવર (૨)	રોજંદા વેતનથી					
વર્ગ-૪ની જગ્યાઓ :							
૧૯.	નાયક	૪૪૦૦/૭૪૪૦	(વર્ગ ૪)	૧૬૪૦		- ૧	૧
૨૦.	પટાવાળા	૪૪૪૦/૭૪૪૦	(વર્ગ ૪)	૧૩૦૦		૭ ૩	૧૦
૨૧.	ફિરાસ	૪૪૪૦/૭૪૪૦	(વર્ગ ૪)	૧૩૦૦		૧૧ ૭	૧૮
૨૨.	માળી	૪૪૪૦/૭૪૪૦	(વર્ગ ૪)	૧૩૦૦		૧	- ૧
૨૩.	પાણીવાળા બહેન	૪૪૪૦/૭૪૪૦	(વર્ગ ૪)	૧૩૦૦		૧	- ૧
૨૪.	સફાઈ કામદાર	૪૪૪૦/૭૪૪૦	(વર્ગ ૪)	૧૩૦૦		૨ ૩	૫

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૧૨
ફાળવેલ રકમો અને તેવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો
સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલબજ્વાણીની રીત

શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર નં. ૧૨

ફાળવેલ રકમો અને તેવા કાર્યકમોના લાભાર્થીઓની વિગતો સહિત
આર્થિક સહાય કાર્યકમોની અમલબજવણીની રીત

૧૨:૧ NILL

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૧૩
પુસ્તકાલયે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા
અધિકૃતિઓ મેળવનારાની વિગતો

શોઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૧૩

પુસ્તકાલયે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા
અધિકૃતિઓ મેળવનારાની વિગતો

- ૧૩ : ૧ પુસ્તકાલયના વાચનાલય - સામયિક વિભાગમાં તમામ પ્રકારના વાચકોને મુક્ત પ્રવેશ આપવામાં આવે છે.
- ૧૩ : ૨ પુસ્તકાલયની વિસ્તરણ સેવાના અનુસંધાનમાં સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મુક્ત પ્રવેશ આપવામાં આવે છે.

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૧૪
ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પુસ્તકાલયને ઉપલબ્ધ અથવા
પુસ્તકાલયે ધરાવેલ માહિતી ને લગતી વિગતો

શોઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

અલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડીસ્કલોગર નં. ૧૪

ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પુસ્તકાલયને ઉપલબ્ધ અથવા
પુસ્તકાલયે ધરાવેલ માહિતી ને લગતી વિગતો

૧૪:૧ પુસ્તકાલયમાં ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી નીચે દર્શાવ્યા મુજબ આપવામાં આવે છે.

- ટેલિવિઝન દ્વારા બાળકોને શૈક્ષણિક તેમજ મનોરંજક માહિતી.
- ઇન્ટરનેટ દ્વારા બાળકોને શૈક્ષણિક તેમજ મનોરંજક માહિતી
- ઇન્ટરનેટ દ્વારા વાચક સભ્યો તેમને જોઈતી માહિતીનું સંશોધન કરી શકે છે.
- વી.સી.ડી./ ઓડિયો-વિડીયો કેસેટ દ્વારા વાચકોને ઉપલબ્ધ માહિતી મળી શકે છે.

૧૪:૨ પુસ્તકાલયમાં કુલ ૨૪૫૫ સી.ડી. છે.

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોઝર નં. ૧૫

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલય અથવા
તેના વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે
નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓને વિગતો

-શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય અને શાખા પુસ્તકાલયો :-

૧. શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય
એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.
ફોન : ૦૭૯-૨૬૫૭૪૪૮૨, ૨૬૫૭૮૫૧૩
ટેલીફોન : ૨૬૫૮૬૬૦૮
૨. ચંદ્રકાન્ત કેશવલાલ કસ્ટીયા મ્યુ. પુસ્તકાલય
જ્લોક નં. ૮૩ ની સામે, ગુજરાત હાઉસિંગ બોર્ડ,
નૂતન નાગરિક બેંકની ઉપર, હરિશ્ચંદ્ર પાર્ક ચારરસ્તા,
પ્રગતિનગર રોડ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.
ફોન : ૦૭૯-૨૭૪૭૪૮૬૮
૩. કવિ શ્રી રામનારાયણ પાઠક 'દ્વિરેષ' મ્યુ. વાચનાલય
અજીત ભગત મેમોરીયલ ટ્રસ્ટ,
કાલુપુર વોર્ડ નં. ૨, સર્વે નં. ૪૬૭, સેન્શસન નં. ૨૬૮,
સાંચોરાનો ખાંચો, દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ - ૧.
૪. માણભહુ પ્રેમાનંદ મ્યુ. પુસ્તકાલય
મરાઠી શાળા નં. ૧-૨, વિજય મીલની સામે, અસારવા, નરોડા રોડ, અમદાવાદ.
૫. શ્રી સુરેશભાઈ રામકુમાર જોધી (સુરેશ જોધી) મ્યુ. વાચનાલય
મ્યુ. શાળા નં. ૮-૧૦, તળિયાની પોળની સામે, સરસપુર, અમદાવાદ - ૧૮.
૬. શામળ ભહુ મ્યુ. વાચનાલય
લલિતેશ્વર મહાદેવની સામે, ન્યુ કોટન સર્કલ પાસે, અમરાઈવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૨૬.
૭. કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહ મ્યુ. પુસ્તકાલય
ગાંધીગ્રામ સબજોનલ ઓફિસની બાજુમાં,
હિંમતલાલ પાર્ક ચારરસ્તા, આજાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ.
ફોન : ૦૭૯-૨૬૭૬૯૯૫૮
૮. આત્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી શાખા પુસ્તકાલય
મણીનગર ટેનીસ કોટની બાજુમાં,
કમલા નહેરુ ઉઘાનની પાછળ, ઉત્તમનગર, મણીનગર, અમદાવાદ.
ફોન : ૦૭૯ - ૨૫૪૪૦૦૩૪
૯. ગરદ્ધાધિપતિ આચાર્યશ્રી
સુબોધસાગર સૂરિશ્વરજી મહારાજશ્રી શાખા પુસ્તકાલય
ચંદ્રનગર રોડ, અંજલી ચાર રસ્તા પાસે, વાસણા, અમદાવાદ.
ફોન : ૦૭૯-૨૬૬૦૭૮૦૩
૧૦. ડૉ. શ્યામાપ્રસાદ મુખજી પુસ્તકાલય
ડૉ. શ્યામાપ્રસાદ મુખજી ઓવરબ્રીજ નીચે, વેજલપુર, અમદાવાદ.

મા.જે. પુસ્તકાલય સંચાલિત અ.મ્યુ. કોર્પોરેશનના પુસ્તકાલય-વાંચનાલયોની યાદી

ઈન્ચાર્જ : શ્રી મગનલાલ સી. ગામેતી ફોન : (ઓ) ૨૬૫૭૮૫૧૩, ૨૬૫૭૪૪૮૨ (મો.) ૯૪૨૭૪૫૫૦૫૧

ક્રમ	પુસ્તકાલયનું નામ	સરનામું
૧.	પન્નાલાલ પટેલ મ્યુનિ. વાંચનાલય	ગોમતીપુર દરવાજા પાસે, ગોમતીપુર, અમદાવાદ.
૨.	નીખુભાઈ ચાવડા મ્યુનિ. વાંચનાલય	સ્વ. શ્રી લીલાધર ભાઈ હોલ પાસે, બહેરામપુરા, અમદાવાદ.
૩.	શ્રી ચીમનલાલ પુરુષોત્તમદાસ ગજજર મ્યુનિ. વાંચનાલય	જીવણ કુમળશીની પોળના સામે, શાહીપુર દરવાજા બઢાર, અમદાવાદ.
૪.	સુરેન્દ્રભાઈ પટેલ (દાસકાકા) મ્યુનિ. વાંચનાલય	ઢાણની પોળ, આસ્ટોડીયા ચકલા, અમદાવાદ.
૫.	શેખાદમ આલુવાલ મ્યુનિ. વાંચનાલય	જમાલપુર પગથિયા પાસે, જમાલપુર, અમદાવાદ.
૬.	શ્રી રમણલાલ નીલકંઠ મ્યુનિ. વાંચનાલય	જોસફ સુલની બાજુમાં, રાજપુર-ગોમતીપુર, અમદાવાદ.
૭.	રા. બ. ગી. ઉ. મ્યુનિ. વાંચનાલય	ખોટી આંબલી મ્યુ. શાળા પાસે, અમદાવાદ.
૮.	શૂન્ય પાલનપુરી મ્યુનિ. વાંચનાલય	સોદાગરની પોળ, જમાલપુર દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ.
૯.	તીર્થિકર ઉદ્યાન મ્યુનિ. વાંચનાલય	તીર્થિકર ઉદ્યાન, રાજસ્થાન હોસ્પિટલ સામે, અમદાવાદ.
૧૦.	જેઠાભાઈ ગાઈન મ્યુનિ. વાંચનાલય	જેઠાભાઈ ગાઈન, સિવિલ હોસ્પિટલ સામે, અમદાવાદ.
૧૧.	કવિ દ્યારામ મ્યુનિ. વાંચનાલય	ગાંધીપાર્ક સોસાયટી, નિકોલ, અમદાવાદ.
૧૨.	શ્રી કનેયાલાલ ભીલ શાખા પુસ્તકાલય	ગુરુદુર્ગા પંથીગ સ્ટેશનની બાજુમાં, કુબેનગર, અમદાવાદ.
૧૩.	કાકા સાહેબ કાલેલકર મ્યુનિ. પુસ્તકાલય	રીકીએશન કલ્યાસ સેન્ટર, સ્વીમીંગપુલ ગુજરાત ફીજુકલ કંપાઉન્ડ, સી.ટી.એમ. ચાર રસ્તા, બાગે ફીરદોશ, અમદાવાદ.
૧૪.	શ્રી રમણલાલ દેસાઈ શાખા પુસ્તકાલય	કિઝાપાર્ક ટયુબવેલ સ્ટેશનની સામે, ફાઈનલ પ્લોટ નં. ૨૮, નિકોલ, અમદાવાદ.
૧૫.	કવિ સુરેશ જોધી શાખા પુસ્તકાલય	ખોખરા સર્કલ, જુના મેલેરિયા ઓફિસ, મ્યુ. શાળાની બાજુમાં, અમદાવાદ.
૧૬.	શ્રી કનેયાલાલ માણેકલાલ મુન્શી મ્યુ. પુસ્તકાલય	સ્વસ્તિક ચારરસ્તા પાસે, ભીલવાડા રોડ, ભાઈપુરા, અમદાવાદ.
૧૭.	શ્રી નરસિંહરાવ હિવેટીયા મ્યુ. પુસ્તકાલય	૧૩૨, કોટ રોડ, સ્વસ્તિક ચારરસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ.
૧૮.	કે.કા. શાસ્તી છિન્ફર્મેશન ટેકનોલોજી લાયબ્રેરી	ધરણીખર ચારરસ્તા પાસે, પાલડી, અમદાવાદ.
૧૯.	શ્રી ચંદ્રકાન્ત બખી મ્યુ. પુસ્તકાલય	દેવપથ ફ્લેટની પાછળા, અર્બન ડેલ્ટ સેન્ટરની ઊપર, નવાવાડ્યા, અમદાવાદ.
૨૦.	કવિ દલપતરામ મ્યુ. પુસ્તકાલય	કેલિકો રોમની સામે, રિલીફ રોડ, કાલપુર, અમદાવાદ.
૨૧.	શ્રી ઉમાશંકર જોધી મ્યુ. પુસ્તકાલય	શાહીભાગ સર્કિટ હાઉસની સામે, વીરાંજલી-૧, શાહીભાગ, અમદાવાદ.
૨૨.	શાખા પુસ્તકાલય બોડકદેવ	એમ.ડી. એસ. ટાવર પાસે, જીસ બંગલો રોડ, ઔડા ગાઈનની બાજુમાં, અમદાવાદ.
૨૩.	નારણભાઈ રણાંધોડભાઈ ચૌહાણ મ્યુ. અભ્યાસ ગૃહ	પારસી અગ્રીયારી પાસે, આબાદ તેરી સામે, કંકરિયા, અમદાવાદ.
૨૪.	કવિ મણીશંકર રતનાજી ભાઈ 'કવિ કાન્ત' મ્યુનિ. પુસ્તકાલય	બાજુદેશાવાડ સોસાયટી, ખોખરા, અમદાવાદ.
૨૫.	દાદાભાઈ નવરોજી મ્યુનિ. પુસ્તકાલય	પાનકોરનાકા પાસે, ગાંધીરોડ, અમદાવાદ.
૨૬.	ભાઈશંકર નાનાલાલ મ્યુનિ. પુસ્તકાલય	પંડિતજીની પોળના નાકે, રાયપુર ચકલા, અમદાવાદ.
૨૭.	ગોવર્ધનરામ ત્રિપાઠી મ્યુનિ. પુસ્તકાલય	રામભાગ ફાયર બ્રિગેડ સામે, મહિનગર, અમદાવાદ.

૨૮.	મહાત્મા ગાંધી મુનિ. પુસ્તકાલય	રામનગર ચોક, સાબરમતી, અમદાવાદ.
૨૯.	શ્રી વિ.ન. શાહ મુનિ. પુસ્તકાલય	રખિયાલ ચાર રસ્તા પાસે, રખિયાલ, અમદાવાદ.
૩૦.	જ્યોતિન્દ્ર દવે મુનિ. પુસ્તકાલય	સ્વ. શ્રી લાલાકાકા હોલ પાસે, શાહપુર દરવાજી બહાર, અમદાવાદ.
૩૧.	પટેલ કે. કે. મુનિ. પુસ્તકાલય	નરોડા ગામના નાકે, નરોડા, અમદાવાદ.
૩૨.	ક્રીટિલ્ય મુનિ. પુસ્તકાલય	અસારવા ચકલા પાસે, અસારવા.
૩૩.	શ્રી રાધાકીશન શર્મા મુનિ. પુસ્તકાલય	પોલીસ ચોકી સામે, આંબાવાડી, સરદારનગર, અમદાવાદ.
૩૪.	કવિ ન્હાનાલાલ મુનિ. પુસ્તકાલય	ફાયર બ્રિગેડ પાસે, ધર્મનગર, સરદારનગર, અમદાવાદ.
૩૫.	સ્વ. લાલભાઈ કુંદીવાળા મુનિ. પુસ્તકાલય	અંજુમન છાઈસ્કુલ પાસે, ધીપાવાડ, જમાલપુર, અમદાવાદ.
૩૬.	પંડિત દીનદયાલ મુનિ. પુસ્તકાલય	ઠાકોરવાસ, ઘાટલોડિયા, અમદાવાદ.
૩૭.	ડૉ. બાબાસાહેબ મુનિ. પુસ્તકાલય	કુંડવાળી ચાલી, ગોમતીપુર દરવાજી બહાર, ગોમતીપુર, અમદાવાદ.
૩૮.	કવિ નર્મદ મુનિ. પુસ્તકાલય	ઢાણપુરા ગાડીન, બારડોલપુરા, અમદાવાદ.
૩૯.	શ્રી ઈશ્વરલાલ કચરાભાઈ પરમાર મુનિ. પુસ્તકાલય	શ્રીજી વિદ્યાલય સામે, બાપુનગર, અમદાવાદ.
૪૦.	શ્રી વસંતભાઈ રામી મુનિ. પુસ્તકાલય	જોધપુર ગ્રામ પંચાયત પાસે, જોધપુર, અમદાવાદ.
૪૧.	શ.ચ. પટેલ સીની સીટી મુનિ. પુસ્તકાલય	દિનાળા, શાહીબાગ, અમદાવાદ.
૪૨.	સેજપુર મ્યુ. વાચનાલય	સેજપુર બોધા, અમદાવાદ.
૪૩.	સોલા મ્યુ. વાચનાલય	સોલા, અમદાવાદ.
૪૪.	ટક્કરબાપા નગર મ્યુ. વાચનાલય	કલ્યાણ ચોક, ટક્કરબાપા નગર, અમદાવાદ.

મા.જે. પુસ્તકાલય સંચાલિત અ.મ્યુ. કોર્પોરેશનના બાલભવનોની યાદી

ક્રમ	બાલભવનનું નામ	સરનામું
૧.	મણિનગર બાલભવન	રામબાગ, મ્યુ. ફાયર સ્ટેશન સામે
૨.	સરસપુર બાલભવન	મણિબહેન કે. કે. આંબની હોસ્પિટલની બાજુમાં
૩.	ગોમતીપુર બાલભવન	ગોમતીપુર મ્યુ. પુસ્તકાલયના મેડા ઉપર
૪.	ઢાળની પોળ બાલભવન	ઢાળની પોળ, આસ્ટોડિયા ચકલા
૫.	ફેલદુરા બાલભવન	ફેલદુરા ગામમાં (પાલડીથી આગળ)
૬.	રાયપુર બાલભવન	રાયપુર દરવાજી બહાર, મહિપતરામ આશ્રમ સામે

-: પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ :-

૨. શ્રી ગૌતમભાઈ નવલચંદ શાહ મેયરશ્રી તથા અધ્યક્ષ, અ.મ્યુ. કોર્પોરેશન	સભ્યશ્રી
૨. શ્રી પ્રવિષ્ણુભાઈ ભગવાનદાસ પટેલ ચોરમેનશ્રી, સ્ટે. કમિટી, અ.મ્યુ. કોર્પોરેશન	સભ્યશ્રી
૩. ડૉ. જગદીશભાઈ ભોગીલાલ ભાવસાર ચોરમેનશ્રી, સ્કૂલ બોર્ડ, અમદાવાદ.	સભ્યશ્રી
૪. સ્વ. શેઠ રસિકલાલ માણેકલાલ	દાતા-સભ્ય (જગા ખાલી)
૫. ડૉ. હેમન્તભાઈ ભડુ	કો-ઓપ્ટ વિદ્યાન સભ્યશ્રી
૬. શ્રીમતી મીનાક્ષીબેન દેસાઈ	કો-ઓપ્ટ વિદ્યાન સભ્યશ્રી
૭. શ્રી દિલીપ એસ. ગોર ડે.મ્યુ. કમિશનરશ્રી	મ્યુનિસિપલ કમિશનરશ્રીના પ્રતિનિધિ તરીકે
૮. શ્રી અરુણભાઈ આર. પંડ્યા મ્યુ. સેકેટરીશ્રી	મ્યુ. સેકેટરીશ્રી

ગ્રંથપાલ:

ડૉ. બિપીનભાઈ જે. મોદી

-ઃ બાળકો માટેનું ફરતું પુસ્તકાલય - સમય પત્રક :-

સોમવાર : સોલા હાઉસીંગ - સાખરમતી

(૧) પંચવીલા ટાવર	૦૮-૩૦ થી ૦૯-૦૦
(૨) રત્નાદિપ એપાર્ટમેન્ટ	૦૯-૧૫ થી ૦૯-૪૫
(૩) નિર્મલ એપાર્ટમેન્ટ	૧૦-૦૦ થી ૧૦-૩૦
(૪) ધર્મનગર	૧૧-૪૫ થી ૧૨-૧૫
(૫) સમરતનગર	૧૨-૩૦ થી ૦૧-૦૦
(૬) કેશવનગર	૦૧-૧૫ થી ૦૧-૪૫

મંગળવાર : ઘોડાસર - મણીનગર

(૧) મણીનગર ચારરસ્તા	૦૮-૪૫ થી ૦૯-૧૫
(૨) દક્ષિણી સોસાયટી	૦૯-૩૦ થી ૧૦-૦૦
(૩) ગોરનો કુવો	૧૦-૦૦ થી ૧૦-૩૦
(૪) એલવોન	૧૦-૪૫ થી ૧૧-૧૫
(૫) આકૃતિ એપાર્ટમેન્ટ	૧૧-૩૦ થી ૧૨-૦૦

બુધવાર : ઓઢવ - શાહીબાગ

(૧) હર ભોળાનાથ	૦૮-૪૫ થી ૦૯-૩૦
(૨) ફૂઝાનગર	૦૯-૪૫ થી ૧૦-૧૫
(૩) સમાટનગર	૧૧-૦૦ થી ૧૨-૦૦
(૪) વસંત વિહાર	૧૨-૩૦ થી ૦૧-૦૦

ગુરુવાર : અંબાવાડી - સેટેલાઈટ

(૧) એસિક એપાર્ટમેન્ટ	૦૮-૪૫ થી ૦૯-૧૫
(૨) કનકકલા એપાર્ટમેન્ટ	૦૯-૧૫ થી ૦૯-૪૫
(૩) વિકમનગર	૧૦-૦૦ થી ૧૦-૩૦
(૪) આશ્રય એપાર્ટમેન્ટ	૧૧-૦૦ થી ૧૨-૦૦
(૫) ગોયલ ખાજા	૧૨-૦૫ થી ૧૨-૩૦

શુક્રવાર : વાસણા - જીવરાજપાઈ

(૧) ભાવના એપાર્ટમેન્ટ	૦૮-૪૫ થી ૦૯-૧૫
(૨) શેફાલી એપાર્ટમેન્ટ	૦૯-૩૦ થી ૧૦-૦૦
(૩) વૃદ્ધાવન એપાર્ટમેન્ટ	૧૦-૧૫ થી ૧૦-૪૫
(૪) જીવરાજપાઈ	૧૧-૩૦ થી ૧૨-૦૦
(૫) સ્વામિનારાયણ પાઈ	૧૨-૧૫ થી ૦૧-૧૫

શનિવારનો દિવસ વહીવટી અને ટેકનીકલ કામગીરી માટે ફાળવેલ છે.

-ઃ ફરતું મહિલા પુસ્તકાલય - સમય પત્રક :-

સોમવાર : આંબાવાડી-સેટેલાઈટ

(૧) સુભદ્રાપુરા	૧ જુલાઈ થી ૩૦ એપ્રિલ સુધી	૧ લી મે થી ૩૦ જૂન સુધી
(૨) સેટેલાઈટ સેન્ટર	૧૧-૩૦ થી ૧૨-૦૦	૦૮-૧૫ થી ૦૮-૪૫
(૩) આશ્રય એપાર્ટમેન્ટ	૧૨-૧૫ થી ૦૧-૦૦	૦૮-૦૦ થી ૦૮-૪૫
(૪) સનવેલી એપાર્ટમેન્ટ	૦૧-૧૫ થી ૦૧-૪૫	૦૮-૫૦ થી ૧૦-૨૦
	૦૨-૦૦ થી ૦૨-૩૦	૧૦-૩૦ થી ૧૧-૦૦
	રિસેસ	રિસેસ
(૫) વિક્રમ નગર	૦૩-૧૫ થી ૦૩-૪૫	૧૧-૪૫ થી ૧૨-૧૫
(૬) કનકકલા	૦૪-૦૦ થી ૦૪-૩૦	૧૨-૩૦ થી ૦૧-૦૦
(૭) સોમેશ્વર કોમ્પ્લેક્સ	૦૪-૪૫ થી ૦૫-૧૫	૦૧-૧૦ થી ૦૧-૪૦

મંગળવાર : વાસણા-જીવરાજપાર્ક

(૧) ચંદ્રનગર	૧૧-૩૦ થી ૧૨-૦૦	૦૮-૧૫ થી ૦૮-૪૫
(૨) ભાવના એપાર્ટમેન્ટ	૧૨-૧૦ થી ૧૨-૪૦	૦૮-૦૦ થી ૦૮-૪૫
(૩) નવાબ પ્લાઝા	૦૧-૦૦ થી ૦૧-૪૫	૦૮-૫૦ થી ૧૦-૨૦
(૪) જીવરાજપાર્ક	૦૨-૦૦ થી ૦૨-૩૦	૧૦-૩૦ થી ૧૧-૦૦
	રિસેસ	રિસેસ
(૫) શેફાલી એપાર્ટમેન્ટ	૦૩-૧૫ થી ૦૩-૪૫	૧૧-૪૫ થી ૧૨-૧૫
(૬) વૃંદાવન વિહાર	૦૪-૦૦ થી ૦૪-૩૦	૧૨-૩૦ થી ૦૧-૦૦
(૭) એસિક એપાર્ટમેન્ટ	૦૪-૪૫ થી ૦૫-૧૫	૦૧-૧૦ થી ૦૧-૪૦

મુધવાર : નવાવાડજ-સોલા

(૧) શિવમ એપાર્ટમેન્ટ	૧૧-૩૦ થી ૧૨-૦૦	૦૮-૧૫ થી ૮-૪૫
(૨) શાસ્ત્રી નગર	૧૨-૧૦ થી ૧૨-૪૦	૦૮-૦૦ થી ૦૮-૪૫
(૩) બંસીધર એપાર્ટમેન્ટ	૦૧-૦૦ થી ૦૧-૩૦	૧૦-૦૦ થી ૧૦-૩૦
(૪) નિર્મલ એપાર્ટમેન્ટ	૦૧-૪૦ થી ૦૨-૩૦	૧૦-૩૫ થી ૧૧-૧૦
	રિસેસ	રિસેસ
(૫) રઘુકુળ એપાર્ટમેન્ટ	૦૩-૩૦ થી ૦૪-૧૫	૧૧-૪૦ થી ૧૨-૧૫
(૬) મોનાપાર્ક	૦૪-૨૫ થી ૦૫-૦૦	૧૨-૩૦ થી ૦૧-૦૦

ગુરુવાર : મણીનગર-નરોડા

(૧) વડીલવાડી	૧૧-૩૦ થી ૧૨-૦૦	૦૮-૧૫ થી ૮-૪૫
(૨) દક્ષિણી સોસાયટી	૧૨-૧૫ થી ૧૨-૪૫	૦૮-૦૦ થી ૦૮-૪૫
(૩) ગોરનો કૂવો	૦૧-૦૦ થી ૦૧-૩૦	૧૦-૦૦ થી ૧૦-૩૦
(૪) હર ભોલેનાથ સોસાયટી	૦૧-૪૫ થી ૦૨-૧૫	૧૦-૩૫ થી ૧૧-૧૦
	રિસેસ	રિસેસ
(૫) કૃષ્ણનગર	૦૩-૧૫ થી ૦૩-૪૫	૧૧-૪૦ થી ૧૨-૧૫
(૬) સૈજપુર બોધા	૦૪-૦૦ થી ૦૪-૩૦	૧૨-૩૦ થી ૦૧-૦૦

શુક્રવાર : સાબરમતી-અસારવા

(૧) ધર્મનગર	૧૧-૩૦ થી ૧૨-૧૦	૦૮-૧૫ થી ૮-૪૫
(૨) મોટેરા સેટેઇમ	૧૨-૧૫ થી ૧૨-૪૫	૦૮-૦૦ થી ૦૮-૪૫
(૩) જવાહરચોક	૦૧-૦૦ થી ૦૧-૩૦	૧૦-૦૦ થી ૧૦-૩૦
(૪) ધનશ્યામનગર	૦૧-૪૫ થી ૦૨-૧૫	૧૦-૩૫ થી ૧૧-૧૦
	રિસેસ	રિસેસ
(૫) અક્ષરધામ	૦૩-૧૫ થી ૦૩-૪૫	૧૧-૪૦ થી ૧૨-૧૫
(૬) પૂજા હોસ્પિટલ	૦૪-૦૦ થી ૦૪-૩૦	૧૨-૩૦ થી ૦૧-૦૦

શનિવારનો દિવસ વહીવટી અને ટેકનીકલ કામગીરી માટે ફાળવેલ છે.

નવા પશ્ચિમ ઝોન - ભાગકો માટેનું ફરતું પુસ્તકાલય

-: સમય પત્રક :-

આ પુસ્તકાલય દર અઠવાડિયે નીચે દર્શાવેલ સમયે જે તે સેવાકેન્દ્રો પર વાયન સેવાઓ આપે છે.

સોમવાર : સરખેજ - વાસણા

(૧) આનંદનગર	૦૮-૩૦ થી ૦૯-૩૦
(૨) નવા વણાજર, ભ્યુ. શાળા પાસે	૦૯-૪૫ થી ૧૦-૩૦

રીસેશ

(૩) સરખેજ મા. શાળા, સરખેજ ગામ	૧૧-૦૦ થી ૧૨-૦૦
(૪) સ્વામિનારાયણ પાર્ક	૧૨-૧૫ થી ૦૧-૩૦

મંગાળવાર : સાબરમતી - મોટેરા

(૧) ન્યુ કલ્યના સોસાયટી	૦૮-૩૦ થી ૦૯-૩૦
(૨) ન્યુ લિટલ ફ્લાવર સ્કુલ પાસે	૦૯-૪૫ થી ૧૦-૪૫

રીસેશ

(૩) સામર્થ્ય ફ્લેટ	૧૨-૦૦ થી ૦૧૦-૦૦
--------------------	-----------------

બુધવાર : થલતેજ - ચાંદલોડીયા

(૧) ભાઈકાકા નગર	૦૮-૩૦ થી ૦૯-૩૦
(૧) ત્રિશલા કુટીર વાટિકા	૦૯-૪૫ થી ૧૦-૪૫
(૨) શિવગણેશ બંગલોઝ ૧-૨	૧૧-૪૫ થી ૧૨-૩૦

રીસેશ

(૩) સોપાન શરણ	૧૨-૪૫ થી ૦૧-૧૫
---------------	----------------

ગુરુવાર : મેમનગર - ભોડકદેવ

(૧) સ્વામી ગુણાતીત સોસાયટી	૦૮-૩૦ થી ૦૯-૩૦
(૨) ગુલાબ ટાવર	૧૦-૦૦ થી ૧૦-૪૫

રીસેશ

(૩) હિલદર્શન એવન્યુ	૧૨-૦૦ થી ૦૧-૦૦
---------------------	----------------

શુક્રવાર : ભોપલ

(૧) ઈન્ડીયા ક્રોલોની, ભોપલ	૦૯-૦૦ થી ૧૦-૦૦
(૨) જલદીપ સોસાયટી	૧૦-૧૫ થી ૧૧-૧૫
(૨) સેફોની ઓપાર્ટમેન્ટ	૧૧-૩૦ થી ૧૨-૦૦

રીસેશ

(૩) અરિહંત બંગલોઝ	૧૨-૩૦ થી ૦૧-૩૦
-------------------	----------------

શનિવારનો દિવસ વહીવટી અને ટેકનીકલ કામગીરી માટે ફાળવેલ છે.

૧૫ : ૧ વાચકો (જનતા)ને માહિતી મળે તે માટે પુસ્તકાલયે અપનાવેલ સાધનો, પદ્ધતિઓ અથવા સવલતો

- મા.જે. પુસ્તકાલય તેમજ પુસ્તકાલય સંચાલિત શાખા પુસ્તકાલયો
- વર્તમાનપત્રો
- નોટિસબોર્ડ
- કચેરીમાં રેકર્ડનું નિરીક્ષણ
- દસ્તાવેજની નકલ મેળવવા નિયત કરેલ રકમ પાના દીઠ રૂ. ૨/- લેવામાં આવે છે.
- મુદ્રિત નિયમ સંગ્રહની પુસ્તિકા રૂ. ૧૦/- રાખવામાં આવે છે.
- પુસ્તકાલયની વેબસાઈટ (સુચિત) www.mjlibraryahd.org / www.mjlibraryahd.com
- પુસ્તકાલયનું પ્રો-એક્ટિવ ડિસ્કલોગર રૂ. ૫૦/- ની કિંમતે તેમજ સી.ડી. રૂ. ૫૦/- ની કિંમતે આપવામાં આવશે.

શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

ટેલીફોન નં. : ૨૬૫૭૮૫૧૩, ૨૬૫૭૮૫૭૮ ટેલીફેક્સ : ૨૬૫૮૬૬૦૮

વેબસાઈટ : www.mjlibraryahd.org

જ્ઞાન મંદિર

સ્થાપના વર્ષ : ૧૫ એપ્રિલ, ૧૯૩૮



'together we shine in the light of knowledge'

'અમદાવાદ શહેર રચિયામણું' એટલે બાધ્ય સ્વરૂપ સુંદર હોવું જોઈએ, એમ નહીં પણ તેનું આંતરિક જીવન પણ સુંદર હોવું જોઈએ, એવાં સરદાર સ્વપ્રો સેવે છે અને હું તેમનો સાથીદાર પણ છું. અમદાવાદ બુદ્ધિ, ધન અને દક્ષતાવાળું શહેર છે... અમદાવાદમાં દરેક ચીજ સુંદર હોવી જોઈએ... આ તકે અમદાવાદ મ્યુનિસિપાલિટીને એક સૂર્યના કરી દઉં કે પુસ્તકાલયનું મકાન એવું બાંધશો કે તેમાં વધારો કરવો હોય ત્યારે થઈ શકે... આ પુસ્તકાલયમાં ભાષણ થાય, શોધખોળ થાય એવી ગોઢવણ કરજો. અમદાવાદ શહેર કારીગરી માટે મશહૂર છે. લાયદ્રેરી માટે કોઇ પગારદાર વિદ્યાન લાયદ્રેરીયન રાખજો કે જે ચોપડીની સંભાળ લે અને પોતે તે સાચવી પણ શકે... પુસ્તકાલયની કમિટીમાં વિદ્યાનની જરૂર નથી. તો તમારા ઠરાવની કોઇ સારી ભારીમાંથી વિદ્યાનનો કમિટીમાં સમાવેશ થાય એવો રસ્તો ખોળજો.

ગાંધીજી

(તા. ૨૧-૮-૧૯૩૩)

સંસ્કાર અને સંયોગો.

આ પુસ્તકાલયને તો એવાં પુસ્તકો એક તપરવી તરફથી મળ્યાં છે કે જેનો તેણે જાતે જ ઉપયોગ કર્યો છે અને જેણે જાતે મેળવીને પસંદ કર્યા હતાં. પુસ્તકો મળવાના સંસ્કાર અને સંયોગો જે આ પુસ્તકાલયને મળ્યા છે તેવાં બીજુ કોઇ પણ લાયદ્રેરીને મળી શક્યા નથી... આ પુસ્તકાલય સંપૂર્ણ બને અને એવી આપણે આશા રાખીએ કે તે એક માનસિક ખીલવણીનો બગીયો બને.

સરદાર વલ્લભભાઈ પટેલ

(તા. ૧૫-૪-૧૯૩૮)

-: પુસ્તકાલયની નોંધપાત્ર સિદ્ધિઓના સોપાન :-

૧. સતત ઉદ્ઘાટન વાચન સેવાઓ.
૨. ગ્રંથાલય શાખાની શાખીય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકાસ પામેલું અધતન અને નમૂનારૂપ સાર્વજનિક પુસ્તકાલય.
૩. મુખ્ય પુસ્તકાલય ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં શાખા પુસ્તકાલયો, વાચનાલયો, બાલભવનો અને ફરતા પુસ્તકાલયોની અવિરત સેવાઓ.
૪. જ્ઞાન અને માહિતીનો અવિરત વહેતો ધોધ, અધતન અને સમૃદ્ધ વાચન સામગ્રીના વૈવિધ્યસભર વૈભવનો સેતુબંધ રચતું પુસ્તકાલય એટલે મા.જે. પુસ્તકાલય.
૫. પુસ્તકાલયના વિવિધ વિભાગોમાં વિવિધ વિષયોના વર્ગીકૃત ઓર્ડરમાં ગોઠવાયેલ અધતન અને સમૃદ્ધ વાચન સામગ્રી.
૬. સાહિત્ય રસિકો, પત્રકારો, લેખકો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, વિષય તજજ્ઞો, સંશોધનકારો, બાળકો, મહિલાઓ, સીનીયર સીટીજનો અને જિજ્ઞાસુઓની માનસિક ખીલવણી કરતી સૌ કોઈની પ્રિય જ્ઞાનભૂમિ.
૭. વિવિધ પ્રવૃત્તિઓથી ધબક્તું પુસ્તકાલય
૮. બાળ વાચકો માટે સંસ્કાર અને ચારિત્ય ઘડતરનું કેન્દ્ર.
૯. બાળકિશોર વિભાગ, મહિલા વિભાગ, રેફરન્સ અને રેડી રેફરન્સ જેવા અનેક વિશિષ્ટ વિભાગો.
૧૦. ઇન્ટરનેટ સર્ફિંગ દ્વારા માહિતી મેળવતા વાચકો.
૧૧. સીડી, વીસીડી, ડીવીડી, ડિજિટલ ફોર્મ માટે ડિજિટાઇઝેશન અને ઈ-લાયબ્રેરી (વર્ચ્યુઅલ લાયબ્રેરી) સર્વિસીઝ.
૧૨. કોમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ.
૧૩. આર્ટ એન્ડ પિક્ચર ગેલેરી સાથે પ્રદર્શન વિભાગની સેવાઓ.
૧૪. જ્ઞાન વિહાર વિદ્યાર્થી - વાચનાલયનો લાભ મેળવતા વિદ્યાર્થીઓ.
૧૫. વાંચન અને સાહિત્યિક - સાંસ્કૃતિક રસને પોષતું સુંદર વાતાવરણ.
૧૬. સાહિત્યિક પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક વિસ્તરણ પ્રવૃત્તિઓ.
૧૭. વર્ષ ૨૦૦૬-૦૭ ના વર્ષને વાંચનપર્વ તરીકે જાહેર કરાતા વાચકોને સભ્યપદ મેળવવા માટે ૫૦% રાહત આપવામાં આવેલી.
૧૮. વર્ષ ૨૦૦૭-૦૮ માં માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શાખા પુસ્તકાલય - મણીનગરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
૧૯. વર્ષ - ૨૦૧૧ માં અ.ભ્યુ. કોર્પોરેશન સંચાલિત તમામ પુસ્તકાલયો, વાચનાલયો અને બાલભવનોની સંઘળી વહીવટી અને સંચાલનની જવાબદારી ગ્રંથપાલ, મા.જે. પુસ્તકાલયને સૌંપવામાં આવેલ છે.
૨૦. ૧૫ એપ્રિલ, ૨૦૧૦ થી મા.જે. પુસ્તકાલયમાં કોમ્પ્યુટરરાઈઝર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો તેમજ તે દિવસથી વાચકોને ડિજિટલ આઈકાર્ડ આપવામાં અને કોમ્પ્યુટરથી બુક ઈશ્યુ કરવામાં આવે છે.
૨૧. શહેરના પ્રજાચ્યકુ ઉપભોક્તાઓ માટે ઓઓઝો માધ્યમથી જુદા જુદા વિષયોની સીડી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
૨૨. માન. મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્તે નવીનીકરણ પામેલ મા.જે. પુસ્તકાલયનું પુનઃલોકાર્પણ કરવામાં આવ્યું.
૨૩. સીનીયર સીટીજનો, મહિલાઓ અને બાળવાચકો માટે લીફટની સુવિધા.
૨૪. પુસ્તકાલયના તમામ ઠરાવો સ્કેનિંગ કરવામાં આવ્યા.
૨૫. ગાંધી સાહિત્યના પુસ્તકોના ડિજિટાઇઝેશનની કામગીરીનો પ્રારંભ.

માહિતી : સંક્ષેપમાં

સ્થાપના, ઈતિહાસ અને વિકાસ :

ઐતિહાસિક દાંડીકૂચના પ્રારંભે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમના ૬૬૫૦ પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર પ્રદર્શિત કર્યો, અમદાવાદ મ્યુનિસિપાલિટીએ પૂજ્ય ભાપુજીના રેલ્વે વિચારને સહૃદ વધાવીને સાર્વજનિક પુસ્તકાલયની રચના અને વિકાસ માટેની સઘળી નાણાંકીય જવાબદારી ઉપાડી લેવાનો કોલ આપ્યો. સરતુ સાહિત્ય કાર્યાલયના સ્વામી અખંડાનંદ તરફથી ૮૮૬૧ પુસ્તકો ભેટમાં મળ્યા. શેઠ શ્રી રસિકલાલ માણેકલાલ તરફથી પુસ્તકાલય ભવન માટે હો. ૫૫,૦૦૦/- ની ઉદાર સખાવત મળી. પૂજ્ય ગાંધીજીના આશીર્વયનો સાથે ૨૧ સપ્ટેમ્બર, ૧૯૩૩ ના રોજ ભવનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. અને ભારતના લોખંડી પુરુષ, ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે ૧૫ અપ્રિલ, ૧૯૩૮ ના રોજ 'શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય' જાહેર જનતાના ઉપયોગ માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું.

દાતાશ્રી રસિકલાલ શેઠ તરફથી પુનઃ સખાવતો મળતા માતાના નામે 'સુભદ્રાબેન માણેકલાલ વાચનાલય' અને પુત્ર કિશોરના નામે 'ભાગકિશોર વિભાગ' ની રચના કરવામાં આવી. ભાગકિશોર વિભાગનો પ્રારંભ મુંબઈ રાજ્યના પંત પ્રધાન મોરારજી દેસાઈના હસ્તે ૧૪ જુન, ૧૯૫૫ ના રોજ થયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પુસ્તકાલય ભવન વિસ્તરણ માટે અનુકૂળ ગ્રંથબંડાર (૧૯૫૦), સંલગ્ન ભવન વિસ્તરણ (૧૯૫૫) અને વધુ મજલાનું બાંધકામ (૨૦૦૧), વર્ષ ૨૦૦૪-૦૫ માં હો. ૨૨.૦૦ લાખની કેપિટલ રકમમાંથી રેફરન્સ એન્ડ રીસર્ચ સેક્શન તથા જ્ઞાનવિહાર - વિધાર્થી વાચનાલય વિભાગ અસ્થિત્વમાં આવ્યો. અ.મ્યુ. કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨-૧૪માં હો. ૫.૩૫ કરોડના ખર્ચે પુસ્તકાલયના નવીનીકરણ અને રીટ્રોફીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી જેમાં વાતાનુકૂલિત ઓડિટોરિયમ અને લીફટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.

શહેરના દુરના અને પરાવિસ્તારોમાં પણ આ પુસ્તકાલયની સેવાઓ ઉપલબ્ધ બની શકે તે હેતુસર વિજયનગર, નરોડા, કાલુપુર, સરસાપુર, હિમતલાલ પાર્ક - આંબાવાડી ખાતે શાખા પુસ્તકાલયો, મણીનગર ખાતે આત્મા સાયંસ એન્ડ ટેકનોલોજી લાયબ્રેરી વાસણા ખાતે ગણ્યાધિપતિ આચાર્યશ્રી સુલોધ સાગર સૂર્યિશ્વરજી મહારાજશ્રી લાયબ્રેરી, વેજલપુર ઓવરલ્યુઝ નીચે ડૉ. શ્યામાપ્રસાદ મુખજી લાયબ્રેરી, અમરાઈવાડી વાચનાલય, વાસણા - ધરણિધર દેરાસર પાછળ વાચનાલય વિકસના રહ્યા છે. ધર આંગણે વાચકોને પુસ્તકો અને વાંચન સેવાઓનો લાભ મળી શકે તે હેતુથી મહિલાઓ માટેનું ફરતું પુસ્તકાલય, ભાગકો માટેનું ફરતું પુસ્તકાલય, નવા પશ્ચિમગ્રેન માટે ભાગકો માટેનું ફરતું પુસ્તકાલય તેમજ મા.જે. પુસ્તકાલય ખાતે ઈન્ટરનેટ સેવાઓ ઉપરાંત ડિજિટલ લાયબ્રેરીની સેવાઓ વિકસની રહી છે. આગામી દિવસોમાં લાયબ્રેરી મોર્ડનાઈઝેશનનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવનાર છે.

પુસ્તકાલય ભવનનું ખાત મુહૂર્ત : રાષ્ટ્રપિતા પૂર્ણ મહાત્મા ગાંધીના હસ્તે તા. ૨૧-૬-૧૯૩૩

પુસ્તકાલય સેવાઓનો પ્રારંભ : ભારતના લોખંડી પુરુષ પૂર્ણ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે તા. ૧૫-૪-૧૯૩૮

બાળ કિશોર વિભાગનો પ્રારંભ : મુંબઈ રાજ્યના પંત પ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે તા. ૧૪-૬-૧૯૫૫

પ્રથમ લાયબ્રેરી કમિટીની રચના : તા. ૩-૮-૧૯૩૩

સંચાલન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્વાચ્છ સંસ્થા અને ટ્રસ્ટ ડીડ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય છે.

અનુદાન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

ટ્રસ્ટ ડીડ : શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ ડીડની નોંધણી ક્રમાંક : ૬૦૮૦ તા. ૨૨-૧૧-૧૯૩૭ મુંબઈ

રાજ્ય ભોભે પલિક ટ્રસ્ટ એકટ નીચે ચેરીટી કમિશનરશ્રીની કચેરીમાં નોંધણી પ્રમાણપત્ર ક્રમાંક : ઈપ્પું અમદાવાદ તા. ૧૬-૬-૧૯૫૩

ઇન્કમટેક્ષ એકટ ૧૯૬૧ સેક્શન ૧૨ એ એ નોંધણી પ્રમાણપત્ર ક્રમાંક DIT (E) / 12AA / 464 / 04-05
તા. ૮-૫-૨૦૦૫

ઇન્કમ ટેક્ષ એકટ ૧૯૬૧ કલમ ૮૦ જુન (૫) નીચે મળેલ પ્રમાણપત્ર

ક્રમાંક DIT (E) / ૮૦ જુન (૫) / ૮૦૭ / ૦૫-૦૬ તા. ૧૧-૧૦-૨૦૦૬

ઇન્કમ ટેક્ષ એકટ ૧૯૬૧ કલમ ૨૫૮ નીચે ટીડીએસ કપાત એક્ઝેમ્પશન (મુક્તિ) પ્રમાણપત્ર

ક્રમાંક ADIT (E) / ૨૫૮ / ૦૫-૦૬ તા. ૨૦-૬-૨૦૦૫

કર્મચારી ગણઃ :

પુસ્તકાલયમાં હાલમાં એસ્ટાડિલશમેન્ટ શિડચુલ પર કર્મચારીઓની કુલ ૧૧૮ જગાઓ મંજૂર થયેલી છે. જે પૈકી ૮૦ જગાઓ ભરાયેલી છે અને ૩૮ જગાઓ ખાલી છે. મોટા ભાગના કર્મચારીઓ વ્યવસાયિક શૈક્ષણિક લાયકાતો અને અનુભવ ધરાવે છે. તમામ કર્મચારીઓ ડ્ર્યુટી લીસ્ટ અનુસાર સોંપવામાં આવેલ કામગીરી અને જવાબદારીઓ નિભાવે છે.

-: પુસ્તકાલય અધિકારીગણ :-

ગ્રંથપાલ	: શ્રી બિપીન જે. મોટી
જુનિયર સહાયક ગ્રંથપાલ	: શ્રીમતી લતાબેન જે. પંડ્યા
ટેકનીકલ આસિસ્ટન્ટ	: શ્રીમતી કલ્પનાબેન સી. ગાંધી
	: શ્રી યોગેશભાઈ જે. પટેલ
ડેડ કલાર્ક	: શ્રી મંજુલાબેન એચ. પટેલ
	શ્રી મયુરબેન એચ. નીનામા

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગ્ર નં. ૧૬

જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદાઓ અને બીજી વિગતો

શેઠ માણોકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ – ૩૮૦ ૦૦૬.

-: પ્રો-એક્ટિવ ડિસ્કલોઝર – ૧૬ :-

માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અન્વયે જાહેર માહિતી અધિકારીઓના નામ, હોદ્દો, સરનામા અને ફોન નંબર

ક્રમ	નામ	હોદ્દો	ફોન નંબર ઓફિસ ફેક્સ નંબર	ઘર	મોબાઇલ નંબર	સરનામું
એપેલેટ ઓથોરિટી						
૧.	ડૉ. બિપીનભાઈ જે. મોટી	ગ્રંથપાલ	૦૭૯-૨૬૪૭૮૪૯૩ ૦૭૯-૨૬૪૭૪૪૮૨ ફેક્સ - ૨૬૪૮૬૮૦૮	-	૮૩૨૮૩૦૩૩૬૬	એમ.જે. લાયબ્રેરી, એલિસબ્રીજ, અમદાવાદ – ૩૮૦ ૦૦૬.
જાહેર માહિતી અધિકારી						
૧.	શ્રી લતાબેન જે. પંડ્યા	જુનિ. સહાયક ગ્રંથપાલ	૦૭૯-૨૬૪૭૪૪૮૨	-	૮૮૧૩૫૨૮૮૨૬	એમ.જે. લાયબ્રેરી, એલિસબ્રીજ, અમદાવાદ – ૩૮૦ ૦૦૬.
મદદનીશ માહિતી અધિકારી						
૧.	શ્રી મગનલાલ જે. ગામેતી	ઓફિસર ઈન્ચાર્જ ઓફ લાયબ્રેરીજ	૦૭૯-૨૬૪૭૪૪૮૨	-	૮૪૨૭૪૫૫૦૫૧	એમ.જે. લાયબ્રેરી, એલિસબ્રીજ, અમદાવાદ – ૩૮૦ ૦૦૬.

વિષય : શેઠ મા.જે. પુસ્તકાલય અને સંચાલિત શાખા પુસ્તકાલયો, ફરતા પુસ્તકાલયોની માહિતી બાબત.

શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

-: માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫ :-

પ્રો-એક્ટીવ ડીસ્કલોગ્ર નં. ૧૭
ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી

શેઠ માણોકલાલ જીઠાભાઈ પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ

એલિસબ્રીજ, અમદાવાદ - ૩૮૦ ૦૦૬.

પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નં. ૧૭

અન્ય ઉપયોગી માહિતી

૧૭ : ૧ લોકોદ્વારા પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો

૧૭ : ૧ નિયત કરેલ સમય મર્યાદામાં જવાબો આપવામાં આવે છે.

૧૭ : ૨ માહિતી મેળવવા અંગે

૧૭ : ૨ અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરવામાં આવેલ પદ્ધતિ અને ફી મુજબ

- અરજીપત્રક (સંદર્ભ માટે ભરેલા અરજી પત્રકની નકલ)

- ફી

- માહિતી મેળવવા માટેની અરજી કઈ રીતે કરવી કેટલીક ટિપ્પણી

- માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે તેવા વખતે નાગરિકના અધિકાર અને અપીલ કરવાની કાર્યવાહી

૧૭ : ૩ જાહેર તંત્ર દ્વારા લોકોને અપાતી તાલીમની બાબતમાં

૧૭ : ૩ - **NIL** -

- તાલીમ કાર્યક્રમનું નામ અને તેનું સંક્ષિપ્ત વર્ણન.

- તાલીમ કાર્યક્રમ / યોજનાની મુદ્દત

- તાલીમનો ઉદ્દેશ

- ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકો (છેલ્લું વર્ષ)

- તાલીમ માટેની પાત્રતા

- તાલીમ માટેની પૂર્વ જરૂરિયાતો (જો કોઈ હોય તો)

- નાણાંકીય તેમજ અન્ય પ્રકારની સહાય (જો કોઈ હોય તો)

- સહાયની વિગત (નાણાંકીય સહાયની રકમ જો હોય તો જણાવો)

- સહાય આપવાની પદ્ધતિ

- અરજી કરવા માટે સંપર્ક માહિતી

- અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)

- અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)